

अक्षरातीत श्री कृष्ण परमात्मने नमः
- (श्री कृष्ण प्रक्षामी धर्म - श्रीमनिजानंद संप्रदाय) -

अष्टादशोऽध्यायः

- (श्री कुलज्ञम् स्वरूप साहेबना) -

- (सरल = स्वभाषार्थम्) -



प्रकाशक -

ज्ञान केन्द्र -

श्री प्राणनाथ महिला मंडण (रजि.)
भोरीवली (प.), मुंबई - ४०० ०८२.

अनुवादक -

श्रीमती नयना भी. साडीवाला,
वीक्षा सितार - डी - ५१४,
महावीर नगर, दादासुकर वाडी,
कांडीवली (प.) मुंबई - ४०००६७



भाष्यकार -

परम पूज्य "वाळी आचार्य"
श्री दीनेन्द्रयालज महाराज

આગ્રહ



તુમ સ્થાને મેરે સાથજુ, જિન રહો વિષે રસ લાગ ।
પાઉં પકડ કહે ઈન્દ્રાવતી, ઉઠ ખડે રહો જાગ ॥
- (પ્રકાશ હિન્દી, પ્ર.૧૭/ચૌ.૨૧).


અર્થ :- હે મારા સુમન સુંદરસાથજુ !

તમે બધા તો બહુ જ બુદ્ધિમાન તેમ જ હોશિયાર તથા
સમજદાર છો. એટલા માટે ઈન્દ્રયજન્ય વિષયોના રસ એવં
સ્થાદમાં લાગીને ન રહો. આપ બધાના ચરણ પકડીને ઈન્દ્રાવતી
કહે છે કે જાગીને ઉઠી, ઉભા થઈ જાઓ, કેમ કે હવે આપણે
(પોતાને) ધામમાં પ્રચાણ કરવાનો સમય આવી ગયો છે.

-પ્રણામ

-શ્રી રાજ-

* મહામતિ શ્રી પ્રાપ્તનાથજી *



શ્રી ધનીજિકો જોશા આતમ દુલાહિન,
ગૂર હુકમ બુધ મૂલ વતન ।
એ પાંચ્યો મિલ ભઈ મહામત,
વેદ કતેઓ પણોંચી સરત ॥

- શ્રીમદ્ વારતમ સાગર

-श्री राज-

अष्टादशोऽद्यायः

-(श्री कुलजम स्वतुप साहेबना)-

-(सरल-स्वभाषार्थ)-

मां-

वि. सं. २०९०
ई. स. २००४
ता. ३-५-०४
प्रथम संस्करण-१०००



विजयाभिनन्द

शाका - ३२९

सेवा - ३।. ३५/-

श्री प्राणनाथ ज्ञान केन्द्र

३, सुंदरधाम, जांभली गली,
बोरीवली (प.), मुंबई - ८२.

फोन : २८९९९ ८७५८.

ઓ ભવે જે પુરી કહાવે, નૌતન જેહજું નામ |
ઉત્તમ યોદે ભવનમાં, જિહાં વાલાનો વિશ્વાસ ||

-ભાગમણિ શ્રી પ્રાણનાથ-

- શ્રદ્ધાંજલિ -

પ્રથમવર સાચાતું ધામધષ્ટી સ્વરૂપ મારા સદગુરુ પરમ -
પુરુષ "વાણી આચાર્ય" પરમહંસ બાબાજી શ્રી લક્ષ્મીદાસ
ભાગરાજાન, જે આથ ધર્મપીઠ ૧૦૮ શ્રી પ નવતનપુરી
ધામ, જામનગરમાં "વાણી પ્રાચાર્ય" ના રૂપમાં સ્થાયી
નિર્માણમાન હતા. તેઓએ ઈ.સ. ૧૯૮૨ માં ઉ મે રવિવાર
ના દિવસે પોતાના પરમપાવન વરિષ્ઠ કરકમલો દ્વારા
નોરીવલી (૫.), મુંબઈ - ૮૨ માં "શ્રી પ્રાણનાથ શાન કેન્દ્ર
મે. દૃષ્ટ" નું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ "શ્રી તારતમ તાલીમ
શાનાશ કેન્દ્ર" શ્રી પ નવતનપુરી ધામની શાખાના રૂપમાં
ના સંસ્થાને પણ સ્થાપિત કરી મને એના સંચાલકના
રૂપમાં સ્થાયી કરી દીધો. મને આધ્યાત્મિક માર્ગ વિષયક
સ્ટડ્યુલું પણ શાન પ્રાપ્ત થયું તથા મારા દ્વારા જે, જેટલું પણ
ધારાજ સેવાનું કાર્ય થઈ રહ્યું છે, તે બધું મારા પરમપૂજ્ય
બાળાજીની જ દ્યા - કૃપા રૂપી દેન છે.

અતઃ હું "શ્રી પ્રાણનાથ શાન કેન્દ્ર" ની તરફથી સમસ્ત
પ્રાસ્ય સુંદરસાથજીના પ્રત્યે "થોઓ, થિએથો જે થીઓ" (સિંગી,
પ્ર. ૭/ચૌ. ૩૩) અર્થાત્ જે જેટલું પણ સેવા - કાર્ય
નું, થઈ રહ્યું છે તથા આગળ થશે, તે બધું પોતાના
સાચાતું ધામધષ્ટી સ્વરૂપ ગુરુપ્રવર પરમપૂજ્ય શ્રી બાબાજી
નો "શ્રદ્ધાંજલિ" ના રૂપમાં ભાવોમિ સભર શ્રદ્ધા સહ
મન સમર્પણ કરું છું.

- દીનદ્યાલ.


- ગુરુપ્રવર -

પરમપૂજ્ય "વાણી આચાર્ય"

પરમહંસ બાબાજી લક્ષ્મીદાસ ભાગરાજજી
(ઇ.સ. ૧૯૦૮/૨૦.૧૧.૨૦૦૨)
નવતનપુરીધામ, જામનગર.



પ્રશાસ



-શ્રી રાજ-

અષ્ટાદશોડધ્યાપ:

-(શ્રી કુલજમ સ્વરૂપ સાહેબના)-

-(સરલ-સ્વભાષાર્થ)-

માં-



-ભાષ્યકાર-

શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્રના સંસ્થાપક
પરમ પૂજ્ય “વાર્ણી આચાર્ય”
શ્રી હીનદ્યાલજી મહારાજ
ઓર્નીવલી (પ.), મુંબઈ - ૬૨.

अक्षरातीत श्री कृष्णाय नमः
(श्री कृष्ण प्रणामी धर्म - श्रीमन्निजननं संप्रदाय)

अष्टादशोऽदयायः

- भाष्यकार-

परमपूज्य “वाणी आचार्य” श्री दीनदयालजु महाराज
संरक्षक - श्री प्राणानाथ ज्ञान केन्द्र ये. ट्रस्ट
बोरीवली (प.), मुंबई - ८२.

प्रकाशक -

१. हिन्दी-नेपाली - श्री प्राणानाथ ज्ञान केन्द्रना संस्थापक
परम पूज्य “वाणी आचार्य”
श्री दीनदयालजु महाराज
बोरीवली (प.), मुंबई - ८२.

२. गुजराती - ज्ञान केन्द्र
C/o श्री प्राणानाथ महिला मंडળ (रजि.)
बोरीवली (प.)
मुंबई-८२.

પુસ્તક પ્રાપ્તિ સ્થાન

૧. આધ ધર્મપીઠ

શ્રી પ નવતનપુરી ધામ,
“જિજડા મંદિર”
આમનગર (ગુજરાત)

૩. શ્રી પ મહામંગલપુરી ધામ

શ્રી કૃષ્ણ પ્રાણામી મોટા મંદિર
સૌચદ્વારા, સુરત - ૩.

૨. શ્રી ૧૦૮ પ્રાણાનાથજી મંદિર

શ્રી પ, પદ્માવતીપુરી ધામ
(મુક્તિપીઠ) પત્રા,
મદ્ય પ્રદેશ - ૪૮૮૦૦૧

૪. શ્રીકૃષ્ણ પ્રાણામી મંદિર,

મંગલધામ, રેલી રોડ,
કાલિભોંગ, દાર્જિલિંગ,
પશ્ચિમ બંગાલ, (ભારત)

૫. શ્રી કૃષ્ણ પ્રાણામી સેવા સમિતિ

(નવતન ધામ)
કેન્દ્રીય કાર્યાલય, ડિલ્લી બજાર,
પોસ્ટ બોક્સ નં. ૨૨૬,
કાઠમાંડૂ - (નેપાલ).

૬. શ્રી કૃષ્ણ પ્રાણામી મંદિર

ડિલ્લી બજાર
કાઠમાંડૂ (નેપાલ)

૭. શ્રી કૃષ્ણ પ્રાણામી મૂલ મિલાવા માનવ મંદિર,

યેડ રોડ, (વરાણી રોડ),
સુરત - ૪.

વિષય સૂચી

ક્ર.	વિષય	પૃષ્ઠ ક્ર.
	અનુભૂમિકા૧....
૧.	વાલો પ્રહરસ ભીનો રંગ વૃદ્ધમાં રમાડતો૪....
૨.	હારે વાલા રલજલાવિયો રામતે રોવરાવિયો૧૦....
૩.	હારે વાલા બંધ પડ્યા બળ હરયા તારે ફુંદડે૧૫....
૪.	કેમ રે ઝંપાચ અંગ એરે ઝાલાઓ૨૨....
૫.	હારે વાલા કારે આપ્યા દુખ૨૭....
૬.	હારે વાલા અગ્નિન ઉંઠે અંગ૩૪....
૭.	ઘોરીડા મા મૂકે તારી ઘૂસરી૪૦....
૮.	વાટડી વિસમી રે સાથીડા બેહદ તણી૪૮....
૯.	મેં ચાહત ન સ્વાંત ઈન ભાંત૫૧....
૧૦.	હુબ મેહેબૂબ કી આસક પ્યાસ લે૭૫....
૧૧.	ચતુર ચૌકસ ચેતન અતિ ચોપસોં૮૨....
૧૨.	નૂર નગન ચેતન ભૂષન રચે૮૮....
૧૩.	મિલી માસૂક કે મોહોલ મેં માનની૯૪....
૧૪.	બાઈરે ગેહેલો વાલો ગેહેલી વાત કરે૧૦૦....
૧૫.	બાઈરે વાત અમારી હવે કોણા સુણો૧૦૫....
૧૬.	પ્રીત પ્રગટ કેમ કીજિએ૧૧૫....
૧૭.	સરુપ સુન્દર સનકૂલ સકોમલ૧૨૫....
૧૮.	પરન આવે તોલે એકને૧૩૩....

* અનુભૂમિકા *

* અનુભૂમિકા *

પરમાદરણીય ધામના સુમન સુંદરસાથજી !

આપ સૌને મારા હાઈક પ્રણામ...

ધામધણી શ્રી રાજજી મહારાજની પ્રેરણા તથા ધામધણી સ્વરૂપ
પરમપૂજ્ય ગુરુપ્રવર મારા સદગુરુ બાબાજી શ્રી લક્ષ્મીદાસજી મહારાજ
(જામનગર)ની અસીમ કૃપા-દચાના પ્રતિફળ મારા જીવનકાલનું
છાસઠમું વર્ધ (ઇ.સ. ૨૦૦૩+૪) બહુ જ મહત્વપૂર્ણ સાલિત થઈ
રહ્યું છે. આ અવધિકાલમાં સ્વસમાજ સેવાર્થ કરેલાં કાર્ય-કલાપોને
આપ બધાની સમક્ષ ઉપસ્થિત કરવાનો સુઅવસર પ્રાપ્ત થવાથી મારું
દિમાગ આસમાનમાં ચઢે તેમાં કોઈ અનોખી અથવા આશ્રયવત્ત વાત
નથી. હા ! હું આ દર્જાનો આદમી નથી. પરંતુ એ અવશ્ય કહીશ કે કોઈ
અદશ્ય પ્રેરણા જ વાસ્તવમાં કાર્ય કરાવે છે. જે કર્તાના રૂપમાં પ્રત્યક્ષ
છે, તેમનું તો એમાં અસ્તિત્વ માત્ર શૂન્ય જ છે. આવી વાતોનો અસોચ્ય
અનુભવ પણ કદાચ સમયનો જ ઈંતજાર કરતાં અટકી રહે છે, કેમ કે ન
મને આવી અધિત્ત આશ હતી અને ન મારા નિજાનંદીય પ્રણામી
સમાજને પણ ક્યારેય આવી કલ્પના જ હતી કે શું ‘કાગડો પણ ચાલે
છે હંસની ચાલ ?’

સમાજની સમક્ષ ઉક્ત પ્રકારના કાર્ય-કલાપોની ઘટના કહી મારા
હૃદયમાં રહેલી સૂક્ષ્મ ભાવનાઓના અંકુરોને પ્રસ્કૃતિત થવાનું જ તો
નથી ? જે રીતે આમ સમાજમાં જન-જનના હોઠો પર એ વાત છિવાતી
રહે છે કે- ‘માનવીની પેશાની જ દિલનો અરીસો તો હોય છે’ની જેમ એ
વાત પણ આ કાર્યનું કારણ બની શકે છે ! અતઃ આ દિલ-દિમાગમાં

* અષ્ટાદશોડદ્વાયઃ *

અચાનક એ વિચાર આવ્યો કે આપણા ધામધારી પ્રદાતા “શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ”ની અંદરથી કંઈ ન કંઈ અંશ ધારીની સંબંધી તે આત્માઓ માટે જ કેમ ન રાખી દઉં, જેના માટે સ્વયં ધારીએ પણ જતાં-જતાં આહ્વાન કર્યું છે કે, ‘જે ચરણો છે તે તો આવસે સહી, પણ પાછળ માટે વાણી કહી’ અર્થાત્ જે પાછળ આવવાવાળા છે, તેમાંથી પણ કેટલાંક તો નિમનાતિનિમન વર્ગના લોકો ગામડાના ખૂણો-ખૂણામાં ‘સૂરે પૂરે ધાયલેં લેવાએ’ અર્થાત્ સંસારની તરફથી ધાયલ અવસ્થામાં આ ખેલની વરચે કહીં ન કહીં, ક્યાંને ક્યાં પડ્યા છે.

અતઃ ઉક્ત પ્રકારના આહ્વાનની અંદર છુપાયેલી પોતાના ધારીની ચિંતાજનક વાતોને સંબંધી લોકો જ ન સમજે, તો કોણ સમજશે ? એટલા માટે મેં વિચાર્યું કે જન-જનના હાથોમાં વિશેષ કરી પોતાના તે ધામના ચારોને ઘર-ઘરમાં આવા કઠિન વિકટ વિષય કેવી રીતે પહોંચાડી શકાય, જેનાથી તે ધાયલ આત્માઓના જીવન “સ્વલ્પમધ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત्” ગીતાના પ્રમાણવત્ત સાર્થકતૂંચ્ય તથા કાર્યાન્વિત (કાર્યરૂપ) સાબિત થઈ શકે ?

ઉક્ત પ્રકારના દ્યેયના કારણો જ મારા દિલ-દિમાગદ્વારા ચુનેલા “અષ્ટાદશ” પ્રકરણોને સરલ-સ્વભાષાર્થ ચુક્ત શબ્દાર્થો તથા ભાવાર્થોની સાથે આ પુસ્તકમાં રાખવામાં આવ્યા છે, જેના ફલસ્વરૂપ પુસ્તકનો જન્મ જ સમાજમાં “અષ્ટાદશોડદ્વાયઃ” નામક સંજ્ઞાથી થયો છે. આ પુસ્તક તે સંબંધી આત્માઓને પોતાના ધની, ધામ તથા પરાત્માના વિષયમાં ધારીના ઈશારાવત્ત પણ સાચો સંદેશ પહોંચાડવામાં સક્ષમ હોય, એવી નૂતન ઈચ્છાની સાથે પ્રકાશનમાં આવેલી છે. આ પુસ્તકના પ્રકાશનથી મારા ચારો-દોસ્તોને ન તો

* અનુભૂમિકા *

નિશ્ચિત સ્થાનની તલાશ કરવી પડશે અને ન રેલ-રુમાલાદિ સામગ્રીઓ
જુટાવાની ચા સંભાળવાની જ ચિંતા કરવી પડશે. એ બધા વગર જ તે
સરલતાથી અદ્યયન તેમ જ મનન કરી શકશે.

તે ઘામના ચારોના પ્રત્યે મારી એ જ હૃદયસ્થ ભાવના છે, જે “લૂલા
પાંગળા” રૂપમાં આ માયાની ચુંગાલમાં નિમ્નનવર્ગની દયનીય
સ્થિતિમાં પડેલાં છે. એની ઉપરાંત આ વિષયમાં વધારે કહેવા ચાહતો
નથી, પરંતુ એટલું તો અવશ્ય કહેવા ચાહીશ કે- ખગ જાને ખગની જ
ભાષા !

અંત્યમાં ઘામસ્થ સુંદરસાથને કરબદ્ધ અનુરોધ કરું છું કે- આપણા
આત્મીય ઘામધણીના શ્રી મુખ વચ્ચનોના અર્થ સહિત તમારા બધાની
સમક્ષ પહોંચાડવાના પિષ્યયમાં તમે મને દોષિત સાબિત કરશો નહિ.
એટલું જ નહિ પણ આ પુસ્તકની ઈજ્જત, રક્ષા તથા જતન કરશો.
અન્ય પુસ્તકોની જેમ એને ગણશો નહિ, આ પુસ્તકમાં પણ શ્રી
મુખવાણી છે, એટલા માટે કહી રહ્યો છું. અતઃ એ પણ દ્યાન રહે કે
આ પુસ્તકની ઈજ્જત અને રક્ષા કરવી જ પોતાના આત્માની ઈજ્જત
અને રક્ષા કરવા સમાન છે, કેમ કે “ધર્મ એવ હતો હન્તિ ધર્મો રક્ષતિ
રક્ષિતः” જે ધર્મની ઈજ્જત તથા રક્ષા કરે છે, તેને જ ધર્મ પણ ઈજ્જત
આપે છે અને તેની જ રક્ષા પણ કરે છે. એટલા માટે ધણીના વચ્ચનોની
ઈજ્જત અને રક્ષા કરવી જ આપણો ધર્મ છે. અતઃ અદ્યયન તથા
મનન કરવું જ આત્માને ઘામધણીની પાસે પહોંચાડવાનું છે. ઈતિ-

સુજોખુ કિં બહુના

લેખક-
દીનદયાલ

* અષ્ટાદશોડદ્યાયઃ *

* અષ્ટાદશોડદ્યાયઃ *

-(શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ “તારતમ સાગર” ગ્રંથાન્તર્ગતના
અઠાર પ્રકરણમાંથી વિરહના ક પ્રકરણાથી શારૂ) જેમ કે -

* વાલો પ્રહરસ ભીનો રંગ વૃષ્ટમાં રમાડતો *

વાલો પ્રહરસ ભીનો રંગ વૃષ્ટમાં રમાડતો,
પાસના રુદ્ધન કરે જલધાર ।
આપ ઓળખાવી અળગો થયો અમથી,
જે કોઈ હુતી તામસિયો સિરદાર ॥૧॥

શબ્દાર્થ :-

વાલો = હે પ્રિયતમ !	રુદ્ધન કરે = રડી રહી છે
પ્રહરસ ભીનો = વિરહ રૂપી	કેમ કે
રસમાં ઓતપ્રોત થઈને	આપ = આપ, સ્વર્યાના
રંગ વૃષ્ટમાં = આનંદમદ વિરહમાં	ઓળખાવી = સાથે આત્મીય સંબંધની
રમાડતો = રમાડી રહ્યા છે અને અહીં	અંતરાણ
પાસના = બાર હજાર બ્રહ્માત્માઓ	કરાવીને
જલધાર = આંસુઓની ધારા વહાવતાં	અમથી = અમે આત્માઓથી અળગો થયો = અલગ અંતર્ધાન થઈ ગયા
	જે કોઈ = જેટલી પણ

* પાલો પ્રહરસ ભીનો રેંગ *

સિરદાર = અગ્રગણ્ય રૂપમાં
તામસીઓ = તામસી સજિયો
હુતી = હતી (ગ્રજ, રાસ તથા

શ્રી પરમધામ આ
ત્રણો લીલાઓમાંથી
અહીં વિશેષ રૂપથી
તડપી રહી છે.

ભાવાર્થ -

હે પ્રિયતમ ! અક્ષરાતીત મૂલ ભિલાવાની અંદર અમારી પરાત્માની ચિત્તવૃત્તિ (સૂરતા) જેલમાં લગાડીને સ્વયં આપ પણ અમારા વિચોગના વિરહમાં ઓતપ્રોત થઈને અમે આત્માઓને પોતાનાથી વિચોગ કરાવીને, આ વિચોગના વિરહમાં અહીં સંસાર રૂપી જેલમાં રમાડી રહ્યા છો. શ્રી પરમધામની વાસના પ્રવિષ્ટ એ સખીઓ, અહીંચા અસહ્ય આપત્તિ-વિપત્તિઓ ભોગવતી રાત-દિવસ આંસુઓની ઘારા વહાવીને તડપી રહી છે. આપ સ્વયં ત્યાં (પરમધામ) થી તારતમ જ્ઞાન - જ્ઞાગૃત જ્ઞાન લાવીને પોતાના સાથને અમારા આત્મીય સંબંધની જાણકારીને દઢ રૂપથી આત્મામાં નિશ્ચિત કરાવીને, બધા પ્રકારથી પ્રત્યક્ષ જ્ઞાન કરાવીને પુનઃ અમારી વરચેથી અંતર્દર્થાનિ થઈ ગયા, શ્રી પરમધામ પાછાં ગયા આ આધાતથી અહીં બારહજાર બ્રહ્માત્માઓમાંથી સર્વાગ્રહણ તામસી સખીઓ અત્યંત જ તડપી રહી છે.

કળકળી કામની વદન વિલખાવિયા,
વિશ્વમાં વરતિયો હા હા કાર ।
ઉનમાદ અટપટા અંગથી ટાળીને,
માનની સહુએ મનાવિયો હાર ॥૨॥

* અષ્ટાદશોડદ્યાયः *

શબ્દાર્થ :-

કામની	= છ હજાર તામસી	અટપટા	= આનંદોદ્વાસ પૂર્ણ
સખિયા		ઉન્માદ	= મસ્તીપન
કળકળી	= રડતાં-વિલાપ કરી રહી છે.	ટાળીને	= નિર્મૂળ થવાથી, હટવાથી
વદન	= શરીરને	માનની	= એ માનનીય તામસી
વિલખાવિયા	= તડપાવી રહી છે	સખિયો	
પિશ્વમાં	= સંસારની વરચ્છે	સહુઅે	= બધાઅે
હા હા કાર	= હાહાકાર	હાર મનાવિયો	= પોતાની હાર
વરતિયો	= ભર્યો છે, તે લોકોમાં		સ્વીકાર કરી લીધી.
અંગથી	= શરીરમાંથી		

ભાવાર્થ -

તે કામની-તામસી સખીઓનું તુદન કરવું, આલાપ-વિલાપ કરતાં ચિલ્લાવું, શરીરને તડપાવીને દવંશ, નષ્ટ-બષ્ટ કરી બરબાદ કરી દેવું, એવી દયનીય અવસ્થા જોવાની તો શું સાંભળી પણ શકાતી નથી. તેની ઊપર એક બાજુ તો સાંસારિક આપત્તિ-વિપત્તિ (અસુરોનો અત્યાચાર) છવાઈ ગયો છે તો બીજુ બાજુ આત્મીય વિયોગની વિરહન્નિ ઉમડી રહી છે. તે ઉભય પક્ષોથી થતાં સંકટ પગેરેના કારણે વિશ્વમાં હાહાકાર મચેલો છે. તે સખિયોના પરાતમ શરીરમાં જે આત્મીય શક્તિની ઉન્માદ, આનંદોલ્લાસ પૂર્ણ ઉમંગ હતી, તે સંપૂર્ણ ઉમંગોને નિર્મૂળ કરી, આપના દ્વારા આ દશામાં પહોંચ્યાના કારણે તે બધી સખિયોએ હવે હાર માની લીધી. બીજુ

* વાલો પ્રહરસ ભીનો રંગ *

કોઈપણ અવસ્થામાં કેવી પણ આપત્તિ - વિપત્તિ આવવા છતાં
પણ હાર નહિ માનવાવાળી તે સખીઓએ અહીં આ બ્રહ્માંડમાં
પોતાની હાર સ્વીકાર કરી લીધી છે.

પતિપ્રતા પળ અંગ થાએ નહીં અળગિયો
ન કાંઈ જરવંતિયો વિના જર ।
પાત્રિયોં પીઉ થકી અમે જે અભાગાદ્યાયો,
રહ્યો અંગ દાગ લગાવન હાર ॥૩॥

શબ્દાર્થ :-

પતિપ્રતા	= પતિપ્રતા સ્ત્રી	અમે	= બાર હજાર
	પોતાના પતિને	અભાગાદ્યાયો	= અભાગનિયો
અળગિયો	= અલગ-વિચોગમાં	પીઉ થકી	= પ્રિયતમથી અલગ
પળ	= એક પળમાત્ર પણ	થઈને આ ખેલમાં	
અંગ	= શરીર ધારણ કરી જુવતા જુવ તો	પાત્રિયો	= પત્રુ સ્ત્રીની સમાન થઈ ગયા.
થાએ નહીં	= રહી શકતી નથી	અંગ દાગ	= પરાત્મ શરીરમાં કલંક
ન કાંઈ	= ન તો કોઈ	લગાવન	= લગાડવાવાળી
જરવંતિયો	= જરવંતી સ્ત્રી જ	હાર	= થઈને પણ
જર વિના	= જર પુરુષ વગર રહી શકે છે.	રહ્યો	= જુવી રહી છે.
જે	= જેમાંથી		

* અષ્ટાદશોડયાયઃ *

ભાવાર્થ -

એ આત્માઓ રાત-દિવસ એ પશ્ચાત્તાપ કરી રહી છે કે “જેમ સત્ય પતિપ્રતા સ્ત્રી પોતાના પતિથી કોઈપણ અવસ્થામાં અલગ થતી નથી, ન તો કોઈ જરૂરંતી સ્ત્રી પોતાના જાર વગર જ રહી શકે છે તે રીતે અમે અક્ષરાતીતની વાસનાઓને અક્ષરાતીત ઘની સંબંધી પતિપ્રતા આત્માઓને અહીં નીચથી પણ નીચ, અભાગણી, દુનભી, કલંકિત, કુલટા સ્ત્રીની સમાન બનાવીને, પરાત્મા શરીર અને નામમાં દાગ લગાડવાળી સાબિત કરીને અમને પણ જીવિત કેમ રાખ્યા? આ પ્રમાણે અમે બ્રહ્માત્માઓ અહીંચા “આપને જીવિત રાખ્યા પર અમે જીવતા છીએ” એમ વિચારીને અસહ્ય વિરહ રૂપી દુઃખમાં પસ્તાઈને તડપી રહી છે.

સ્થારે કરમ એવા કરયાં હતાં કામની,
ધામ માંહે ઘણી આગળ આધાર ।
હવે કાઢો મોહજલ થકી બૂકૃતી કર ગ્રહી,
કહે મહામતિ મારા ભરતાર ॥ ૪ ॥

શબ્દાર્થ :-

પ્રકરણ-૧, ચૌ. ૪.

ધામ માંહે =	શ્રી પરમધામની	કરમ કરયાં =	કર્મ કર્યા હતાં
વરચે		હતાં	= (મારાથી થયેલાં
આગળ =	સામે		કોઈ અક્ષમ્ય
કામની =	તે સખિયોએ		અપરાધ પણ
સ્થારે એવા =	કેવા એવા		ભૂલી જવા)

* વાલો પ્રહરસ ભીનો રંગ *

ધર્મી	= પ્રિયતમના	મોહજલ થકી	= સંસાર
આધાર	= આત્માધાર		સાગરમાંથી
હવે	= હવે તો (દ્યા કૃપા કરીને)	કાઢો	= નિકાલો, બચાવો
બૂકૃતી	= તે કૂબકી મારતી કૂબતી આત્માઓને	મહામતિ	= શ્રી પ્રાણનાથજી
કરત્રણી	= હાથ પકડીને	કહે મારા	= કહે છે, હે મારા
		ભરતાર	= પ્રાણપતિ વદ્ધભ !
		ભાવાર્થ-	

હે સર્વશક્તિમાન ધની ! હે આત્માધાર ધની !! આપની સંબંધી તે ખ્રિસ્તાત્માઓ, કામની સખીઓએ શ્રી અક્ષરાતીત નિજધામમાં આત્માધાર ધનીની આગળ એવા કેવા દુષ્કર્મ, કેવી દુષ્ટતા કરી હતી? જે દુષ્કર્મોના બદલામાં આપ તે આત્માઓને એવી નિર્દ્યતા પૂર્ણ સખત સજા ભોગાવી રહ્યા છે. શ્રી મહામતિ તે આત્માઓના દુઃખ નિવારણ માટે સર્વાગ્રહય રૂપથી પુકાર કરતાં કહી રહ્યા છે કે હે મારા આત્માધાર પ્રિયતમ ! અગાર જો આત્માઓ દ્વારા કોઈ અક્ષમ્ય અપરાધ થયો હોય તો તેને ભૂલી જયો. એ બધું કરવા કરાવવાવાળા સર્વશક્તિમાન સ્વયં આપ જ છો. હવે તો તે આત્માઓ પ્રત્યે દ્યાવંત કૃપા-દર્શિ રાખો અને દુસ્તર મોહસાગર-માયાસાગરમાં ઉલજીને કૂલી રહેલી તે આત્માઓનો દિલ રૂપી હાથ પકડીને આ માયાસાગરમાંથી કાઢી લો અને બચાવી લ્યો.

* હારે વાલા રલજલાવિયો રામતે રોવરાવિયો *

હારે વાલા રલજલાવિયો રામતે રોવરાવિયો
 જૂજવે પરવતેં પાડ્યા રે પુકાર ।
 રણપગડા માંહે રોઈકહે કામની,
 ઘણી વિના ધિક ધિક આરે આકાર ॥ ૧ ॥

શબ્દાર્થ :-

હારેવાલા	= હે પ્રિયતમ, તે	રણપગડામાંહે	= મરુભૂમિ તુલ્ય આ સંસારની વચ્ચે
રલજલાવિયો	= વિલિત્ર ઉલજનોમાં ઉલજાવીને	કામની	= તામસી સખિયો
રામતે	= આ ખેલમાં	રોઈકહે	= રોતાં-રોતાં પુકારી રહી છે, કે
રોવરાવિયો	= રડાવી રહ્યા છો, તે સખીઓને અહીં ઉદ્યપુરની	ઘણી	= આત્માધાર પ્રિયતમ
પચ્ચને	= પર્વતોની વચ્ચે	વિના	= ના વગર
જૂજવે	= અલગ-અલગ	આરે	= એ જીવિત
પુકાર	= આલાપ -વિલાપ	આકાર	= શરીરને
પાડ્યારે	= કરાવી રહ્યા છે.	ધિક-ધિક	= ધિક્કાર-ધિક્કાર છે આ પ્રમાણે ધિક્કારી રહી છે.

* હરે વાલા રલગ્લાવિયો *

ભાવાર્થ-

હે પ્રિયતમ ! આ સંસારિક વ્યવહાર રૂપી જેલમાં આપના દ્વારા ઉલજેલી ધિલિત્ર પ્રકારની ઉલજનોને અમે કેવી રીતે સંભાળીએ? ન અમે તેને છોડી શકીએ અને ન તો તોડી શકીએ એવા અનેકો અસહ્ય રૂપી દુઃખ-કષ્ટ આપત્તિ-વિપત્તિઓ તે આત્માઓના સિર પર નાખીને કેમ તેને રાત-દિન રડાવાની, તડપાવાની રામત કરાવી રહ્યા છો? એ આત્માઓ અહીં સંસારની વચ્ચે ઉદ્યપુરની પહાડીઓના જંગલમાં સ્થિત ગુફાઓ, કંદરાઓ આદિમાં એકલી આલાપ-વિલાપ કરી રહી છે તથા પોતાની ભૂખી અને નંગી જાન હથેલીમાં છુપાવીને તડપી-તડપીને રડી રહી છે. મરુભૂમિ સદશ આ સંસારમાં કામની સજિયો રોતા-રોતાં તડપતી તથા પછતાતી કહી રહી છે કે “આપ -આત્માધાર પ્રાણ પ્રિતમના વગર, આપના વિચોગ રૂપી વિરહમાં જીવિત આ શરીર પર ઘિક્કાર છે” એવું કહેતાં તે વારંવાર સ્વયં પોતાને ઘિક્કારી રહી છે.

વેદના વિષમ રસ લીધાં અમે પ્રહતણાં,
હવે દીન થઈ કહું વારમવાર ।
સુપનમાં દુઃખ સહ્યાં ઘણાં રાસમાં,
જગતાં દુઃખ ન સહેવાએ લગાર ॥ ૨ ॥

શબ્દાર્થ :-

(અહીં, આ બ્રહ્માંડમાં)	પ્રહતણાં = વિરહનો
અમે = અમે સજિયોએ	વિષમ = અથાહ -અગમ્ય

* અષ્ટાદશોડદ્યાયઃ *

વેદના	= પ્રાણાન્ત દુઃખનો	ધારાં	= બહુ જ
રસ લીધાં	= અનુભવ કર્યો, લીધો	દુઃખ સહ્યાં	= જે દુઃખ સહન કર્યા હતા
હવે	= હવે તો	સુપનમાં	= તે સ્વખનનું હતું તો
દીન થઈ	= અતિ દુઃખી થતાં	જાગતાં દુઃખ	= એ જાગ્રતનું
વારંવાર	= બાર-બાર		દુઃખ
કહું	= કહી રહી છે કે ત્યાં-	લગાર	= હવે તનિક (જરા) પણ
રાસમાં	= રાસમંડલમાં પણ	ન સહેવાએ	= સહન કરી શકતા
			નથી.
		ભાવાર્થ-	

અહીંચા આલાપ-વિલાપ (આંકંદ-રૂદન) કરતી એ સભિયો
કહી રહી છે કે “ અમે સભિયોએ વિચોગના અસોચ્ય-અથાહ
પ્રાણાન્ત દુઃખ દર્દનો અનુભવ રૂપી રસ લીધો. એવા અસહ્ય દુઃખને
સહન કરવાની શક્તિ અમે સભિયોમાં નથી. હવે તો અત્યંત
દીનતાપૂર્વક, અસર્મદ્ધ થઈને વિનભૂતાની સાથે વારંવાર અમે એ જ
પ્રાર્થના કરીએ છીએ કે - અમને તે દુઃખોથી છુટકારો અપાવી દો,
અમને લોકોને બચાવી લ્યો. શ્રી વૃન્દાવનના રાસ મંડલમાં
અંતદ્યાનિના સમયે મને જે અસહ્ય દુઃખ થયું હતું, તે તો
આનન્દકારી યોગમાયાના મંડલનું સ્વભિક દુઃખ હતું ત્યારે પણ
અમે સહન ન કરી શક્યા, પરંતુ અહીં તારતમ જ્ઞાન દ્વારા ત્રિકાલ
સંબંધના વિધયમાં પ્રત્યક્ષ રૂપથી જાગ્રત થઈ જવાને લીધે જાગ્રત
અવસ્થાનું એ દુઃખ પ્રતિક્ષણ અસહ્ય થઈને પણ ઉમળતા જઈ રહ્યું

* હારે વાલા રલજલાવિયો *

છે. હે અંતચંભી પ્રાણાધાર ઘની ! હવે એનાથી ઉપરાન્ત આ પ્રાણાન્ત દુઃખ અમારાથી સહન નહિ થઈ શકે. હવે તો અમારા જીવનનો અંત થવામાં કોઈ અશક્યતા નથી.

દંત તરણાં લેઈ તાળણી તલફિયો,
તમે બાહો દાહો દીન દાતાર ।
ખમાએ નહીં કઠણ એવી કસની,
રાખો ચરણ તલે સરણ સાધાર ॥ ૩ ॥

શબ્દાર્થ :-

(હમેશાં એક રસ નેહચલ-)	દચાંવત
તાળણી = તરણાવસ્થાવાળી	પ્રિયતમ, તે
(ચુવતી સજિયો)	સજિયોના
દંત તરણાં = દાંતમાં તૃણ ધાસનો એક તણા	દાહો = આ જલન રૂપી દુઃખ કષ્ટને
ખલું	બાહો = નિર્મૂલ કરી હટાવી દો
લઈ = દબાવીને (પશુવત् થઈને)	એવી કઠણ = આવી કઠણ
તલફિયો = તડપી રહી છે	કસની = દુઃખ, કષ્ટ
તમે = હે ઘની ! આપ	ખમાએ નહીં = સહન કરવામાં અસમર્થ છે
સર્વશક્તિમાન છે	સાધાર = આદરપૂર્વક એને હે
દીન દાતાર = હે દીન દુઃખી પર	પ્રાણાધાર પ્રિયતમ !

* અધ્યાત્મોદ્દ્યાચः *

ચરણ તલે = ચરણોની છત	શરણ = શરણમાં
છાયા રૂપી	રાખો = રાખો

ભાવાર્થ-

શ્રી પરમધામમાં ત્રિકાળમાં એક જ રસમાં ઓતપ્રોત તરણાના
અવસ્થામાં સ્થિત, એ સભિયો અહીંચા જ્ઞાન રૂપી દાંતની નીચે
તૃણ રૂપી શારીરિક ઈચ્છા-તૃષ્ણાને દબાવીને, પસ્તાઈને પોતાની
હાર સ્વીકાર કરી રહી છે તથા પોતાને જ પશુપત્ર ઘોષિત કરી વારંવાર
ધિક્કારતા તડપી રહી છે. હે સર્વ શક્તિમાન પ્રિયતમ ! આપ તો
દીન - દુઃખીઓના, દુઃખભંજન સ્વરૂપ છે, સુખના દાતાર છે. તે
દીન-દુઃખી આત્માઓના પ્રત્યે કરુણામય દર્શિ રાખો. તે
સભિયોના અંતઃકરણાની દુઃખ રૂપી જલન હટાવીને તેમને સુખી
જનાવી દો. જ્યારે એ સભિયો એવા કઠિન દુઃખ, કઠોર કષ્ટ સહન
કરી શકતી નથી, અતઃ અંત્યાવસ્થામાં પણ પહોંચી ગઈ છે. હે
સર્વ શક્તિમાન ! હે સાધાર ઘની ! આપની તે આત્મીય સભિયોના
દુઃખો-કષ્ટોનું નિવારણ કરો અને એમને આદરપૂર્વક આપના ચરણા
રૂપી છત છાયાની શરણ આપીને નિર્ભય ચરણમાં લઈ લ્યો.

હવે હારયા હારયા કહું વાર કેટલી,
રાખો રોતિયોं કરો નિરમલ નાર ।
કહે મહામતિ મેહેબુબ મારા ઘણી,
આ રે અરજ રખે હાંસીમાં ઉતાર ॥૪॥

પ્રકરણ-૨, ચૌ. ૮.

* હંરે પાલા રલગ્લાવિયો *

શાસ્ત્રાર્થ :-

હવે	= હવે	રાખો = ચરણ શરણમાં રાખો
હારયા	= અમે હારી ગયા,	મહામતિ = શ્રી પ્રાણનાથજી
હારયા	= હારી ગયા	કહે = કહે છે
કેટલી વાર	= કેટલીવાર	મારા મેહેબૂબ = હે મારા પ્યારા
કહું	= કહું ?	ધણી = પ્રિયતમ !
	હવે તો-	આ રે અરજ = મારી આ પુકાર
રોતિયોં નાર	= તે રોતી-રડતી સજિયોને	હાંસીમાં = હસવામાં, દિંદળીમાં
નિરમલ કરો	= નિર્મળ-પવિત્ર બનાવીને	રખે ઉતાર = ના ઉડાડો.

ભાવાર્થ -

હે ધામ ધની ! હવે તો અમે અહીં વારે-વારે અમારી હાર સ્વીકાર કરતાં કહી રહ્યા છે કે અમે હારી ગયા ! અમે હારી ગયા !! અમે હારી ગયા !!! આપની જુત થઈ, અમે અમારી હાર કબૂલ કરી. હવે કેટલી વાર હાર કબૂલ કરતાં વારંવાર કહું ? અહીં આ બ્રહ્માંડમાં તે બધી સજિયોએ “અમારી હાર તથા તમારી જુત સ્વીકાર” કરી લીધી છે. હવે તે આત્માઓને આપણો પ્રેમ-વિશવાસ, ધૈર્ય-દફતા આપીને નિર્મળ-પવિત્ર બનાવી દો. તે રડતી આત્માઓને પોતાની શરણમાં રાખી ત્યો. અને તેમનું આકંદ - રૂદ્ધન - તડપને બંધ કરાવી દયો. શ્રી પ્રાણનાથજી દફતાપૂર્વક કહી રહ્યા છે કે “હે મારા પ્યારા પ્રિયતમ ! મારી આ પ્રાર્થના, એ પુકાર હાંસીમાં મત (ન) ઉડાવી દો, એને

* અષ્ટાદશોડદ્વાયઃ *

ઇલ્લગી ન સમજો. અમારી આ પ્રાર્થનાને દ્વાન દઈને, દ્વા કરીને
પોતાના ઇલમાં સ્વીકાર કરો.” આપ તો અંતર્યામી છો, મારા
ઇલની બધી વાતો જાણો છો. તે આત્માઓમાંથી મને અગ્રગણ્ય
બનાવી એમને એવું દુઃખ કેમ આપી રહ્યા છો? તે આત્માઓનું
દુઃખ સહેવું મારાથી જોવાતું નથી. અતઃ તુરેત તે આત્માઓ પર
દ્વા કૃપા કરો અને તેની પર આવેલાં દુઃખોને હટાવી-ખસેડી દો.

* હારે વાલા બંધ પડ્યા બળ હરયા તારે ફંદડે *

હારે વાલા બંધ પડ્યા બળ હરયા તારે ફંદડે,
બંધ વિના જાએ બાંધિયો હાર ।
હંસિયે રોઈએ પડિએ પછતાઈએ,
પણ છૂટે નહીં જે લાગી લાર કતાર ॥૧॥

શબ્દાર્થ :-

હારે વાલા = હે પ્રિયતમ !	કીડીઓની હારની
તારે ફંદડે = આપના માચાવી	(જેમ)
બળ (ફંદ)માં	હાર જાએ = પરવશ થઈને જઈ
બંધ પડ્યા = બંધનમાં પડીને	રહ્યા છે
બળ હરયા = બળ - શક્તિ હરીને	હંસિયે = ચાહે હસું
વિના બંધ = વિના બંધનમાં	રોઈએ = ચાહે રડતાં રહું
બાંધિયો = બાંધીને (ભેડ કતાર,	પડિએ = ચાહે ઉઠતાં ચા

* હારે વાલા બંધ પડ્યા *

પછાડ ખાતા રહું	જે લાર = જે કુળની કહૃતા
પછતાઈએ = રાત-દિવસ	કતાર = અંધ વિશ્વાસરૂપી
પસ્તાતા જ કેમ	કતાર (પંક્તિ)
ન રહું	લાગી = લાગેલી છે
પણ = પરંતુ	ધૂટે નહીં = ધૂટશે જ નહીં.

ભાવાર્થ-

હે પ્રિયતમ ! વિલિન્ન પ્રકારના બંધન રૂપી ફંદ (જળ)માં નાંખીને આપની માચાવી જાને અમારી શક્તિ (બળ) હરીને અમને બળહીન-અશક્ત બનાવી દીધાં છે. એટલા માટે અમે આ અદશ્ય માચાવી બંધનમાં પડી ગયા. એનું બંધન ન જોઈ શકીએ અને ન છૂટી જ શકે. આવા વગર બંધનનાં બંધનમાં પોતાના નખશિખ બાંધીને એ આત્માઓ અંધાધૂંધ બેડ કતાર, કીડી (ચીટી) હારની જેમ માચાના પરવશ થઈ જઈ રહી છે. આ બંધનથી નીકળવાનો તથા ધૂટવાનો કોઈપણ ઉપાય કરો, ચાલતું નથી. આ માચાના વશમાં થઈને કોઈ હસી રહ્યું છે, તો કોઈ રાત દિવસ પસ્તાઈ રહ્યું છે. ચાહે હસો ચા રડો, ચાહે કેટલાં પણ પછાડ ખાએ ચા પસ્તાતા રહે, પરંતુ હે કરતાર ઘની ! એ કઈ પૂર્વજો (પૂરખો) થી ચાલતી આવેલી કુળ કહૃતા રૂપી અંધવિશ્વાસના ભયંકર રૂપી વિકાર લાગેલાં છે. આ રહ્દિવાદની પાછળ અંધાધૂંધીની જબરદસ્ત હારની હાર જઈ રહી છે. એ માચાનો ફંદો આપના સિવાય કોઈ ખોલી શકતું નથી.

* અષ્ટાદશોડદ્વારાયः *

જહેર ચઢ્યું હાથ પાંવ ઝટકતિયો,
સરવા અંગ સાલે કોઈ સકે ન ઉતાર ।
સમરથ સુખ થાએ સાથને તતભિણા,
ગુણવંતા ગારડી જહેર તેહેને તેણી વિધેંઝાર ॥૨॥

શબ્દાર્થ :-

જહેર ચઢ્યું	= ઝેર ચઢી ગયું	તતભિણા	= તરત જ
હાથ પાંવ	= હાથ-પગ	સાથને	= એ આત્માઓને,
ઝટકતિયો	= ઝાટકી રહ્યા છે		જેનાથી
સરવા અંગ	= બધા અંગ-પ્રત્યંગ	સુખ થાએ	= સુખ થશે (તે
સાલે	= ચુલ્હાં- દુઃખદાયી થઈ રહ્યા છે		ઉપાય કરો)
ઉતાર	= આ દુઃખનું નિવારણ કરી	ગુણવંતા ગારડી	= ગુણી વૈદ
કોઈસકેન	= કોઈ શક્યું નથી	તેહેને જહેર	= ચઢેલું ઝેર કેવી
સમરથ	= હે શક્તિશાલી પ્રિયતમ !		રીતે ઝાડે, ઉતારે છે
		તેણી વિધે	= તે રીતથી
		ઝાર	= ઝાડી દો, ઉતારી દો.

ભાવાર્થ -

હે ઘામધણી ! ઝેરીલા ફંદ - માચાનું ઝેર ચઢવાને કારણો એ
સભિયો બેહોશ થઈને હાથ - પગ ઝાટકી રહી છે. એ આત્માઓના
સર્વાંગમાં ઝેરીલા ઝેર બ્યાખ થઈને પ્રાણાન્ત દુઃખ આપી રહ્યા છે.

* હરી વાલા બંધ પડ્યા *

આપ વિના કોઈપણ આ જહેર (તેર) ને ઉતારી શકતું નથી હે
સામર્થ્યશાળી ઘની ! દયા કરો, કૃપા-દર્શિ નાંખો અને એવો કોઈ
ઉપાય કરો, જેનાથી કે એ આત્માઓ તુરંત સુખી થઈ જાય, હે
ગુણવંત, હે પરોપકારી દયાવંત ! જેરીલા સર્પો વીંછીઓના તેર
ઉતારવાના ગારડી - વૈધ જેવી રીતે ચઢેલું તેર ઉતારે છે, તેવી રીતે
આપ એ આત્માઓ પર ચઢેલું માયાવી તેરને ઉતારી દો તથા એને
તરત જ સુખી બનાવી દો.

માહેંઘે દાવાનલ દસો દિસા,
હવે વલણ વાસનાઓથી નિવાર ।
હુકમ મોહથી નજર કરો નિરમલ,
મૂલ મુખ દાખી વૃષ અંગથી વિસાર ॥૩॥

શબ્દાર્થ :-

એ આત્માઓને-		
માંહે = અંદરો અંદર	દિલમાંથી	
દસો દિસ = દસે દિશાઓથી	વલણ = ઉઠતી-વધતી	(બળણ) અન્નિ
દાવાનલ ઘખે = દાવાનળ	નિવાર = નિર્મૂળ કરી હટાવી દો	(આ માયાને)
નામક અનિન		
ઊઠી રહી છે	હુકમ મોહથી = માયાને હુકમ	
હવે = હવે તો		કરો, તે લોકોના
વાસનાઓથી = તે આત્માઓના		પ્રતિ

* અષ્ટાદશોડયાયઃ *

નિરમલ	= પવિત્ર કળણામય	દાખી	= દર્શન કરાવી, તે
નજર કરો	= દર્જિ રાખો		લોકોના
મૂલ મુખ	= મૂલ પરાત્મા	પ્રહ	= વિરહાન્ત્ર-જલન
	સ્વરૂપના	વિસાર	= હટાવી દો

અંગથી = દિલથી જ

ભાવાર્થ-

એ આત્માઓના અંતઃકરણ રૂપી દિલમાં દસો દિશાઓથી માચાવી ઝેર રૂપી દાવાનળ અન્તિ (દાવાન્તિ) લપટોની (જવાળા) જેમ ઘગઘગતી ઉમડી (જલી) રહી છે. હવે આપની વાસનાઓના આ પલ-પલ વધીને ભલકતા - ઉમડતા ઝેરીલા અન્તિ રૂપી દુઃખને નિર્મૂળ કરીને ખસેડી - હટાવી લ્યો. હે સમરથશાળી ધની ! એ અભાગિણા - દુઃખી સખીઓના પ્રત્યે નિર્મલ કળણામય દર્જિ કરો અને પોતાની માચાને હુકમ કરો તથા એમને માચાથી છોડાવી દયો. મૂલ શ્રી પરમધામની અંદર સ્થિત પરાત્મા સ્વરૂપના મુખ તથા પરાત્મા સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરાવીને એ આત્માઓના અંતઃકરણ રૂપી અંગમાંથી વિરહ રૂપી દુઃખને નિર્મૂળ કરી હટાવી દયો.

ઇલ મોટે અમને અતિ છેતરયાં,

થયા હૈયા ઝાંકરા ન સહેવાએ માર ।

ક હે મહામતિ મારા ઘણી ઘામના,

રાખો રોતિયોં સુખ દેઓને કરાર ॥૪॥

પ્રકરણ-૩, ચૌ. ૧૨.

* હરે વાલા બંધ પડ્યા *

શબ્દાર્થ :-

મોટે છલ	= અથાહ વિશાલ માયાવી છળના	ન સહેવાએ = હવે સહન થઈ શકતું નથી.
અમને	= અમે આત્માઓને	મહામતિ શ્રી = પ્રાણનાથજી
અતિ છેતરયાં	= અત્યંત ઠગ્યા	કહે = કહી રહ્યા છે
	ઘોખા આપ્યા	મારા ધામના = હે મારા ધામના
	અમારા-	ધણી = ધણી !
હૈયા	= હૃદય અંતઃકરણ	રોતિયો = એ રોતી (રડતી)
જાંગરા	= ચાળણાની જેમ છિદ્રજ છિદ્ર	આત્માઓને
થયા	= હુઅા (થયા)	સુખ કરાર = સુખશાંતિ
માર	= ઘક્કો	દેઓને = આપો અને રાખો = ચરણ-શરણામાં રાખો.

ભાવાર્થ -

હે ધની ! આપના વિલિન્ન ફંદો (જાળ)માં ઉલજાવવાવાળા માયાવી છળનો કોઈ પાર નથી. એને આપની અપાર શક્તિ અને નેસુમાર છળકપટથી અમને લોકોને વિલિન્ન પ્રકારથી ઠગ્યા, અપાર ઘોખા આપ્યા અને ઘક્કા ખવડાવ્યા એનો માર સહન કરતાં - કરતાં અમારા હૃદય ચાળણાની સદશ છિદ્રો જેવા થઈ ગયા. હવે તો આ હૃદયમાં માયાવી ઘક્કા તથા માર સહન કરવાની શક્તિ પણ રહી નથી. શ્રી પ્રાણનાથજી કહે છે કે હે મારા ધામના ધની ! હે પ્રાણાધાર પ્રિયતમ !! આપની શરણાર્થી રડતી, પસ્તાતી

* અષ્ટાદશોડધ્યાયः *

આત્માઓ પર દયા કરી તેમને સુખશાંતિ આપો અને આપના
ચરણ-શરણમાં રાખો, અમને હુકરાવો નહિ.

* કેમ રે ઝંપાય અંગ એ રે જાળાઓ *

કેમ રે ઝંપાય અંગ એ રે જાળાઓ,
વળી વળી વાદ્યો વિષ વિસ્તાર।
જીવ સિર જુલમ કીધો ફરી ફરી,
હઠિયો હરામી અંગ ઈંગ્રી વિકાર ॥૧॥

શબ્દાર્થ :-

કેમ રે = ક્યા મ્રકારથી	જીવ સિર = જીવાત્માના સિર પર
અંગ એ રે = દિલની એવી એ	જુલમ કીધો = આધાત કરી
જાળાઓ = જવાળાઓ-પીડાઓ	રહ્યા છે તે
ઝંપાય = શાંત કરન, નિભાઉં?	આત્માઓના
વળી વળી = વારંવાર	અંગ ઈંગ્રી = શરીરના અંગ- ઈંગ્રિયો વગેરે પર
વિષ વિસ્તાર = વિષનો વિસ્તાર	હઠિયો હરામી = હઠી, હરામી
વાદ્યો = વધી રહ્યો, ફેલાઈ રહ્યો છે.	(કામ, કોઘ, લોભ વગેરે)
ફરી ફરી = આ પ્રમાણે પ્રતિક્ષણા વારે-વારે	વિકાર = વિકાર ઘેરી રહ્યા છે.

* કેમ રે ઝંપાય અંગ *

ભાવાર્થ-

હે ધની ! એ કામ, કોધ લોભાદિ માચાવી વિકારોની જવાળાઓ કેવી રીતે શાંત કરું ? એ આત્માઓમાં આ વિષ (ઝર) નો વિસ્તાર બેસુમાર રૂપથી પ્રતિક્ષણ વારંવાર ઉમડી-ઉમડીને વધી રહ્યો છે. એ જીવાત્માની ઉપર બેસીને વારંવાર જન્મ-મરણ રૂપી જુલમ મચાવી રહ્યા છે. આપના દ્વારા નાંખેલા આ માચાવી વિકાર રૂપી ફંદ જ્ઞાન દ્વારા કેટલાં પણ સમજાવવાથી-બુઝાવવાથી પણ છૂટતાં જ નથી. એ મોટા જબરદસ્ત હરામ તથા ઉત્ત્ર હઠીલા છે. એ જિદ્ધી થઈને એ આત્માઓના અંગ-ઇન્ડ્રિય વગેરેમાં વ્યાપક થઈ મનમાની શાસન જમાવી રહ્યા છે. એ આત્માઓને તે પોતાની મનમાનીથી નચાવી રહ્યા છે.

ઝંપ ઝાળાઓ હવે ઉઠતિયો અંગથી,
સુખ શીતલ અંગ અંગનાને ઠાર ।
બાળ્યાં વળી વળી એ મન એ કબૂદ્ધે,
કમસીલ કામ કાં કરાવ્યાં કરતાર ॥૨॥

શબ્દાર્થ :-

હવે અંગથી = હવે દિલથી	ઓલવી નાંખો
ઉઠતિયો = એ ઉમડીને વધી	અંગનાને = તે અંગનાઓને
રહી છે	અંગ = અંતઃકરણ રૂપી દિલમાં
ઝંપ ઝાળાઓ = અન્નિની	સુખ શીતલ = સુખમય
જવાળા	શીતલતાનો

* અષ્ટાદશોડદ્વારાયः *

ઠાર	= સંચાર કરી દો	છે
એ કબુદ્ધો	= એવી કુબુદ્ધિવાળા	કરતાર = હે કરતાર ધની ! એ
એ મન	= આ ધૂર્ત મનને	આત્માઓ દ્રારા
વળી વળી	= વારંવાર	કાં કમસીલ = કેમ નીચ-પતિત
બાળ્યાં	= ભટકાવી બાળી રહ્યા	કામ કરાય્યાં = કર્મ કરાવી રહ્યા છો.

ભાવાર્થ-

હે ધામ-ધની ! એ આત્માઓના અંતઃકરણ રૂપી અંગમાંથી રાત-દિવસ, કાણ-પ્રતિક્ષણ ઉમડતી આ નશવર ઈચ્છા-તૃષ્ણા રૂપી અન્નિને હવે તો શાંત કરાવી દયો. આ અન્નિને નિર્મૂળ-શાંત કરી એ આત્માઓના અંગ રૂપી દિલમાં ધૈર્ય, શાંતી, દફ, પ્રેમ તથા વિશ્વાસ ભરી દો તેમ જ આત્મીય સુખશાંતી દ્રારા સંતોષ કરાવી દો. આ પ્રમાણે કુબુદ્ધ બ્રસ્ત મન કુપદાર્થોના પ્રતિ વિલિન્ન ઈચ્છા-તૃષ્ણા વધારીને વારંવાર એ આત્માઓને બાળી રહ્યા છે. હે કરતાર ! હે પ્રિયતમ !! આપ તે આત્માઓના ધૂર્ત મનના ચક્કરમાં પરવશ કરાવીને એને આવા નીચ, પતિતમાં પણ પતિત (પાપી) કર્મ કેમ કરાવી રહ્યા છો. અહીંના એવા કર્મો દ્રારા એમની પરાત્મા પર કલંક લગાવી રહ્યા છો.

ગુણ પખ ઈંદ્રી વસ કરી ઈબલીસને,
 અંગના અંગ થાયો દઈ દિક્કાર ।
 અરથ ઉપલે એમ કહેવાઈયો વાસના,
 ફરી એણો વચને દીધી ફિટકાર ॥૩॥

* કેમ રે ઝંપાય અંગ *

શાબ્દાર્થ :-

ઇબલીસને	= દુષ્ટ મનને	દઈને
ગુણ પખ દ્વારી	= ગુણ સહિત ઇન્ડ્રિયોને	એમ = આ પ્રમાણે કહેવાઈઓ = પ્રસિદ્ધ કરાવી
વસ કરી	= વશમાં કરીને	દીઘાં
અંગના અંગ	= આપની અંગનાઓના	ઉપલે અરથ = કેમ વ્યગાંથી કરી રહ્યા છો ?
અંગમાં		એણો વચને = એ વચનોએ પણ
ધિક્કાર	= ધિક્કાર રૂપી કલંક	ફરી = પુનઃ (ફરીથી)
થાચ્યો	= સ્થાપિત	ફિટકાર = તુચ્છ-ધિક્કાર જ
દઈ	= કરી દીઘાં	દીધી = આપ્યા
વાસના	= ભ્રઘણવાસના નામ	

ભાવાર્થ -

હે મિયતમ ! આ દુષ્ટ મને એ અબોધ (અણાસમજુ) સખિયોના ગુણા, અંગ, ઇન્ડ્રિય વગેરે બધા અંગોને પોતાના વશમાં કરી લીધાં છે તથા તેમને મદમસ્ત બંદરની જેમ નચાવતા તેઓથી નીચ -પતિત કુકૃત્ય કરાવી રહ્યા છે. એ મન એવા કર્મ કરાવીને આપની અંગનાઓને પરાત્મા શરીર તથા નામ પર અસહ્ય આધાત -કલંક રૂપી ધિક્કાર સ્થાપિત કરાવી રહ્યા છે. એક બાજુ તો આપના જ વેદ, શાસ્ત્ર, પુરાણાદિમાં અમે સખિયોને “અક્ષરાતીતની ભ્રઘણવાસના” કહીને સંસારમાં પ્રસિદ્ધ કરી દીઘાં તથા બીજુ બાજુ ધૂર્ત મનને પરવશ કરાવીને એ જ વાસનાઓ દ્વારા એવા નીચ -પતિત

* અષ્ટાદશોડધ્યાયः *

કર્મ કરાવીને એને જ “હંસીના” પાત્ર બનાવી દીધાં. એ બધું આપ
કેમ કરાવી રહ્યા છો? હે પ્રિયતમ! વાસના નામ રાજીને આપ
અમારી પર વ્યગાર્થ કરી રહ્યા છો? એવા વ્યગાર્થ, તે પણ દુનિયાની
વરચે? એ “વાસના” શબ્દ અમે-આત્માઓને લાગેલાં કાંટાના
ધા પર નમક (મીહું) મરચાંનું કામ કરી રહ્યું છે. તુચ્છ-દિક્કાર આપી
રહ્યું છે. એ બધું કરવા -કરાવવાવાળા આપ જ છો. એ મને અત્યંત
અસહ્ય થઈ રહ્યું છે.

માંહેલે માયને જોપે જ્યારે જોઈએ,
ત્યારે દીધી તારણી તન તણકાર ।
કળ કળી મહામતિ કહે હો કંથજુ,
એવા સ્યારે દોસ અંગનાઓના આધાર ॥૪॥

પ્રકરણ-૪, ચૌ. ૧૫.

શબ્દાર્થ :-

માંહેલે = વાસ્તવિક, આન્તરિક	તણકાર = દિક્કાર -લાંછન જ
માયને = અર્થ	દીધી = આખું
જોપે = સારી રીતે નિહારકરીને	કળ કળી = આધાત પૂર્ણ તડપન
જ્યારે = જ્યારે	સહિત કલ-કલીને
જોઈએ = વિચાર કરીને જોઉં છુ	મહામતિ = શ્રી પ્રાણનાથજુ
ત્યારે = ત્યારે પણ	કહે = કહે છે
તારણી = એ વાસનાઓના	હો કંથજુ = હે પ્રાણપતિ !
તન = શરીરને	આધાર = હે પ્રાણાધાર ઘની !!

* હરે વાલા કરે આપ્યાં દુઃખ *

અંગનાઓના	= એ અંગનાઓથી	દોસ	= દોષ-ગલતી થઈ ગઈ
એવા	= એવી		છે જેના માટે તેમને
સ્થારે	= કેવી		દોષી માની રહ્યા છે.

ભાવાર્થ-

હે ઘની ! વાસના શબ્દનો વાસ્તવિક અર્થ અર્થાત् શાસ્ત્ર-પુરાણોમાં કરેલી તેમની સિફ્ફત - બડાઈની સાથે તેઓના કર્મોની તુલના કરી વિચાર વિયેકપૂર્વક જુઓ તો પણ, અમે આત્માઓના શરીર અને કલંક-લાંછન પૂર્ણ ધિક્કારને જ પાત્ર છે, એવું પામીએ છીએ. કોઈપણ પ્રકારથી અમે ધિક્કાર - લાંછનથી મુક્ત જોઈશકતા નથી. આ પ્રમાણે આધાત પૂર્ણ દર્દનાક પુકાર કરતાં મહામતિ શ્રી પ્રાણનાથજી કહે છે કે હે આત્માધાર પ્રાણપતિ ! આપની એ અંગનાઓએ એવી કેવી ગલતી કરી હતી, જેના માટે આપ તેઓને એવા દોષી બનાવીને નિર્દર્ઘતાપૂર્ણ અવસ્થામાં આ રીતે તડપાવી રહ્યા છો. એ આત્માઓ પર દયા કરો, કૃપા કરો.

* હારે વાલા કારે આપ્યાં દુઃખ *

હારે વાલા કારે આપ્યાં દુઃખ અમને અનઘટતાં,
પ્રાધ લગાડી વિદ્ય વિદ્યના વિકાર ।
વિમુખ કીધાં રસ દઈપ્રહ અવલા,
સાથ સનમુખ માંહે થયા રે ધિક્કાર ॥૧॥

* અષ્ટાદશોડદ્વાયઃ *

શબ્દાર્થ :-

હરેપાલા =	હે ધામ ધની	દઈ =	આપીને
વિદ્ય વિદ્યના =	અનેકો પ્રકારના	અવલા =	અમે અબલા
પ્રાધ =	જન્મસિદ્ધ વ્યાધિ		આત્માઓને ઉલ્ટા
	રોગ રૂપી	વિમુખ કીધાં =	વિમુખ કરી દીધાં
વિકાર લગાડી =	વિકાર લગાવીને	માંહે =	શ્રી પરમદ્યામમાં
અમને =	અમે આત્માઓને	સાથ સનમુખ =	બાર હજારની
અનંદટતાં =	અસોચ્ય, ન		સામે
	ઘટવાવાળા	રે દિક્કાર =	એવા દિક્કારને
દુઃખ =	એવું દુઃખ		પાત્ર
કરે આપ્યાં =	કેમ આપ્યું ?	થયા =	બની ગયા.
પ્રછ રસ =	ધિરહાનુભવ રૂપી રસ		

ભાવાર્થ -

હે પ્રાણાધાર પ્રિયતમ ! અમે આત્માઓના એવા અસહ્ય કહી ન ઘટવાવાનું દુઃખ કેમ આપ્યું ? આપ જેવા સર્વશક્તિમાન સ્વરૂપની સંબંધી અંગનાઓ આ સંસારની વચ્ચે તડપી - તડપીને દુઃખ ભોગવે, તે પણ આ જૂઠા - નશવર દુનિયાની સામે ! તો અહીં બેઇજજતી કોની થશે ? કલંક કોની પર લાગશે ? આપ પર જ ને ! શાસ્ત્ર પુરાણાદિમાં ‘મારી ભ્રહાંગનાઓ’ પણ કહેવી, પુનઃ એવા જન્મસિદ્ધ વ્યાધિ રોગ રૂપી વિકાર અમારી પર લગાવીને અમારાથી અનેકો પ્રકારના તુચ્છ-નીચ કર્મ પણ કરાવવાના !! આવી અચોગ્ય અવસ્થામાં પહોંચાડીને અમને લોકોને દુઃખ આપવું, શું આપને

* હરે વાલા કરે આપ્યાં દુઃખ *

શોલે છે? એક તો એ અબુધ સભિયોને શ્રી પરમધામથી વિમુખ
કરાવીને અહીં લઈ આવ્યાં, ફરી અહીં પણ વિયોગના જ્ઞાન કરાવીને
તેમને વિરહમાં તડપાવી રહ્યા છો! જ્યારે અમે શ્રી પરમધામમાં
આવીશું, ત્યારે આપના તથા બાર હજારની સામે અમે બધા કેવા
'ધિક્કારના હાંસીના પાત્ર' હોઈશું અમને લોકોને આપ એવા નીચ-
તુછ સાબિત-સિદ્ધ કેમ કરી રહ્યા છો?

અનેક રામત બીજુ હતી અતિ ઘણી,
સુપને અગ્રાહ ઠેલે સંસાર ।
ઉધડી આંખ દિન ઉગતે એહો છલે,
જાગતાં જનમ રૂડા ખોયા આવાર ॥૨॥

શબ્દાર્થ :-

અતિ ઘણી =	વિલિન્ન પ્રકારની	દિન ઉગતે =	દિવસ ઉગતાં જ
બીજુ અનેક =	બીજુ પણ અનેકો	એહો છલે =	આ ઘૂર્ટ છલમાં
રામત હતી =	ખેલ રૂપી રામતો	આંખ ઉધડી =	આંખો ખુલી ગઈ
	હતી, કેમ એવા-		પરંતુ
અગ્રાહ =	ધૃષિત અથોગ્ય	જાગતાં રૂડા =	જાગ્રતના
	લાગવાવાળા		અમૂલ્ય જીવન
સુપને સંસાર =	સ્વખનમય	જનમ આવાર =	આ વખતનું
	સંસારમાં		પણ
ઠેલે =	ઘકેલી દીઘાં, મોકલી	ખોયા =	નિરર્થક જઈ રહ્યું છે,
	આખ્યા		નાચ થઈ રહ્યું છે.

ભાવાર્થ-

હે ધની ! શ્રી પરમધામમાં બીજા પણ અનેકો પ્રકારની રામતો (ખેલ) પણ તો હતી. અમે આત્માઓ દ્વારા ખેલ જોવા માટે માંગવાથી શું આપને અમને અબુધ અબળા આત્માઓને એવા અચોગ્ય, નશ્વર, અસહ્ય, દુઃખદાચી સ્વચ્છિક સંસારમાં આ રીતે ખેલ જોવા માટે કેમ ઘકેલી દેવા હતાં (હડસેલી દીધાં), ઠીક છે ! આપને મોકલી દીધાં, અમે આવી ગયા. અમે લોકો એક મસ્તીમાં મસ્ત થઈને સુખી તો હતા. તેમાં પણ આપને આ સંસાર રૂપી ખેલમાં ત્યાંનું જ્ઞાન લાવીને અમને પણ જ્ઞાન આપ્યું અને જ્ઞાન રૂપી દિન ઉગાડીને અમારી આંખો પણ ખોલી દીધી અને અમે પણ બધું જ જોઈ લીધું, જાણી લીધું. આપના તારતમ જ્ઞાને જ એ બધું જ કરાવ્યું, પરંતુ જાણતાં- જાણતાં, જોતાં-જોતાં પણ આપ જાગ્રત આત્માઓના આ વખત (ફેરા)નું ઉત્તમાતિઉત્તમ અમૂલ્ય જીવન પણ ડાન, કોધ, લોભાદિ વિકારોના વશમાં થઈને-કરાવીને અમને નિરર્થક ધિક્કાર પૂર્ણ પસ્તાવાનું પાત્ર બનાવી રહ્યા છો.

સનમુખ તમસું પ્રહરસ તમતણાં,
 કાં ન કીધાં જાળી બાળી અંગાર ।
 ત્રાહિ ત્રાહિ એ વાતો થાસે ઘેર સાથમાં,
 સેહેસું કેમ દાગ જે લાગ્યા આકાર ॥૩॥

* હારે વાલા કારે આપ્યાં દુઃખ *

શબ્દાર્થ :-

એના બદલામાં અમે	એ ત્રાહિ ત્રાહિ = એ હાચ-હાચ
આત્માઓને	પસ્તાવાના
તમસું = આપની સાથે	વિષયની
તમતણાં = આપની	વાતો = વાતો
સનમુખ = પાસે જ સામે રાખીને	સાથમાં = બાર હજારની વચ્ચે
પ્રહુરસ = વિરહ રસની અભિમાં	ઘેરથાસે = શ્રી ધામમાં થશે
સળગાવી	જે આકાર = અહીંચાના
જાળી બાળી = જલાવી-બાળીને	પરાત્માના નામ
અંગાર = અંગાર બનાવી દેવા	અને શારીરમાં જે
હતા ન !	દાગ લાગ્યા = કલંક લાગ્યો છે
કાં ન કીધાં = કેમ નહીં બનાવ્યાં ?	કેમ સેહેસું = તે કેવી રીતે સહન કરી શકીશું ?

ભાવાર્થ -

હે પ્રિયતમ ! આ સ્વર્ણમય અગ્રાહ સંસારની વચ્ચે મોકલીને અમારી આવી દશા બનાવતાં પહેલાં આપની જ સામે આપની પાસે રાખીને આપના વિયોગની વિરહઅભિમાં બાળીને અમને અંગાર ભર્મીભૂત કેમ ન કરી દીધાં ? અમારા લોકો પ્રત્યે મનમાં નિદર્યતાપૂર્ણ કપટ રાખીને, આ સંસારમાં હડસેલી, ન મરી શકીએ, ન જીવી શકીએ એવી અવસ્થામાં પહોંચાડીને કેમ તડપાવી રહ્યા છો? શ્વાસપ્રશ્વાસથી પસ્તાવાના પ્રતિક્ષલ નીકળવાવાળી હાચ-હાચ વિષયની દુઃખપ્રદ વાતો, જ્યારે અમે શ્રી પરમધામ મૂલ ભિલાવામાં ઉઠીશું ત્યારે આપની

* અધ્યાદશોડદ્યાયः *

સાથે અવશ્ય થશે. આપને અમે અબૂધ આત્માઓના પ્રત્યે કપટભાવ રાખીને સંસારમાં ઘકેલીને, આ શરીર દ્વારા અમારા પરાત્મ શરીર અને નામ પર જે લાંછન-કલંક લગાવ્યું છે, તે અમે આત્માઓને અસહ્ય થઈ રહ્યું છે. અમે લોકો આ જધન્ય કલંકને સહન કરી શકીશું નહિ.

પ્રહ્થી વિષોડી દુઃખ દીધાં વિસમાં,
અહેનિસ નિષ્પાસા અંગ ઉઠે કટકાર ।
દુઃખ ભંજન સહુ વિદ્ય પીઉજુ સમરથ,
કહે મહામતિ સુખ દેણા સિણાગાર ॥૪॥

પ્રકરણ-૫, ચૌ. ૨૦.

શબ્દાર્થ :-

અમે આત્માઓને-		પ્રત્યંગના દુક્કા-દુક્કા
વિષોડી = એક તો વિયોગ કરાવ્યો		થઈ જાય છે)
પ્રહ્થી = બીજુ વિરહન્નિ નાંખીને	ઉઠે	= ઊઠી રહી છે
વિસમાં = અસહનીય		સમરથ = હે સામર્થ્યશાળી
દુઃખ = દુઃખ		પીઉજુ = ઘની !
દીધા = આપ્યું, આપી રહ્યા છો		સહુ વિદ્ય = આપ બધી રીતે
અહેનિસ = રાત-દિવસ	દુઃખ = દુઃખોનું નિવારણ	
નિષ્પાસા = શ્વાસ પ્રતિશ્વાસ	ભંજન = કરવાવાળા સ્વરૂપ છો	
અંગ = શરીરના અંગ પ્રત્યંગમાં	મહામતિ = શ્રી મહામતિ સ્વરૂપ	
કટકાર = વેદના-પીડા (જેમ કે	કહે = કહે છે તે આત્માઓને	

* હંરે વાલા કરે આપ્યાં દુઃખ *

સુખ સિણાગાર = સુખનો
સિણાગાર
કરીને

| દેણા = દો (તે આત્માઓને
સુખી કરી દો).

ભાવાર્થ-

હે સર્વશક્તિમાન ધની ! એક તો અમે અબજા આત્માઓને
આપને સંસારમાં હડસેલીને સ્વયંથી પણ અમારો વિચોગ કરાવી
દીધો. જીજું આ સંસારની વચ્ચે આવીને અમારી પરાત્માની સંપૂર્ણ
જ્ઞાનાકારી આપીને, દૃઢ સંબંધ નિશ્ચિત કરાવીને સ્વયં અંતર્દ્યાનન
થઈ ગયા અને અમને અસહ્ય વિરહમાં જકડીને વિરહગ્રસ્ત બનાવી
દીધાં. આપના દ્વારા પરાત્મ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન કરાવી દેવાનું
કારણ જ અમે આત્માઓ રાત-દિવસ શ્વાસોચ્છાસમાં વિરહ-
વેદનાને હરા-ભરા (તાજા) દુઃખ દ્વારા સર્વાંગોને ટુકડા-ટુકડા કરીને
નાંખી દીધી છે. હે સામર્થ્યશાળી ધની ! આ વિરહ-વેદના રૂપ
આત્મીય રોગનું સર્વ રૂપેણ નિવારણ કરવામાં આપ જ
સામર્થ્યશાળી છે. આ પ્રમાણે શ્રી પ્રાણનાથજી વિનયપૂર્વક પુકાર,
કરતાં કહી રહ્યા છે કે હે સર્વ સામર્થ્યશાળી પ્રિયતમ ! આપની એ
અબૂધ અંગના ઓને દુઃખદાયી સિંગાર જેવા કે ઈચ્છા-તૃષ્ણા, કામ,
કોધ, લોલ વગેરે છોડાવીને ઈચ્છા-તૃષ્ણા, શીલ-સંતોષ, ઘોર્ય,
સહનશીલતા, પ્રેમ, વિશ્વાસ, સેવાદિ જેવા આત્મીય ગુણાચુક્ત
સિંગાર કરાવીને એમણે સુખી બનાવી દો.

* અધ્યાદશોડદ્યાયः *

* હારે વાલા અગિન ઉઠે અંગ *

હારે વાલા અગિન ઉઠે અંગ એ રે અમારકે,
વિમુખ વિપરીત કમર કસી હથિયાર ।
સ્વાદ ચઢ્યા સ્વામ દ્રોહી સંગ્રામે,
વિકટ બંકા અમે કીધાં આ સાધાર ॥૧॥

શબ્દાર્થ :-

હારે વાલા =	હે પ્યારા પ્રિયતમ	અમે	= અમે આત્માઓને
	અમે આત્માઓએ-		તે સમય -
વિપરીત =	નિર્દર્શિતાપૂર્વક	આસાધાર	= નિરણતર
હથિયાર =	માચાવી હથિયાર	સ્વામ દ્રોહી	= આત્માધાર
	લઈને		સ્વામીની સાથે
વિમુખ =	આપનાથી વિપરીત		શત્રુતાના ભાવ
	થઈને, લડાઈ કરવા		સહિત
માટે		સંગ્રામે	= લડાઈ કરવામાં જ
કમર કસી =	કમર કસવાને લીધે	સ્વાદ ચઢ્યા =	સ્વાદ લાગ્યો
એ રે અમારકે =	એ અમારા		ત્યારે આપની
અંગ =	અંતઃકરણ રૂપી દિલમાં		સાથે-
	પસ્તાવાની	વિકટ બંકા =	દુષ્કર્મી, માચાવી
અગિન ઉઠે =	અન્ન ઉઠી રહી છે		ટેઢાપન
		કીધાં	= કચર્યા.

* હારે વાલા અગિન ઉઠે *

ભાવાર્થ-

હે પ્રાણ પ્યારા પ્રિયતમ ! અમારા અંતકરણ રૂપી દિલમાં
વિરહ રૂપી પરસ્તાવાની અભિ ઉત્તરોત્તર તીવ્ર ગતિથી ઉમડી રહી
છે. તે સમયે તો અમે આત્માઓએ કુલુદ્ધિચુક્ત મનને પરવશ થઈને
કામ, કોધ, ઈજ્યા-દ્રેષ, તર્ક-વિતર્ક રૂપી માયાવી હથિયાર ઘારણ
કરી આપની સાથે ટિંદ (જિદ્દી) કરવા તથા દ્રંદ કરવા માટે કમર
કસી. આપનો સદૃપુદેશ સાંભળીને પણ વિચાર કર્યા વગર વિષેક
હીન બનીને નિર્દર્ઘતાની સાથે આપના પ્રતિકૂળ બનીને, દુષ્કર્મ
કરીને વિમુખ થયા. તે સમય અમે આત્માઓને આપની વિરુદ્ધ
થઈને લડાઈ-જઘડા કરવાનો જ સ્વાદ લાગ્યો હતો, આ ધૂર્ત કુલુદ્ધિ
ચુક્ત મને અમને બધાને સ્વામી દ્રોહી બનાવીને ઠગી લીધાં. એટલા
માટે શરૂથી અંત સુધી અમે નિરંતર લડાઈ-જઘડા કરતાં આપના
પ્રતિકૂળ બન્યા તથા બેમુખી બનાવીને, ટેઢો રસ્તો અપનાવીને
અમે અનેક કુર્કમ કર્યા તે સમય અમે આત્માઓ આપના મનોનુકૂળ
રસ્તા પર ન ચાલી શક્યા.

કુકરમ કસાબ જુદ્ધ કે કરાવિયાં,
પલીત ઈબલીસ અમ માંહે બેસાર ।
જાગતાં ટિંન કે દેખતાં અમને છેતરયાં,
ખરાને ખરાબ એ ખલક ખુઆર ॥૨॥

શાબ્દાર્થ :-

અમ માંહે = અમારા દિલમાં | પલીત = દુષ્ટ-ધૂર્ત, નીચ, પતીત

* અષ્ટાદશોડદ્યાયः *

ઈબલીસ = મન	કેટિન = કેટલાય દિવસ
બે સાર = બેસાડી, એના વશમાં	અમને છેતરયાં = અમે
કરાવીને, આપની	આત્માઓને
સાથે જ-	જગ્યા
કસાબ = ખરાબથી પણ ખરાબ	ખરાને = અમે સત્ય
કુકરમ = દુષ્કર્મવાળા	આત્માઓને પણ,
કે જુદ્ધ = કદ્ધિયો ઝઘડા	એ ખરાબ ખલક = આ જૂઢી
કરાવિયાં = કરાવ્યાં.	દુનિયાની
આ ધૂર્ત મને -	વરચે
જાગતાં = જાણતાં હોવા છતાં	ખુઅાર = દવંસ કરી દીધાં
દેખતાં = પણ, જોતાં હોવા	(જૂઢાની સાથે પણ,
છતાં પણ	નીચાની સાથે અમારી
	તુલના કરી.)

ભાવાર્થ-

અહીંચા અમે આત્માઓ માચાવી, માચા - મોહ ગ્રસ્ત, મનની પરવશ થઈને આપની સાથે જ ખરાબ જિદ્ધીપન લઈને લડાઈકરવા લાગ્યા. આપને અમને કેટલાં સમજાવ્યા-બતાવ્યાં, અમારી પર દચા કરીને અમને આત્મીય સહુપદેશ આપ્યો. અમારા આત્મીય સંબંધની ઓળખાણ કરાવી દીધી. તે બધા ઉપકારોના બદલામાં પણ અમે તેમના પ્રતિ અપકાર કરવાનું ચૂક્યા નહિ. આપની સાથે કેટલીય વાર લડાઈઓ કરી, હે પ્રિયતમ ! આપને અમે આત્માઓને “કુતરાની પુંછ” સદશ ગુણાયુક્ત અને શરીરમાં નાંખીને અમારા

* હારે વાલા અગ્નિન ઉઠે *

અંતઃકરણમાં એવા ધૂર્ત-પતિત મનને નાંખીને તથા તે મનના પશમાં કરાવીને અમારાથી આવા-આવા કર્મ કરાવ્યા. હે ઘામ ઘની ! પ્રત્યક્ષ તારતમ જ્ઞાન દ્વારા જ્ઞાનતાં હોવા છતાં પણ, સમજતાં હોવા છતાં પણ અમને મુર્જ તથા આંઘળા બનાવીને આ મને આપની જ સામે અમને કેવી રીતે ઠગી લીધાં ? આપની સાથે લડાઈ કરાવી દીધી. અહીંચા સુધી કે આપની અમે સાચી-સત્ય વાસનાઓને આ ઝૂઠી દુનિયાની વરચે ઝૂઠાથી પણ ઝૂઠા, નીચ - પતિત સાબિત કરી દીધાં.

ઓળખી તમને અમે જુદ્ધ કીધાં તમસું,
મન ચિત બુધ મોહ ગ્રહી અહંકાર ।
અ વિમુખ વાતો મોટે મેળે વંચાસે,
મળસે જુથ જિહાં બારે હજાર ॥ 3 ॥

શબ્દાર્થ :-

આ ધૂર્ત મનના પશમાં થઈને-	એ સમયે-
તમને અમે = આપને અમે	મન ચિત = આ મન ચિત તથા
આત્માઓએ	બુધ મોહ = બુદ્ધિએ માચાવી
ઓળખી = ઓળખતાં પણ	અહંકાર = અભિમાન
તમસું = આપની સાથે	ગ્રહી = ગ્રહણ કરી, અપનાવીને
જુદ્ધ કીધાં = લડાઈ-જઘડા કરી	(આપથી વિમુખ કરાવી
લીધાં	દીધાં)

હવે-

જિહાં = જે સ્થાન (શ્રી મૂલ
મિલાવા) માં

જૂથ = ચાણીસ જૂથોમાં સ્થિત

બારે હજાર = બાર હજાર
આત્માઓ

મળસે = એકઢી જાગ્રત થશે

જ્યારે, તે સમયે

મોટે મેળે = તે વિશાલ
મિલાવામાં

મેળામાં

એ વિમુખ = એ વિમુખી દ્રોહપૂર્ણ
વાતો = વાતો

વંચાસે = થશે, ખુલશે જ

ભાવાર્થ-

હે આત્માધાર પદ્ધત ! અમે આત્માઓએ તે સમયે આપની
પ્રત્યક્ષ ઓળખાણ કરી તો પણ આપની સાથે લડાઈ કરી. આ
માયાએ અમારા મન, ચિત્ત, બુદ્ધિ વગેરે બધા અંગોને પોતાની
વશમાં કરી લીધાં હતા. અમારા એ મન, ચિત્ત, બુદ્ધિએ માયા રૂપ
થઈને, અહૂંકાર - અભિમાન ગ્રહણ કરી, આપની સાથે પણ દ્રેષ્ણ
રાખીને વિપરીત વિદ્રોહ કરીને જ છોડ્યા. જ્યારે શ્રી પરમધામના
વિશાલ મૂલ મિલાવામાં અમે ચાણીસ જૂથ અર્થાત् બાર હજાર
આત્માઓના મિલન થશે ચા બાર હજાર આત્માઓ એક સાથ
જાગ્રત થશે, ત્યારે આપની સાથે વિપરીત ચાલચલન, વ્યવહાર
વિષયક બધી વાતો ખુલશે ચા જાહેર થશે. તે સમયે અમારી અન્ય
જૂથ સંખ્યાની વર્ણે શું દશા થશે ?



* હારે વાલા અગ્નિન ઉઠે *

કહે મહામતિ હું ગાઉં મોહોરે થઈ
 પણ વિમુખ વિદ્યો વીતી સહુ માંહે નરનાર ।
 ધામ માંહે ઘણી ઊંચું કેમ જોઈસું,
 પોહોંચસે પંવાડા પર આતમ મોંકાર ॥૪॥

પ્રકરણ-૬, ચૌ. ૨૪.

શાબ્દાર્થ :-

મહામતિ = શ્રી પ્રાણનાથજી	ધણી = હે ધામ ધની પ્રિયતમ !
કહે = કહી રહ્યા છે કે	ધામ માંહે = શ્રી પરમધામમાં
હું મોહોરે = હું સર્વગ્રાહય ઇપમાં	અમે ઊંચું = અમે આત્માઓ
થઈગાઉં = થઈને કહી રહી છું	સિર ઊંચું કરી
પણ = પરંતુ	આપની સામે
સહુ નરનાર = દુનિયાના બધા	કેમ જોઈસું = કેવી રીતે જોઈ
વિમુખ વિદ્યો = લોકો લોકો વિમુખી પુનાજીવાળો	શકીશું,
માંહે વીતી = ની વચ્ચે વીતેલી	કેમ કે-
(મારા દ્વારા પણ બેમુખી થવામાં કોઈ કસર બાકી રહી નથી.)	પંવાડા = આ જેલની સંપૂર્ણ વાતો
	પરઆતમ મોંકાર = પરાત્માની વચ્ચે
	પોહોંચસે = પહોંચશો, થશો.

ભાવાર્થ -

શ્રી મહામતિ સ્વરૂપ બ્રહ્માત્માઓ માટે સર્વગ્રાહય ઇપમાં
પ્રાર્થના કરતાં કહે છે કે હે ધામધની ! હે પ્રાણાધાર પ્રિયતમ !! હું

* અષ્ટાદશોડયાયઃ *

સર્વગ્રાહય થઈને આપને કહી રહી છું, પરંતુ કેવળ તે સજિયોની જ એવી દશા નહોતી થઈ. મારાથી પણ વિમુખ -બેમુખ થવામાં કોઈ કસર બાકી રહી નથી. અમે બધી આત્માઓને એવા માચાની જાળ (ફંદ)માં નાખીને જૂઠી દુનિયાની આગળ આપને પતિત-ડ્રોહી બનાવી દીધાં. આપને જેવા બનાવ્યા તેવા જ અમે બની ગયા. હવે હે પ્રિયતમ ! જ્યારે અમે બ્રહ્માત્માઓ શ્રી પરમધામમાં ઊઠીશું, ત્યારે સિર (માથું) ઊંચુ કરીને આપને અમારું મોઢું (મુખ) કેવી રીતે જેઈ શકશું? ‘પાએ ન રેહેંદી તિર જેતરી’ અર્થાત् જ્યાં જેલની તલ જેટલી પણ વાતો છૂપતી નથી, ત્યાં અમારી શું દશા થશે ? પુનઃ આપ અમને ચાહે જેટલી નીચ, જેટલી પતિત સાખિત કરવા ચાહો, કરો, અમે છે તો આપની જ ને ! હવે જે થયું તે થયું. એ બધું આપનું કર્યુ કારબ્યું છે. હવે તો અમને લોકોને આપણી શરણામાં લઈલ્યો. એ દુઃખી આત્માઓ પર દયા કરો અને તેની પર આવેલી આપત્તિ-વિપત્તિઓથી તુરંત એમની રક્ષા કરો.

* ઘોરીડા મા મૂકે તારી ધૂંસરી *

રાગ ધન્યાસરી

ઘોરીડા મા મૂકે તારી ધૂંસરી,
વાટડી વિસ્મી ગાડી ભાર ભરી ।
ઘોરીડા આરેં મારે રે, હરે તુંને ગોઘે ઘણો।
તું તાં નાકે નથાણો રે, તું તાં બંધ બંધાણો,
ગુણ આપણો રે ॥૧॥

* ધોરીડા મા મૂકે તારી *

શબ્દાર્થ :-

ધોરીડા	= હે બેલ !	અહીદાર લોહખંડ
તારી ધુંસરી	= તારી જિભેદારી	લગાવેલું એક શસ્ત્ર).
	ઝૂપી જુવા	મારે રે લુંટે = ચુભાવે છે.
મા મૂકે	= મત (ના) છોડ	હાં રે = અરે ! ફરી તને ઉપરથી
વિસ્મી વાટડી	= અત્યંત કઠીન રસ્તો છે	ઘણો ગોધે = બહુ જ ગોદતાં (ચુભાવે) પણ છે
ભાર ભરી	= વજનદાર ભારી સામાન ભરેલી	તૂતાં નાકે = તારું તો નાક પણ
ગાડી	= ગાડી છે	નથાળો રે = છેટેલું છે
ધોરીડા	= હે બેલ !	આપણો ગુણ = પોતાના જ ગુણો દ્વારા
આ રે	= અહીદાર ભાલા જેવા શસ્ત્રોથી (લાકડાની આગળના ભાગમાં	તૂંતાં બંધ = તૂં તો તે બંધનમાં, બંધાળો રે = બંધાયેલો જ છે.

ભાવાર્થ-

શ્રી પ્રાણનાથજી ઈન્દ્રજાવતી દર્જામાં થઈને સદ્ગુરુની આજા
સામે રાખીને પોતાની આત્માની તુલના સરખામણી બેલગાડીની
સાથે કરતાં કહી રહ્યા છે કે હે ઈન્દ્રજાવતી આત્મા ! પોતાની કબૂલ
કરેલી વચ્ચે ઝૂપી જુવા ઝૂપી જિભેદારી ના છોડ (મત મુકર). જે
તારતમ ઝૂપી ગાડીની જિભેદારી ઝપ જુવાં તારા કંધા (ખલા) પર
છે, તે ગાડીમાં બાર હજાર આત્મા ઝૂપી સામાન ભરેલો છે. હવે આ
ગાડીને ખેંચીને તને નિશ્ચિત સ્થાન પર પહોંચાડવું જ પડશે. હે

* અષ્ટાદશોડદ્યાય : *

ઇન્દ્રાવતી આત્મા ! તને અનેકોવાર તર્ક-વિતર્કવાળા કદુ વચન રૂપી આર (ભાલા) થી ચુલ્બાવે છે અને ઉલ્ટા-સીધા નિંદનીય વચન રૂપી દંડાથી તારી પર અનેકોવાર વાર કરે છે, પ્રહાર કરે છે. તને વિલિન્ન પ્રકારના દર્દ જેવા લોખંડ (લોહા) ની ગોદનથી ગૂંઘવાથી થતાં દર્દ ચા આરાથી ચુલ્બાવતાં થવાવાળી પીડા વગેરે સહન કરવા પડે છે. તારી નાકમાં નકેલ (નથ) બાંધેલી છે તને નકેલ (નથ) નાંખીને સાંધેલો છે તું પોતાના જ પરોપકારત્મક - વિશ્વાસનીય ગુણો દ્વારા બંધનમાં બંધાઈ ગયો છે હવે તારી પાસે ઓની મુસીબત સમજુને, ગભરાઈ-નર્વસ થઈને જલ્દ બાજુમાં પોતાની જુવાંથી મુક્રવાનો મોકો નથી.

ઘોરીડા અવાચક થયો રે ,
 મુખથી ન બોલાએ ।
 કલને વેલું રે ઘોરીડા,
 ઉપટ ઊંચાણો સ્વાસ મા ખાએ ॥૨॥

શાબ્દાર્થ :-

ઘોરીડા મુખથી	= હે બેલ !	ઘોરીડા	= હે બેલ !
મુખથી		ઉપટ ઊંચાણો	= કઠિન ચઢાવદાર
ન બોલાએ	= બોલી શકતો નથી		ઊંચા માર્ગ અને
અવાચક	= અબોલ, ગૂંગા-મૂંગા॥	કલને	= દળદળ-કાદવ કીચડથી
સદશ			ભરેલો અને
થયો રે	= થઈ ગયો છે ન !	વેલું રે	= બાલુયુક્ત (રસ્તો છે)

* ધોરીડા મા મૂકે તારી *

સ્વાસ મા ખાએ = વચમાં

શાસ - દમ

લેવા પણ

નહીં મળશે.

ભાવાર્થ-

હે ઈન્દ્રાવતી આત્મા ! શ્રી સદગુરુજીની સામે વચનબદ્ધ થવાને (હોવાને) લીધે તારું મોકું બંધ થઈ ગયું છે તું અબોલ સદશ થઈ ગઈ છે. આ દુઃખને પ્રગટ કરવા માટે તારી પાસે કોઈ સ્થાન નથી. જો, તે આત્માઓના પ્રેમ રહિત નિરસ અંતઃકરણ બાલુચુક્ત મરુભૂમિના સમાન છે અને ત્યાં વિલિત્ર શાંકા - ઉપશાંકાઓ તથા અજ્ઞાનચુક્ત દળદળ - કીચડ ભરેલું છે. એવા દિલવાળી આત્માઓના અન્તઃકરણમાં ‘અનન્ય પરા-પ્રેમ લક્ષણા ભક્તિમય’ પ્રેમ પ્રગટ કરાવીને તેમના દિલ પરમાત્માના ચરણમાં બાંધવા જેવા વિકટ-ચઢાવદાર રસ્તા તારે પાર કરવાના છે. એના સિવાય તારી પાસે અન્ય કોઈ રસ્તો નથી આ કારણ તે આત્માઓના દિલ રૂપી રસ્તા પર તારતમ જ્ઞાન રૂપી ગાડીને પ્રયેશ કરાવીને તે આત્માઓને પરાલક્તિ માર્ગના ઊંચા રસ્તા પાર કરવાના છે. નિરંતર તારતમ બોધ કરાવવા, સમજાવવામાં પ્રયત્નશીલ ન થઈને અગર જો તમે પચ્યે નિરાશા રૂપી શાસ લેવા લાગશો તો તમારી ગાડી દળદળ - કીચડમાં ફસાઈને અન્ય માર્ગ પર ચાલવા લાગશો અને તમારા માટે ઊંચા રસ્તા પાર કરવા અસંભવ થઈ જશે.



* અષ્ટાદશોડયાચ : *

ઘોરીડા ઘણું દોહેલું છે રે,
કીધાં ભોગવે રે ।
તારે કાંધે ચાંદી રે,
દુખડાં સહે રે ॥ ૩ ॥

શાબ્દાર્થ :-

ઘોરીડા	= હે બેલ !	તારે કાંધે	= તારા કંધા (ખબા)
ઘણું દોહેલું	= અત્યંત જ કઠિન		પર
છે રે	= છે	ચાંદી રે	= ચાંદા પડી ગયા છે
કીધાં	= પોતે-સ્વયં કરેલાં	દુખડાં	= અસહ્ય દુઃખ થવાથી કર્મોના ફળ
ભોગવે રે	= ભોગવવા જ પડે છે.	પણ	
		સહે રે	= સહન કરવા જ પડશે.

ભાવાર્થ -

હે આત્મા ! સાવધાન રહે !! અસાધ્ય દુર્ગમ રસ્તો છે. પૂર્વ
જન્મોમાં કરેલાં કર્મોના ફળ ભોગવવાં જ પડે છે 'ગહના કર્મણો
ગતિઃ' અર્થાત् પૂર્વ કર્મોની ગતિ ગહનશીલ થાય છે, ભોગવવી જ
પડે છે. જો ! તારા છાતી રૂપી કંધા પર ગહેરો (ઉંડો) ઘા સદશ
ચાંદા પડી ગયા છે. બંને પક્ષો હિન્દુ તથા મુસ્લિમના સિદ્ધાંતવાદી
વિદ્રાન ધર્મ સિદ્ધાંતના વિષયમાં જન્મથી લઈને મરાણ સુધી લડતાં
જ રહ્યા છે. જન્મેલાં ધર્મનું પાલન કરવાને લીધે વારે વારે જન્મ લઈ
રહ્યા છીએ. તારા તો સૃજિના જન્મથી પણ પહેલાં અને પ્રલયના
પછી જ રક્ષા કરવાવાળા આવાગમન રહિત ધર્મ હોવાને લીધે આ

* ધોરીડા મા મુકે તારી *

જન્મમાં જ તને પૂર્વના બધા કૃત કર્માદિં ભોગવીને પૂરા કરવા જ પડશે. એ ધર્મ અપરા ન થઈને, આવાગમન રહિત અનન્ય પરાપ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ ચાલવાવાળા ધર્મના કારણે અપરા ભક્તિવાળાઓના અનેકો ઈચ્છાજન્ય કટુ વચન રૂપી બાળ સહન કરતાં-કરતાં તારી છાતીમાં ઊંડા પડેલાં ધાવ સદશ ચાંદા પણ પડી ગયા છે. છાતી ગેંડાની છાલ જેવી વજ પણ બની ગઈ છે. લેક્કિન તે મૂર્ખ લોકોના અજ્ઞાનજન્ય કટુ તીક્ષ્ણા વચન રૂપી બાળના દુઃખ તારે સહન કરવા જ પડશે. એ પણ તો તારા પૂર્વ સંચિત કર્મ જ છે, જે તારે સહન કરવા અને ભોગવવા જ પડશે.

ધોરીડા ઘણું જાય રે ઉજાણી,
દ્રોડાદ્રોડ તું આવે ।
દયા રે વિના રે,
બેઠા મારડી પડાવે ॥ ૪ ॥

શબ્દાર્થ :-

ધોરીડા	= હે બેલ !	આવે	= આવવું જ પડશે.
ઘણું	= અત્યંત ઊંચા હોવાને લીધે	બેઠા	= ગાડીમાં બેઠેલાં
ઉજાણી	= કુમાર્ગની તરફ	રે	= તે (ગાડીવાન)
જાય રે	= જઈ રહ્યો છે	દયા વિના રે	= નિર્દ્દયી છે
તું	= તને	મારડી	= લાકડીનો સોટો
દ્રોડાદ્રોડ	= દોડતાં-કૂદતાં	પડાવે	= લગાવે છે.

* અષ્ટાદશોડદ્વારાયઃ *

ભાવાર્થ-

હે આત્મા ! અક્ષરાતીત પ્રેમાસ્પદ પરમાત્માના ચરણમાં પહોંચાડવાવાળા ‘અનન્ય પરા દશા પ્રેમ લક્ષણા ભક્તિ’ ના ઊંચા માર્ગ અત્યંત જ કહિન છે . આ ગાડીમાં ગહનતાચુક્ત બહુમૂલ્ય બ્રહ્માત્મા રૂપી સામાન ભરેલો છે. આવી ગહન-વજનદાર ગાડી કુમાર્ગની તરફ ન જતી રહે એ વાતનું દ્યાન રાખતા સતર્ક રહે. સાવધાની પૂર્વક તારે સીધા લક્ષ્યની તરફ નિશાના રાખીને એક સુર (તરફ) થઈ દોડ લગાવી ઊંચા રસ્તા પાર કરીને જ આવવું જ પડશે. અગર જો તું વચ્ચે રસ્તામાં હતોત્સાહ શ્વાસ લેવા રહીશ, તો તારી ગાડી ખસીને પાછી કુમાર્ગ તરફ વળવા લાગશે. હે ઈન્દ્રાવતી આત્મા ! બ્રહ્માનંદ સ્વરૂપ સદ્ગુરુનો હુકમ - આજા રૂપી ગાડીવાન નિર્દ્દયી છે. અતઃ તે શાસકના રૂપમાં શીગ્રાતિશીઘ્ર ગાડીને નિશ્ચિત સ્થાન પર પહોંચાડવા માટે તારા સિર પર લાઢી (લાકડી) થી આધાત (પ્રહાર) કરી રહ્યા છે.

ઘોરીડા વહી ને છૂટે રે,
કરમ આપણાં રે ।

મેહેરાજ કહે એમ,
કીધાં છે ઘણાં રે ॥૫॥

શબ્દાર્થ :-

મકરણ-૭, ચૌ. ૨૬.

ઘોરીડા = હે બેલ !

પર પહોંચવાથી જ

વહી ને = તે તો નિશ્ચિત સ્થાન

છૂટે રે = છૂટશે, (તે જુવાંની

* ધોરીડા મા મૂકે તારી *

જવાબદારી)	કહે	= કહી રહી છે કે
રે કરમ = તે પૂર્વ જન્મના કર્મ	રે ઘણાં =	એવા-એવા અનેકો કર્મ
આપણાં = આપણાં જ તો છે.	કીયાં છે =	કર્યા છે. (તે બધા
એમ = આ પ્રમાણે		કર્મ ભોગવયાં જ
મેહેરાજ = શ્રી ઈન્દ્રાવતી આત્મા		પડશે)

ભાવાર્થ-

હે ઈન્દ્રાવતી આત્મા ! તારા કંધા (ખલા) પર પડેલી ગહનશીલ વજનદાર આ બહુમૂલ્ય ગાડીની જિઝ્મેદારી હવે વરચે રસ્તામાં કોઈપણ હાલતમાં છૂટી શકશે નહિ. એ જિઝ્મેદારી રૂપી જુવાં તો હવે આ આત્મા રૂપી સામાનને નિશ્ચિત સ્થળ અર્થાત् શ્રી અક્ષરાતીતમાં સ્થિત ‘મૂલ ભિલાવા’માં પહોંચાડ્યા પછી જ છૂટી શકે છે. તે દુઃખોનું ભુગતાન (ભોગવયું) તો પોતાના પૂર્વ સંચિત કર્મોના ફળ છે. જે અવશ્વમેવ ભોગવયા જ પડશે. એ ગાડીને નિશ્ચિત જગ્યા પર પહોંચાડવી જ પડશે. પોતાના ફૂલ કર્મોના ફળ કયારેય બીજું કોઈ ભોગવતું નથી. શ્રી ઈન્દ્રાવતી પોતાની આત્માને સાવધાન કરાવતાં, સમજાવતાં કહી રહી છે કે પૂર્વ જન્મમાં કરેલાં સંચિત કર્મોના ફળ બહુ જ છે, જે અવશ્વમેવ ભોગવયા જ પડશે. એટલા માટે આ જન્મમાં તમારા જીવનમાં વિભિન્ન આપત્તિ-વિપત્તિઓ, દુઃખ કષ્ટ આવી રહ્યા છે. તે કર્મફળોને ભોગવ્યા પછી જ આત્મા મુક્તિનો અધિકારજન્ય સુખ તથા શાંતિ પ્રાપ્ત કરી શકશે.

* અષ્ટાદશોડદ્વાયः *

* વાટડી વિસમી રે સાથીડા બેહદ તણી *

-રાગ રિંધુડો-

વાટડી વિસમી રે સાથીડા બેહદ તણી
 ઉવટ કોણો ન અગમાએ ।
 ખાંડાની ઘારે રે એણી વાટે ચાલવું,
 ભાલા અણી કેણે ન ભરાએ ॥૧॥

શબ્દાર્થ:-

રે સાથીડા =	હે મારા સાથીઓ !	પર ચાલવું
બેહદ તણી =	બેહદને	ખાંડાની ઘારે રે = તલવારની ઘાર
વાટડી =	માર્ગ	ના સમાન છે
વિસમી =	કઠિન છે	ભાલા અણી = ભાલાની તીખી
ઉવટ =	એ ઊંચા	અણી ચુલે છે
કોણો =	કોઈએ પણ	કેણે = કોઈએ પણ, કોઈપણ,
ન અગમાએ =	પાર કર્યા નથી	ન ભરાએ = સહન કરી શક્યા
એણી વાટે ચાલવું =	એ રસ્તા	નથી

ભાવાર્થ-

હે સુન્દરસાથજુ ! બેહદ ભૂમિકા અક્ષર-અક્ષરાતીત
 બ્રહ્મધામ, શ્રી પરમધામમાં જવાનો રસ્તો બહુ જ કઠિન છે. એ
 સર્વોર્ચ્ચ માર્ગ ‘ન પુનર્ભવાય’ આવાગમન રહિત ગુણયુક્ત હોવાના

* વાટડી વિસમી રે સાથીડા *

લીધે અત્યંત અગમ્ય, અપાર તથા ઊંચો છે. એ રસ્તો આજ સુધી ક્યારેય પણ કોઈ પાર કરી શક્યું નહિ. પુનઃ એ રસ્તા પાર ચાલવું તલવારની ધાર પર ચાલવા સમાન છે. એ રસ્તા પર ચાલવા માટે વિનય - નભતા, શીલ, જ્ઞાન-વૈરાગ્યમાં દફ્તા વગેરે ગુણ અત્યાવશ્યક છે ઉપરાંત દશ ઇન્દ્રિય રૂપી ભાલાથી તથા પંચ વિષયની તીક્ષણાતા રૂપી અણીની તીજાપનથી કમશા: વારે-વારે ચુભતાં, ચલ-વિચલ કરતાં રહે છે. એ કોઈને પણ છોડતાં નથી. આ તીજા ભાલાની ચોટમાં - આકર્ષણમાં આસક્ત લોલુક આત્માઓ એ રસ્તો પાર કરી શકતી નથી.

આડીને આડી રે અગની જોને પર જલે,
વૈરાટ માંહે ન સમાએ ।
બ્રહ્માંડ ફોડીને ઝાળો જોને નીસરી,
ઓલાડી તે કેણે ન જાએ ॥૨॥

શબ્દાર્થ :-

સંસારની વચ્ચે -		ઉમડીને આવે છે.
જોને = જુઓ !		એનાથી આત્મા
આડીને આડી = દિવાલ પર		રૂપી પક્ષીની
દિવાલ,	પર જલે = પાંખ જલી (બળી)	
આવર્ણ પર		રહી છે
આવર્ણ,	વૈરાટ માંહે = ચૌદલોક રૂપી	
અગનીને સૂક્ષ્માનિન, ઉત્તરોત્તર		બ્રહ્માંડની અંદર

* અધ્યાત્મશોદ્ધ્યાયः *

ન સમાએ	= નથી સમાતા	જાલો	= આગની જવાળા
હસાઠસ ભરેલાં		નીકણી	= નીકળી ગઈ
છે.		તે ઓલાડી	= તે ઉલંઘીને
જોને	= જુઓ ! જુઓ !!	કેહને	= કોઈપણ આત્મા
બ્રહ્માંડ	= ચૌદ લોક		આગળ
ફોડીને	= ફોડીને આગળ	ન જાએ	= નથી ગઈ.

ભાવાર્થ-

અમારા બધાના અંતઃકરણાની અંદર કામ, કોધ, લોભ, મોહ રૂપી સૂક્ષ્માભ્રિ હોય છે. તે અભ્રિની જવાળા - ઈરછા-તૃષ્ણા, રાગ-ક્રેષ તથા ઈષ્યા છે. એ જવાળાઓ રાત-દિન ઉત્તરોત્તર ઉમડતી રહે છે. એક જવાળાથી બીજી જવાળા અત્યંત ભયંકર શક્તિશાળી રૂપમાં આવીને લાગે છે. તે જવાળાઓએ આત્મા રૂપી પદ્ધીના પ્રેમ અને વિશ્વાસ રૂપી પાંખ (પર) જલાવી (બાળી) ને ભરમ કરી દીધાં છે. અભ્રિની તે જવાળાઓએ વિરાટ - ચૌદ લોકમાં રહેતાં પ્રાણીઓમાંથી કોઈને પણ છોડ્યા નથી. જુઓ ! જુઓ !! ચૌદ લોક - બ્રહ્માંડની અંદરના બધા જીવોને ભરમીભૂત કરી એ જવાળા હવે બ્રહ્માંડને ફોડીને આગળ નીકળી રહી છે. એ જવાળાને બ્રહ્માંડની ઉત્પત્તિ, પાલન અને સંહારકર્તા બ્રહ્મા, વિષણુ, મહેશાદિ દેવોને પણ જલાવી (બાળી) રહી છે. આ જવાળાથી ઉગરીને એનું ઉલ્લંઘન કરી આજ સુધી કોઈપણ આત્મા બેહદના રસ્તા પર આગળ વધી શકી નથી.

* વાટડી વિસમી રે સાથીડા *

ઈહાં હસ્તી થઈને એણી વાટે હીડવુ,
 પેસવું સુઈના નાકા માંહે ।
 આલ ન દેવી રે ભાઈઆકાર ને,
 ઝાંપ તો ભૈરવ ખાએ ॥ ૩ ॥

શબ્દાર્થ :-

ઈહાં એણી વાટે = અહીં આ	આકારને = શરીરમાં
રસ્તા પર	આલ = આળસ
હસ્તી થઈને = હાથીની જે મન દો	ન દેવી રે = આવવા જ ન દો
બેઘડક ચાલથી	ભાઈ = હે સભીયો ।
હીડવુ = ચાલવું છે	તો = ત્યારે જ
અને ફરી -	ભૈરવ = ભૈરવ - અક્ષરાતીત
નાકા માંહે = છેદની અંદરથી	બ્રહ્મના ચરણમાં
સુઈના = સોચની	ઝાંપ = સમર્પિત
પેસવું = પાર થવું છે	ખાએ = થઈ જશે. (આત્મા ને
એટલા માટે -	પહોંચાડી શકાય છે.)

ભાવાર્થ -

આ બેહદ, અક્ષર-અક્ષરાતીત બ્રહ્મધામના રસ્તા પર ઘૈર્યતા,
 સહનશીલતા, દટ્ઠતા આદિ ગુણ ધારણ કરી હાથીની સમાન
 બેઘડક ચાલથી ચાલવું પડશે. પુનઃ સોચના કાણાંની અંદરથી પાર
 થઈને શીલ, સંતોષ આદિ ગુણો સહિત વાસ્તવિક લઘુતા ધારણ
 કરવી પડશે. તે ઉપાદેય ગુણોને ધારણ કર્યા પગર સોચના કાણાં

* અધ્યાદશોડદ્વાયः *

સદશ બેહદનો રસ્તો પાર પામી શકતા નથી. એટલા માટે શરીરમાં આળસ આવવા જ દેશો નહિ. ત્યારે જ ભજન, ભક્તિ, સેવાદિમાં આ શરીર લગાવી શકશો. સેવા-ભાવનું મહત્ત્વ ગહનશીલ છે. શ્રી ચુગલ સ્વરૂપના ચરણમાં ચિત્તવૃત્તિ લગાવીને પ્રસન્ન દિલથી અગર આ શુષ્ણન સેવા-ભક્તિમાં ન્યોચછાપર કરવું હોય તો, આ શરીરને સમર્પિત કરી ધની ચરણમાં ભેરવ ઝાંપ (છલાંગ) ખાવી પડશો. ભેરવ ઝાંપ (છલાંગ) ખાદ્યા પછી આ જન્મ સમાખ થઈજશે. અમને લોકોને તો ત્યાં મૂલ ભિલાવાની અંદર મૂલ પરાત્મ શરીરમાં જાગ્રત થવું છે. આ પ્રમાણે જાગ્રત થયા પછી જ અમે આવાગમનના ચક્કરથી મુક્ત થઈ શકશું.

ઓતડ દિસે રે અતિ ઘણું દોહેલી,
હાથ ન થોભે રે પાય ।
કામ નહીં રે ઈહાં કાયર તણું,
સુરે પૂરે ઘાયલે લેવાય ॥૪॥

શબ્દાર્થ :-

એ રસ્તો માર્ગ -	અહીં-
અતિ ઘણું = અત્યંત જ	હાથ = હાથથી પકડી શકે છે
દોહેલી = કઠિન	ન થોભે રે = ન તો ટકી શકે છે
ઓતડ = અથાહ, દુસ્સાધ્ય	પાય = પગ જ
દિસે રે = જોવામાં આવે છે	ઈહાં = અહીં, આ રસ્તામાં

* વાટકી વિસમી રે સાથીડા *

કાયર તણું = કાયર-ડરપોક

લોકોને તો

કામ નહીં રે = કામ જ નથી

પુરે ઘાયલે = પૂર્ણ રૂપથી ઘાયલ

અને

સુરે = માત્ર શૂરવીર ચોઢા જ

લેવાય = લઈ શકે છે, ચાલી

ભાવાર્થ -

આ અથાહ કઠિન માર્ગને પાર કરી સફળતા પ્રાપ્ત કરવો અત્યંત ભયંકર દેખાય છે. ક્યારે કોઈએ આ રસ્તા પર ચાલવાની હિંમત કરી નથી. અતઃ આ માર્ગ અથાહ કઠિન, વિકટ, દુઃસાદ્ય છે, એવું કહીને છોડી દીધું છે. અહીં આ રસ્તા પર ન તો પગ જ ટકી શકતો અને ન હાથમાં જ એ રસ્તો સમાઈ શકે છે. આ રસ્તા પર મન રૂપી પગનું સ્થિર થવું મુશ્કેલ છે. અને ચિત્ત રૂપી હાથથી લક્ષને પહ્ફડવો પણ કઠિન છે. આ માર્ગ પર કાયર -ડરપોક, શંકા-ઉપશંકા વગેરેથી ચુક્ત ચાત્રી ચાલી શકતો નથી. આ માર્ગ પર તો તે જ ચાલી શકે છે, જે એક બાજુ દુનિયાની વિભિન્ન હોકરોથી ઘાયલ થઈ ચૂક્યા હોય તો બીજુ બાજુ ધર્મના પ્રત્યે શૂરવીર છે અર્થાત् આદિથી લઈને અંત સુધી ઘોકા આપવાવાળા આ નરપર સંસારના પ્રત્યે પૂર્ણ રૂપેણ વૈરાગ્ય ચુક્ત ઘાયલ ચાત્રી (આત્મા) અને આત્મીય સુખ-શાંતિ પ્રાપ્ત કરવા વિષયમાં પૂર્ણ રૂપેણ શૂરવીર ચાત્રી (આત્મા) જ આ માર્ગ અપનાવીને એની પર ચાલી શકે છે.



* અધ્યાદશોડદ્વાયः *

સાગરના પંથે રે બીજા જોને પાધરા,
ચાલે ચાલે ઉત્તરતાં જાય ।
સ્વાંત લઈને સેહેજલ સુખમાં,
પ્રધલ જાએ રે પ્રવાહે ॥ ૫॥

શબ્દાર્થ :-

આજ સુધી બધા દ્વારા ચાલેલો-	અને ઇટી-
અપનાવેલો -	સ્વાંત લઈને = શાંતિ ધારણા
સાગરના = સંસારઢૂપી સાગરમાં	કરીને
બીજા = બીજા એવા	સેહેજલ = સ્વાભાવિક,
પાધરા = પ્રસિદ્ધ, પ્રત્યક્ષ	સુખમાં = સંસારના સુખમાં
પંથ રે = માર્ગ છે જેમાં-	રહેવા માટે બાધ
જોને = જુઓ ! જુઓ !!	રૂપ થઈ જાય છે
ચાલે ચાલે = ચાલતાં-ચાલતાં	ત્યારે-
ઉત્તરતાં = પાછળ બાજુ લપસતાં	પ્રધલ = ઉપરાઉપર, કમશા:
જાય = ચાલી જાય છે. (જઈ રહ્યા છે.)	પ્રવાહે = માયાવી પ્રવાહના ચક્કરમાં
	જાએ રે = જાય છે - પડે છે

ભાવાર્થ-

જુઓ ! જુઓ !! સંસાર ઢૂપી અથાહ સાગરમાં અપરા ભક્તિ
માર્ગનો રસ્તો સરલતાપૂર્વક પ્રત્યક્ષ -પ્રસિદ્ધ રૂપમાં ચાલ્યા કરે છે.
આ માર્ગના ચાત્રી-સાધક જેટલાં પણ આગળ જવા ચાહે, તેટલાં

* વાટકી વિસમી રે સાથીડા *

જ પાછળ બાજુ લપસતાં જાય છે. જેમ કે સંસારના પ્રસિદ્ધ અધિ-
મહર્ષિઓમાંથી શ્રુંગી અધિ, સોવરી, વિશ્વામિત્રાદિ, અહીં સુધી કે
વિશ્વાગ્રગણ્ય ભ્રણા, વિષણુ, મહેશાદિ ત્રિદેવા સુધીની
ગતિવિધિઓ પુરાણોમાં લોકપ્રિય જ છે. આખરકાર અંતિમ
અવસ્થામાં તે લોકોએ પણ હાર સ્વીકારી શાંતી ધારણ કરી લીધી
અને ભ્રણાનંદની આશાનો પરિત્યાગ કરી વિષયાનંદમાં જ મસ્ત
થઈ ગયા. “ભ્રણાનંદ અપ્રાપ્ય છે, અગમ્ય છે” એવો સ્વીકાર કરી
કહેવા લાગ્યા કે “ન જાનિમો વચ્ચે ધાત પર વસ્તુ સનાતનમ્”
અર્થાત् પરાતપર સનાતન ભ્રણ તત્વના વિષયમાં અમે જાણતાં
નથી, પામવું તો તેનાથી પણ પરે છે. એવું તેઓએ પ્રત્યક્ષ સ્વીકાર
કર્યું.

તે તો આકાર કરે રે જોને ઉજળા
માંહે તો અધમ અંધાર ।
ખાએ ને પિએ રે સેજ્યા સુખ ભોગવે,
એણી વાટે ચાલતાં કરાર ॥૫॥

શબ્દાર્થ :-

ઉક્ત જનોની પાછળ તો	કરે રે = કરે છે
જોને = જુઓ ન !	માંહે તો = દિલમાં તો ચાહે
તે તો = એ લોકો તો	અંધાર = અંધાર રૂપી વિકાર, લઈને
આકાર = શરીરને જ	અધમ = અધમાતિઅધમ એ
ઉજળા = સ્વરચ્છ	

* અષ્ટાદશોડ્યાયઃ *

વાતને પ્રધાનતા	સાર સમજે છે.
આપે છે કે-	એહી વાટે = એ માર્ગમાં
ખાએને = ખાવવું અને	ચાલતાં = ચાલવા પર જ
પિએરે = પીવવું તથા	કરાર = શાંતિ, સુખ, પ્રામણશો, તો તે લોકો
સેજ્યા સુખ = સેજનું સુખ	ક્યાં પહોંચશે.
ભોગવે = ભોગવવું જ જીવનનો	

ભાવાર્થ-

જુઓ તો ! આ માર્ગના ચાત્રી-સાધક તો આ શરીરની પવિત્રતા, સ્નાનાદિ અને વસ્ત્રાભૂષણ, વેશભૂષાદિમાં જ આત્મીય સ્વચ્છતા માનીને શરીરને જ સ્વચ્છ રાખવા તથા તેનો જ સિનગાર કરવામાં લાગેલાં છે. જુઓ ! જુઓ !! તે તો હૃદયની અંદર અંતઃકરણામાં પૂર્ણ અજ્ઞાન - અંધકારમય વિકાર લઈને દેખા-દેખી (દેખી-શેખી) નું સાધન કરતાં અધમાતિઅધમ બનતાં જઈ રહ્યા છે, અને જીવનની સાર્થકતા ખાવા, પીવા અને સેજ્યા સુખ ભોગવવામાં જ છે, એવું માનીને અને તેને અંત ગતિનું લક્ષ બનાવીને, શાંત થઈને મસ્ત થઈ રહ્યા છે તે લોકોને આ માર્ગ પર ચાલવું તો સ્વતઃ સુખદાચી, આનન્દમયી સરલ જ છે. પરંતુ જ્યાં સુધી તે માર્ગ પર ચાલશે ત્યાં સુધી જ. આ માર્ગ પર ચાલતાં-ચાલતાં તે અંતમાં ક્યાં પહોંચશે? એ આશ્ર્યજન્ય તથા અકથ્ય છે.



* વાટડી વિસમી રે સાથીડા *

બાંત માહેલી જિંહા ભાજે નહીં,
 તિહાં લગે જાએ નહીં કપટ ।
 બેશ બનાવો રે અનેક વિદ્યનાં,
 પણ મૂકે નહીં વેહેવટ ॥૭॥

શબ્દાર્થ :-

જિહાં માહેલી = જ્યાં સુધી	પ્રકારના
દિલની અંદરનો, બેશ બનાવો રે = વેશભૂષા તો	
બાંત = ભમ	બનાવી શકાય
ભાજે નહીં = નિર્મૂળ નહિ થાય	છે
તિહાં લગે = ત્યાં સુધી	પણ = પરંતુ
કપટ = કપટતા, ઘૂર્તતા	વેહેવટ = ભયંકર કહિન ચક્કર
નહીં જાએ = નહિ છૂટશે	મૂકે નહીં = છૂટતું જ નથી.
અનેક વિદ્યનાં = અનેકો	

ભાવાર્થ -

હે સાધક આત્માઓ ! જ્યાં સુધી જીવાત્મા નિઃસેદ્ધ નિશ્ચિત જ્ઞાન ન પામે, ત્યાં સુધી અન્તઃકરણમાં રહેલી શંકા-ઉપશંકા રૂપી બાંતિ મટી શકતી નથી. જ્યાં સુધી અન્તઃકરણમાં રહેલી બાંતિ ન મટે, ત્યાં સુધી મોક્ષ બાધક કર્મજન્ય કપટ રૂપી અન્તઃકરણ (દિલ) ના દરવાજા ખૂલશે જ નહિ અને આ કપટ ચુક્ત દિલના દરવાજા ખૂલ્યા વગર જીવાત્મા જાગ્રત થઈ શકતી નથી. તે અજ્ઞાનજન્ય

* અષ્ટાદશોડ્યાયઃ *

નીંદમાં ચક્કર મારતી જ રહેશે. અનેકો પ્રકારની વેશભૂષા બનાવવાથી, ધારણ કરવું ચા કરાવવાથી પરમાત્મા ઠગી શકાતા નથી. એ તો માત્ર અમારી ઘૂર્તતા જ કહેવાય છે એવી ઘૂર્તતાથી ચુક્લિ પામી શકતાં નથી. ભલે ન આ શરીરને નાના પ્રકારના સિંગારથી સજાવી દો, પરંતુ જ્યાં સુધી જીવાત્મામાં સ્થિત ફૂડ-કપટનું નિર્મલીકરણ થતું નથી, આત્મજ્ઞાન થતું નથી, ત્યાં સુધી જન્મમરણ ઇપી ભયંકર, અસાધ્ય માચાવી ચક્કર છૂટશે નહીં.

બેહદ વાટે રે કપટ ચાલે નહીં,
રાખે નહીં રજ માત્ર ।
જેને આવો રે તે તો પહેલે આગમી,
પછે ને કરું પ્રેમનાં પાત્ર ॥૮॥

શબ્દાર્થ :-

બેહદ = બેહદનાં	આવવું છે
વાટેરે = રસ્તામાં તો	તે તો = તેને તો
કપટ = ઘૂર્તતા	આગમી = આવવાથી
ચાલે નહીં = નહીં ચાલશે	પહેલે = પહેલાં વિચાર કરે,
રજ માત્ર = અહીંયા તો રજકણ	સમજુ લે
જેટલી માત્ર પણ	પછે ને = પછી તો, ફરી તો
કપટતા	પ્રેમનાં પાત્ર = પ્રેમનું પાત્ર
રાખે નહીં = રહેવી જોઈએ નહીં	કરું = બનશે જ, બનાવીશ જ
જેને આવો રે = એટલા માટે જેને	

* વાટડી વિસમી રે સાથીડા *

ભાવાર્થ-

આ આવાગમન રહિત બેહદ-અક્ષર-અક્ષરાતીતના ઉંચા રસ્તા પર ધૂતોની ધૂર્તતા અપનાવીને ચાલી શકાતું નથી. અજ્ઞાનજ્ઞન્ય માચાવી વિકારો જેવી ધૂર્તતા વગેરે તો લેશમાત્ર પણ થવી ન જોઈએ. દઢ રૂપથી નિશ્ચિત કરેલાં આત્મીય જ્ઞાનમાં શંકા - ઉપશંકા, બાંતિ વગેરે ન હોવું જોઈએ. એટલા માટે જેને પણ બેહદના રસ્તા પર આવવું હોય, તે આવતાં પહેલાં જ જ્ઞાન દ્વારા સોચ-વિચાર કરી લે ! ગૌર (એકીટશે) પૂર્વક જાણી - સમજુ લે !! નિઃશંક થઈને દઢ નિશ્ચય કરી લે !!! આત્મીય જ્ઞાન દ્વારા નિશ્ચિત થવા પર જ આત્મજ્ઞતિ થઈ શકે છે. તત્પર્યાત્ પ્રેમાર્પદ પરમાત્માની સંભૂખ થવાને લીધે, માત્ર તે જ જ્ઞત આત્મા પ્રેમના પાત્ર બની શકો છે આત્માને પ્રેમના પાત્રમાં પરિવર્તિત (બદલ્યા વગર) કર્યા વગર, આ રસ્તામાં પ્રવિષ્ટ થઈને ચાલવું અત્યંત દુર્લભ જ નહિ, અસંભવ છે.

બાંત માહેંલી રે મહામત ભાજવી,
 રદે માંહે કરવો પ્રકાસ ।
 પછે ને ટેખાનું ઘેર મુખ આગળ,
 જેમ સોહેલો આવે મારો સાથ ॥૮॥

શાબ્દાર્થ :- પ્રકાશ-૮, પૃ. ૩૮.

માહેંલી	= દિલના અંદરની	મહામત = મહામતિના જ્ઞાન
બાંત	= બાંતિ-ભંગ	દ્વારા

* અધ્યાદશોડદ્વારાયઃ *

ભાજવી રે	= નિર્મૂળ કરી	મુખ = પ્રત્યક્ષ મુખ
મટાડવી છે		આગળ = આગળ, સામે
અને-		દેખાડું = દેખાડીશ
રદે મોહે	= હૃદય-અંતઃકરણામાં	જેમ = જેમાંથી કે
પ્રકાસ	= જ્ઞાન ઇપી પ્રકાશ	સોહેલો = સરલતાની સાથે
કરવો	= કરીશ, થશે	મારો સાથ = મારા સુંદરસાથ
પછે ને	= તેના પછી	શ્રી બ્રહ્મધામ
ઘેર	= શ્રી પરમધામના	પરમધામ
	તથા પરાત્માના	આવે = આવશે.

ભાવાર્થ -

મહામતિ સ્વરૂપ શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે કે તે જીવાત્માઓના દિલમાં જે અનેકો જન્મ-જન્માંતરના પૂર્વકૃત-કર્મોના વિકારાન્ય ખાંતિ જામેલી છે. તેને હું મારા નિઃશંક આત્મીયજ્ઞાન દ્વારા નિર્મૂળ કરી મટાડી દઈશ. આ પ્રમાણે જ્ઞાનાન્ધિ વગર કર્મના વિકાર ભર્મ થઈ શકતાં નથી, ત્યારે જીવાત્માઓના હૃદયમાં આત્મીય જ્ઞાન ઇપી પ્રકાશ થઈ જાય છે. ત્યારબાદ તે આત્માને જ્ઞાન દ્વારા જાગૃત થઈ આત્માઓની સામે પરાત્મા અને ધામ સહિત પરાત્મ શરીરના મુખ પ્રત્યક્ષ આત્મા દ્વારા - 'આત્મા-પરાત્મા જોસે' જોઈ લે છે (હું બતાવી દઉં છું), જેનાથી મારા પરાત્મા આત્મીય સાથી, ધામની આત્માઓ સરલતાની સાથે નિજધામ-અક્ષરાતીત શ્રી પરમધામમાં આવી જશે.

* मैं चाहत न स्वांत *

* मैं चाहत न स्वांत इन भाँत *

(ब्रह्मतामरसना प्रकरण)

मैं चाहत न स्वांत इन भाँत, अजुं आउद्य अंग चलें,
इन नैनों दोनों नेक न आवे नीर।
दरद देहां जरद गरद रद करे,
मैं क्यों धरुं धीर अस्थिर शरीर ॥ १॥

शब्दार्थ :-

इन भाँत मैं	= आ प्रकार हुं	नेक न आवे	= एक बूँद पण
स्वांत न चाहत	= शांतीपना	पड़युं नथी	
धारणा करवा	देहां	= आ शरीरमां	
चाहता	दरद	= प्रेमोन्नत्पना माटे	
नथी, करी	क्यों धीर धरुं	= धैर्य केवी शीते	
शक्ता नथी		धारणा करुं ?	
अजुं अंग	अत्यारे तो शरीरना	मैं अस्थिर	= हुं आ अनिश्चित
आउद्य चलें	= साधन रूपी		क्षणालुंगर
हथियार सकीय	सरीर	= शरीरने	
छे	जरद	= हणदर सदश	
इन दोनों	गरद	= पीला बनावीने	
नैनों	रद करे	= राख सदश	
नीर		= उडावी दृशा.	

ભાવાર્થ-

મહામતિ સ્વરૂપ શ્રી પ્રાણનાથજી સ્વાત્માની દઢતા પ્રગટ કરતાં પોતાની આત્માઓને સાવધાન કરાવતાં કહી રહ્યા છે કે “આજ સુધી જે થયું, તે થયું પરંતુ હવે હું ચાર આશ્રમો પર આધારિત (૨૫ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, ૨૫ વર્ષ ગૃહસ્થાશ્રમ, ૨૫ વર્ષ વાનપ્રસ્થાશ્રમ, ૨૫ વર્ષ સંન્યાસાશ્રમ) સમય પર આશ્રિત થઈને શાંતીપૂર્વક અર્ધ ક્ષણ બેસવા ચાહતો નથી, બેસી શકતો નથી કેમ કે અત્યાર સુધી તો મારા શરીરમાં સાધ્ય તરત્ત્વ પ્રાપ્ત કરવા વિષયક અન્તઃકરણ ઈન્દ્રિયાદિ સાધન સક્રિય (કામ કરતું) જ છે. આ દેવ દુર્લભ માનવ શરીરના અંતઃકરણ મન, ચિત્ત, બુદ્ધિ અને ઈન્દ્રિય વગેરે સાધનો દ્વારા પણ પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉઘોગ ન કરે, તો બીજા કયા સાધન દ્વારા કરે, કેમ કે બીજા કોઈપણ સાધનો દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવું અકાટય જ સંભવ નથી. આ નિર્દર્શા આત્મામાં સાધ્યતાત્ત્વ પરમાત્માના પ્રતિ ચિંતા-ફિકરી ન થવાને કારણે જ પ્રેમ પ્રગટ થયો નથી (નથી થતો) આત્મામાં પરમાત્માના વિયોગની ચોટ લાગી નથી. જેનાથી મારી એ બંને આંખોથી નિર્ણય પરમાત્માના પ્રતિ પ્રેમાશ્રુ પડવા જોઈતા હતાં, પરંતુ અશ્રુ (અંસું)નું એક બૂંદ પણ પડયું નથી, આ તો મોટા આશ્ર્યની વાત છે. એનું મૂલ કારણ આ જૂઠા શરીર જ છે. એટલા માટે હું આ ક્ષણાંગુર શરીરને જ્ઞાનાભિ રૂપી કસનીની કસોટીમાં એ રીતે ચઢાવીશ કે જેનાથી મારા સર્વાંગ નિખરીને પીળું કુંચન સદશ બની જશે. આ કસોટીમાં સંસારના પ્રત્યે જેટલી પણ લોકીક આશાઓ, ઉમંગો, મોહ-મમતાદિ છે, બધુંચ ટુકડા-ટુકડા થઈને ઘૂળની જેમ ઉકી જશે. આ શરીર દ્વારા આત્માના આત્માધાર પરમાત્માના ચરણામાં

* मैं याहत न स्पांत *

पहोंचाइवुं एटले के आत्मामां परमात्माना प्रति प्रेमोन्धव करावीने
परमात्माने प्रत्यक्ष प्राप्त करवा माटे हવे हुं घैर्य धारणा करीने बेसी
शक्तो नथी.

कठिन निपट विकट धाटी प्रेमकी,
त्रबंक बंको सूरों किनों न अगमाए ।
धार तरवार पर सचर सिनगार कर,
सामी अंग सांगा रोम रोम भराए ॥२॥

शब्दार्थ :-

प्रेमकी धाटी	= प्रेमना धाट-अंत	धार पर
लक्ष्यमां पहोंचवुं	सिनगार कर	= सिंगार करीने
निपट विकट	= निश्चय ज अथाह	सचर = प्रवेश करवो पडशे
कठिन	= तथा कठिन	पुनः-
त्रबंक बंको	= त्रण बाजुथी टेडा	सामी = सामे यालतां
	रस्ताने छोडीने	अंग रोम रोम = शरीरना
किनों सूरों	= कोईपण शूरवीर	प्रत्येक
न अगमाए	= ओने अपनावी	रोमाइद्रथी
शक्युं नथी		सांगा भराए = जरछी भालाउ
तरवार धार पर	= ओ तलवारनी	युभावशे.

भावार्थ -

श्री अक्षरातीत भ्रष्ट रस ३५ प्रेम स्व३५ छे. तेमने 'रसो वे

સः બ્રહ્મ વે રસः' અર્થાત् બ્રહ્મ જ પ્રેમ છે, પ્રેમ જ બ્રહ્મ છે, એવું કહેવાય છે. એવા રસ રૂપ પ્રેમાસ્પદ પરમાત્માના ચરણમાં કોઈપણ આત્માના પ્રેમમય સાધના વગર પહોંચ્યું, અકાટચ રૂપથી અસંભવ છે. એટલે હે સાધક આત્માઓ ! તે પરમાત્માના પ્રેમને અંતઃકરણમાં ધારણ કરીને, તે જ પરમાત્માના ચુગલ ચરણોમાં પહોંચાડવાવાળા અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગ પર કટિબદ્ધ થઈને પ્રવેશ કરો, અગર જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો ! કેમ કે એ રસ્તો નિઃસૈદ્ધ અથાહ તેમ જ કઠિન છે. આ 'અનન્ય પરા દશધા પ્રેમ લક્ષણા ભક્તિ' ની ઘાટીને ઘઢીને પાર કરવી જ પડશો. અપરા - માર્ગની ત્રણ પ્રકારની ટેડાઈ-લોક, વેદ અને કુળ મર્યાદા રૂપી ધર્મ પાલન દ્વારા આત્મોદ્વારની આશાને પરિત્યાગ કર્યા વગર એ રસ્તામાં પ્રવેશ કરી શકાતો નથી . એ કારણો આજ સુધી આ રસ્તાને કોઈપણ શૂરવીર સાહસી અપનાવી તેની પર ચાલી શક્યા નથી.

આ માર્ગ પર ચાલવું તો તલવારની ધાર પર ચાલવા સમાન છે. અહીં આત્મસિનગાર કરીને જ ચાલી શકાય છે. આત્મ સિનગાર-આત્મીય જ્ઞાન દ્વારા નિશ્ચય કરીને દફ્તા, ઘૈર્યતા, નભતા, ક્ષમા, વિવેક સહિત પ્રેમપૂર્ણ ઉગ્રતા આદિ ગુણોથી આત્મ સિણગાર કરીને જ આ માર્ગમાં પ્રવિષ્ટ થવું પડશો. કાચર લોકોના તો અહીં કામ જ નથી. ઉક્ત પ્રકાર આત્મ સિનગાર કરીને પણ અગર જો સાંખ્યેત થયા વગર ચાલ્યા, તો સામેથી શરીરના પ્રત્યેક અંગ તેમ જ રોમ-રોમમાંથી ખટરાગ તેમ જ વિષયાદિ રૂપી બચ્છી-ભાલાદિ આવીને ચુલવા લાગશો, જેનાથી નિષ્ઠા-નિયમોનો ભંગ થઈને માર્ગથી ચ્યુત થવું તથા તલવારની ધારથી કપાવું સંભવ થઈ શકે છે.

* મેં ચાહત ન સ્વાંત *

સાગર નીર ખારે લેહેરાં માર મારે ફિરે,
 બેટોં બીચ બે સુધ પછાડ ખાવેં ।
 ખેલેં મછ મિલે ગલેં લે ઉછાલેં,
 સંધો સંધ બંધે અંધો યોંજે ભાવેં ॥૩॥

શબ્દાર્થ :-

સાગર = સંસાર રૂપી સાગરમાં	મગરમચછ
ખારેનીર = નમકીન - ખારા	મિલે = મળે છે
પાણીની	ખેલેં = તે રમાડે છે.
લેહેરાં = લહેરો, બાઢથી	ઉછાલેં = ઉપર ફેંકી ટે છે અને
ફિરે = વારંવાર	ગલેં લે = ગળી જાય છે
માર મારે = ગોઢો મારે છે, પાટે છે	સંધો સંધ = અંગ-પ્રત્યંગમાં
બેટોં બીચ = શરીર રૂપી નાવમાં	બંધે = અજ્ઞાનમાં બંધાયેલાં
બેઠેલી જીવાત્મા	અંધો = અજ્ઞાન ઘ્રસ્ત અંધા
બેસુધ = બેહોશ, બેચિત થઈને	લોકોને પણ
પછાડ ખાવેં = પછાડ ખાય છે	યોંજે = એવા જ
તથા ફૂલી જાય છે	ભાવેં = સારા લાગે છે,
	વિશ્વાસ થાય છે.
મછ = મોટા-મોટા ભયંકર	

ભાવાર્થ -

હે આત્માઓ ! જુઓ !! જે રીતે સાગરની અંદર ખારું,

* અષ્ટાદશોડધ્યાય: *

નમકીન પાણી ભરેલું હોચ છે અને પાણીની લહેરો, મોજાં -તરંગો
વારે-વારે ઠોકર ખાતાં-ખાતાં જહાજને (માં) છલની (છિદ્ર)થઈને
દૂબવા અથવા પલટવાનો કર રહે છે, તેવી રીતે આ શરીર રૂપી
જહાજને પણ સંસારમાં વિસ્તૃત જન્મ-મરણ રૂપી ખારા પાણીમાં
માયાવી વિષયુક્ત ઈચ્છા -તૃષ્ણા રૂપી લહેરો નિરંતર રાત-દિન
ઠોકરો મારતી (લગાવતી) રહે છે. આ જહાજમાં બેસેલી જહાજવાન
રૂપી જીવાત્મા લહેરો વગેરેની ઠોકરોને લીધે સંસારની વચોવચ
બેચિત-બેસુધ અવસ્થામાં પહોંચીને મનુષ્યવત્ કર્માથી અચુત થઈ
જાય છે. તથા શરીર રૂપી નાવ પલટવા તથા દૂબવા લાગે છે. આ
અવસ્થામાં અગર જો જહાજવાન જહાજ સહિત પોતાના બચાવ
માટે સહારો-મદદ શોધે તો એ અફસોસની વાત છે. ત્યાં ભયંકર
મગરમરછાદિ જલચરોના મુખમાં ફસાઈને ઘોકા ખાય છે.

તે પ્રમાણે અહીં, શરીર રૂપી જહાજની જહાજવાન રૂપી
જીવાત્મા પણ પોતાના રક્ષાર્થ ધર્મની શરણ લઈને ધર્મવેતા,
ભ્રમતરત્વ જ્ઞાતાઓની પાસે પહોંચી જાય છે. તે ભયંકર
મગરમરછના રૂપમાં બેસી રહે છે. તે પેલી માયાવી ઠોકરોને લીધે
બુદ્ધિ-વિયેક છલની થઈને બેશુદ્ધ-બેચિત થઈ જીવાત્માઓના
પ્રલયાન્તરગતના લક્ષ્ય જેવા સ્વર્ગ, વૈકુંઠ, નિરાકાર-નિરંજનાદિને
જ અદ્રિતીય ભ્રમધામ કહીને તેના પ્રલોભન બતાવીને લક્ષ્ય રહિત
થોથા જ્ઞાનમાં ફસાય છે. એવા ભ્રમ લક્ષ્ય રૂપી નિશાના વગર
લોકોને ફસાવવાં, બિલાડી દ્રારા ઉંદરને ફસાવે તેમ જ છે. તર્ક-વિતર્ક
દ્રારા અજ્ઞાની લોકોને પરાસ્ત કરવા અને તમને આત્મતારણના
વિષયમાં વિશ્વાસ અપાવીને શિષ્ય-શિષ્યા બનાવવા બિલાડીને

* મેં ચાહત ન સ્વાંત *

જેલતાં - જેલતાં ઉંદરને ગળી જવાની જેમ જ છે. આ પ્રકારના ધોકામાં પડી જાય છે. શરીરની પ્રત્યેક સંધિઓમાં એ માચાવી વિકાર જકડવાને લીધે, જે અંધાત્માઓને વિચાર - વિવેક કરવાની શક્તિ સમાઝ થઈ જાય છે. તેને એવા જ પ્રલોભન ભલીભાંતિ અવિનાશી લાગવા લાગે છે અને તે તેમને જ ગ્રહણ કરે છે તથા તે નિરંતર જન્મ-મરણ રૂપી જેલમાં જેલતી જ રહે છે.

દાહો દસો દસો હિસ સબે ઘખે,
લાલ જાલા ચલે ઈંડ ન જલાએ ।
ફોડ આકાસ ફિરે સિર સિખરો,
એ ફલંગ ઉલંઘ સંગ ખસમ મિલાએ ॥૪॥

શાબ્દાર્થ :-

સબે	= બધાના દિલની	બ્રહ્માંડમાં
દસો હિસ	= દશો હિશાઓથી	સમાતી નથી.
ઘખે	= જવાના, ભબકતી	સિખરો = શિખરના
દાહો	= આગ	સિર = સિરના પણ
દસે	= ઉમડી રહી છે	ફોડ = ઉદ્વંઘન કરી
ચલે	= એ વધતી	આકાસ = આકાશમાં
લાલ	= આગની લાલ-લાલ	ફિરે = વ્યાપક થઈ રહ્યા છે
જાલા	= જવાના વગેરે	ફલંગ = એક છલાંગમાં
ઈંડ ન જલાએ	= ચૌદલોક રૂપી	એ = એ બધું સિર શિખર,

* અષ્ટાદશોડદ્યાયઃ *

આકાશ	ખસમસંગ = ધનીની સાથે
ઉલંઘ = ઉલંઘીને	મિલાએ = મળવું છે.

ભાવાર્થ -

આ સંસાર રૂપી સાગરમાં પંચભૌતિક શરીર ધારણ કરવાવાળા યાવત् પ્રાણીઓના અંત:કરણ રૂપી દિલમાં દસો દિશાઓથી ઈર્છા, તૃષ્ણા રૂપી ભલકતી આગ ઉમડી રહી છે, તે પણ નશપર લક્ષ્ય પ્રતિની ભૌતિકતા ઉપર્યુક્ત આગની કામ, કોદ્ય, લોભ, ઈધ્યા-દ્રોષ રૂપી લાલ-લાલ જવાળા આકાશ-પાતાલના બધા પ્રાણીઓનો વિદ્યવંસ કરી, બ્રહ્માંડના શિખર રૂપી સ્વર્ગ વેકુંઢ વાસીઓને પણ અધમું કરીને છોડી દે છે અથવા જગ્નમ-મરણ રૂપી નાચ નચાવતી રહે છે. આ પ્રમાણે આગની એ જવાળા ચૌદ લોકમાં ન સમાઈને, આકાશને ઉદ્ઘંધન કરીને શિખરમાં ચારે બાજુ વ્યાપક રૂપથી ખમણા કરી રહી છે. એટલા માટે હે આત્માઓ ! તે બધાને એક જ છલાંગમાં ઉલંઘીને પોતાના પ્રિયતમ અક્ષરાતીત ધનીને મળવું પડશો, ત્યારે જઈને પોતાનો આત્મીય દ્યેય ફળીભૂત થઈ શકશો.

ઘાટ અવઘાટ સિલપાટ અતિ સલવલી,
 તહાં હાથ ના ટિકે પપીલ પાએ ।
 વાઓ વાએ બઢે અગિન ફૈલાએ ચઢે,
 જલે પર અનલે ના ચલે ઉડાએ ॥૫॥

* મેં ચાહત ન સ્વાંત *

શબ્દાર્થ :-

ધાટ	= અક્ષરાતીત ધાટમાં	વાએ	= ચાલે છે
	ઉત્તરવાનો રસ્તો	અગિન	= આગની જ્વાળાઓની
અપધાટ	= અથાહ, અગમ્ય છે	જેમ	
સિલપાટ	= સંગેમરમર પત્થરથી બનેલાં ફર્શની જેમ	ચઢે	= ઉમડી રહી છે
અતિ	= અત્યંત ચીકણું છે,	ફૈલાએ	= ફૈલાઈ રહી છે અને એ
સલવલી	= લીલ (શેવાળ) થી ભરેલું છે.	અનલેં	= આત્મા હૃપી પક્ષીના
તહાં	= એ રસ્તામાં	પર જલેં	= પર (પાંખ)ભર્મ
હાથ	= હાથ દ્વારા પકડવાનું તો શું	કરીને તોડી દે છે	(થઈને તૂટી જાય છે)
પપીલ પાએ	= કીડીના પગ પણ	ચલે ના। ઉડાએ	= ન ચાલી શકે
ના ટિકે	= ટકી શકતા નથી.	છે, અને ન	
વાઓ બઢે	= અહીં હવા જોરથી	ઉડી શકે છે.	

ભાવાર્થ-

શ્રી અક્ષરાતીત પ્રેમાર્પદ બ્રહ્મધાટમાં પહોંચવા-ઉત્તરવાનો રસ્તો એક તો અથાહ, અગમ્ય, વિકટ છે, તો બીજો સંગેમરમરના પત્થરથી બનેલાં ફર્શની જેમ અત્યંત સપાટ અને લીલ શેવાળ યુક્ત ચીકણો છે કણોર દિલ જ સંગેમરમર પત્થર છે. તથા અનેકો જન્મોના।

સંચિત અશુભ કર્મોના વિકાર રૂપી પાપ જ લીલચુક્ત ચિકનાઈ છે. ભક્તિ-સેવા રૂપી માર્ગમાં દિલ પ્રધાન છે. કઠોર દિલમાં ભક્તિ ચા સેવા ભાવનું પ્રગટ થવું અસંભવ છે. નિશ્ચિત નિઃશંક જ્ઞાન વગર અહીં મન રૂપી પગ (પાંખ) ટકી શકતો નથી અને ચિત્ત રૂપી હાથથી એ પકડી પણ શકતા નથી. કીડીના પગને પણ અટકવું-ટકવું જ્યાં મુશ્કેલ છે, એવા માર્ગ પર મન તથા ચિત્તના આધાર પર સફળતા પ્રાપ્ત કરવી છે. કદાચ યેન-તેન-પ્રકારેણ ચાલતાં-ચાલતાં આગળ પણ વધે તો કામ, કોઘ, લોભ રૂપી અભિને ઈચ્છા, તૃષ્ણા રૂપી તેજ હવા મળી જાય છે અને તે અભિ ચારે બાજુ ફેલાવા લાગે છે. એ અભિ શરીરની અંદર હૃદય રૂપી ગુફામાં બેસેલા આત્મા રૂપી અનલ પક્ષીના પ્રેમ તથા વિશ્વાસ રૂપી બંને પરો (પાંખો) ને ભર્મ કરી ગિરાવી (ફેંકી) દે છે. ત્યારે આત્મા રૂપી પક્ષી નિષ્ઠા ચ્યૂત થઈ જવાથી ન ક્યાં ચાલી શકે છે, ન ઉડી શકે છે, અને ન તો કોઈ પરમાત્માની પાસે જ પહોંચી શકે છે, એટલા માટે-

પહેન પાખર ગજ ઘંટ બજાએ ચલ,
 પૈઠ સંકોડ સુઈ નાકે સમાએ ।
 ડાર આકાર સંભાર જિન ઓસરે,
 દોડ ચઠ પહાડ સિર ઝાંપ ખાએ ॥૬॥

શાબ્દાર્થ :-

હે આત્માઓ !	પહેન = પહેરવો પડશો અને
પાખર = પોશાક	ગજ ઘંટ = હાથીની ચાલથી ઘંટા

* મેં ચાહત ન સ્વાંત *

બજાએ ચલ = બજાવતા ચાલવું	સંભાર	= યતનપૂર્વક
પડશો	આકાર કાર	= શરીરને સમર્પિત
આ પ્રકારથી-		કરી
પૈઠ સંકોડ = અંગાદિને સમેટીને	દૌડ	= દોડતાં-દોડતાં
પ્રવેશ કરી	પહાડ ચઢ	= પહાડ પર ચઢી
સુઈનાકે = સોચના છિદ્રમાંથી		અને શિખર પર
સમાએ = પાર થવું છે.	સિર	= સિરથી
જિન ઓસરે = પાછળ ન ખસ !	જાંપ ખાએ	= છલાંગ લગાડવી
નિશાઃક થઈને		છે.

ભાવાર્થ-

હે આત્માઓ ! શીલ-સંતોષ રૂપી પોશાક પહેરી લો. અને અટલ(દઢ-મક્કમ) થઈને ધોર્યતા પૂર્વક નિશ્ચિત રૂપથી આત્મીય તારતમ જ્ઞાનના નિકર રૂપી ઘંટા લટકાવી દો. અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિમાર્ગ પર પણ માધુર્ય ભાવની મસ્તીમાં આત્મીય પ્રેમ વૃદ્ધિ કરતાં-કરાવતાં હાથીની ચાલથી ચાલો. પ્રેમભક્તિ માર્ગ પર ચાલવાના સમયે નિરંતર વિનિષ્ટતા ગુણ ધારણા કરો અને ગુણ, અંગ, ઈન્દ્રિય વગેરેને યતન પૂર્વક સંભાળતાં ‘પ્રેમ સેવા’ રૂપી સોચના કાણાંને પાર કરવા માટે લઘુતા ધારણા કરવાના પ્રત્યે સદા સાવધાન તથા હોશિયાર રહો. પ્રેમ સેવાની ગહનતાનો મોટા-મોટા યોગેશ્વરાદિ પણ પાર પામી શક્યા નથી. પરતું તમે લોકો તો ‘સેવાની સેવા દાખું સાર’ અર્થાત् સર્વોત્તમ રૂપમાં તે પથના રાહી બનીને બધાને પથ પ્રદર્શન કરાવતાં અને સર્વત્તમાઓના ચેતનની સેવા

* અષ્ટાદશોડદ્યાયः *

કરવામાં પોતાના અંત:કરણની વૃત્તિ અંગ, ઈન્દ્રિય વગેરે સંભાળીને
હવન-હોમ કરવામાં અગ્રગણ્ય બનો. આ જીવનનો ક્ષણ-પ્રતિક્ષણ
પ્રેમમય સેવામાં દોડ-ધૂપ લગાડવામાં વીતાવી હો. પ્રેમ સેવા રૂપી
પહાડ પર ચઢીને પરાકાઢા (છેલ્લી હદ) રૂપી શિખર અર્થાત्
ચેતનના મૂલાધાર ચિદ્ધન સ્પર્શ અક્ષરાતીત પ્રાણ પ્રિયતમના
ચુગલ ચરણોમાં છલાંગ લગાડવી છે અથવા જાગૃત થવું છે.

બોહોત બંધ ફંદ ધંધ અજૂંકે બીચમે,
સો દેખે અલેખે મુખ ભાખ ન આવે ।
નિરાકાર સુંન પાર કે પાર પીઉ વતન,
ઈત હુકમ હાકિમ બિના કૌન આવે ॥૭॥

શાબ્દાર્થ :-

આ સંસાર સાગરમાં	ભાખ ન આવે = બતાવી
અજૂં બીચમે = અત્યારે પણ	અથવા કહી
વચ-વચમાં	શકાતું નથી
કે બોહોત = અનેકો પ્રકારથી,	અલેખે દેખે = અનગણિત
બહુ જ	દેખાય છે
બંધ -ધંધ = બંધન રૂપી	નિરાકાર = સાકાર, નિરાકાર
વ્યવહારીક	- તથા
ફંદ = ઉલ્લંઘન	સુંન = મોહમાચા શૂન્યાદિથી
સો મુખ = તેને મુખથી,	પાર કે = પરે અક્ષર પુરુષથી પણ

* મેં ચાહત ન સ્વાંત *

પાર	= પરે અક્ષરાતીતમાં	બ્રહ્મના
પીઉ વતન	= પ્રિયતમના	હુકમ બિના = આ જ્ઞાની વગર (અનદિકારી)
	બ્રહ્મધામમાં જવું	
છે.		કોણ આવે = કોણ આવી શકે
ઈત	= આ ધામમાં	છે ? કોણ નથી
હાકિમ	= સર્વાદ્યક્ષ અક્ષરાતીત	આવી સકતા.

ભાવાર્થ-

અહીં સંસારની વર્ચ્યો, જીવનમાં આ અનેકો પ્રકારના નિરર્થક બંધન કુળ મર્યાદા, લોક-લાજ મર્યાદાની રૂપમાં વિસ્તૃત છે. આ સંસાર શરીર સંબંધી વ્યવહારિક વિષયની ઉલ્લંઘનોની સાથે જ આત્મીય સાધન વિષયક પણ બેસુમાર નિરર્થક ઉલ્લંઘન જોવામાં આવે છે. જેનું વર્ણન હું કરી શકતો નથી. એ બધું આત્મીય સાધન વિષયક કાંટા રૂપી બાધક છે. જેનો ન તો કોઈ સાર છે અને ન તો કોઈ પાર જ છે. હે આત્માઓ ! તે બધાને ઉલંઘી સાકાર, નિરાકાર, કશ્યપુરુષની હંદ આદિ શૂન્યથી પરે, સૃજિના કારણ રૂપી અવિનાશી અક્ષરપુરુષથી પણ પરે, આત્માધાર અક્ષરાતીત પ્રિયતમના બ્રહ્મધામમાં પહોંચવું છે. ત્યાં અક્ષરાતીત ધામમાં, સ્વયંસિદ્ધ સર્વાદ્યક્ષ રૂપી અક્ષરાતીત ઘની - પ્રિયતમની આજ્ઞા વગર તથા તે પ્રિયતમની સંબંધી આત્માઓના સિવાય શું બીજું કોઈ અનદિકારી જીવ પહોંચવાની ચોઢા કરી શકે છે? ત્યાં બીજું કોઈ પહોંચી શકતું નથી.

મન તન વચન લગે તિન ઉત્પન,
 આસ પિયા પાસ બાંદ્યો વિસવાસ ।
 કહે મહામતિ ઈન ભાંત તો રંગ રતી,
 દૈ પિયા આગ્યા જાગ કરું વિલાસ ॥૮॥

પ્રકરણ-૬, ચો. ૪૬.
 શાબ્દાર્થ :-

મન તન	= મનમાં અને શરીરમાં	થઈને કહી રહી છે કે-
વચન	= વચનોમાં પણ	ઈન ભાંત = આ પ્રકાર, ઉપરોક્ત
લગે	= થઈ રહ્યું છે	પ્રકાર
તિન	= તે બધામાં	તો = તો હું સ્વચં
ઉત્પન	= ઉત્પત્ત	રંગ રતી = આનંદ વિલોર ગદ-
આસ	= અતૂટ આશા	ગદ થઈ રહી છું
પિયા	= પ્રિયતમ-સ્વામીથી	દૈ પિયા = હે પ્રિયતમ ! આપો
પાસ	= મળવાની	આગ્યા = આદેશ તો
બાંદ્યો	= લાગી રહી છે, બંધાઈ રહી છે	જાગ = હું સર્વ સખિઓ સહિત ધામમાં જાગૃત થઈને
વિસવાસ	= અકાટચ રૂપથી વિશવાસ	કરું = કરે
કહે	= શ્રી ઈન્દ્રાવતી સખી	વિલાસ = આમોદ - પ્રમોદ રૂપી
મહામતી	= મહામતી દર્જમાં	લીલામાં આપની સાથ વિલાસ

* હુબ મેહેબૂબકી આસક *

ભાવાર્થ-

હે પ્રિયતમ ઘની ! મારા શરીરમાં, મનમાં અને વચ્ચનોમાં તથા સર્વાંગમાં ક્ષણ-પ્રતિક્ષણ ઉત્તરોત્તર પિયા મિલનની આશા ઉત્પત્ત થઈ રહી છે અને એ આશા બધોચથી પિયા મિલનના અવિકલ્પ અતૂટ વિશ્વાસ બંધાઈ રહી છે. પિયા મિલનની તે શુભ ઘડી મુહૂર્તનો દ્યુતાર કરતાં હું એકીટશે નિહારી રહી છું. મહામતિ દર્જમાં સ્થિત શ્રી ઈન્દ્રાવતી પ્રાર્થના કરતાં કહી રહી છે કે હે પિયા ! ઉપરોક્ત પ્રકારથી હું તો સ્વયં જ પિયાના પ્રેમમાં -પ્રેમાનંદમાં વિલોર થઈ રહી છું. એટલા માટે હે પ્રિયતમ ઘની ! હવે તો આપની આજ્ઞા પ્રાપ્ત કરવાની ચાહના લઈને એકી નજરે નિહારતાં આપની આજ્ઞાની દ્યુતાર આશામુખી છું, અગર જો આપ આજ્ઞા આપો, તો અમે બધી સખિયા ધામમાં જાગૃત થઈને હર્ષ ઉલ્લાસ-ઉમંગની સાથે આમોદ-પ્રમોદ રૂપી લીલામાં આપની સાથે વિલાસ કરે.

* હુબ મેહેબૂબકી આસક પ્યાસ લે *

હુબ મેહેબૂબકી આસક પ્યાસ લે,
ચાહે સાઝ સરાબ સુરાહી સકા ।
પીવતે પીવતે પીઉકે પ્યાલે સોં
હુદ્ય હાલમેં લાલ પી મણ્ણ બકા ॥૧॥

* અધ્યાદશોડદ્વાયः *

શબ્દાર્થ :-

હુબ	= પ્રેમ, ખ્યાર - સનેહ	ખ્યાલે સોં	= નાનું કટોરો જેવું
મેહેબૂબ કી	= ખ્યારે પ્રિયતમ કે		માટીનું પાત્ર
આસક	= પ્રિયતમા, ખ્યારી		(તારતમ જ્ઞાન રૂપી ખ્યાલા)
	પ્રેમિકા		
ખ્યાસ લે	= ગહેરી ખ્યાસવાળી	હુઈ	= થઈ ગઈ, બની ગઈ
ચાહે	= અભિલાષા-ચાહ	હાલમે	= વર્તમાનમાં (આ જ સંસારના શરીરમાં)
સાઝ	= સ્વચ્છ, શુદ્ધ		
શરાબ	= મદિરા, જામ(પ્રેમરૂપી)	લાલ	= લાલના પ્રેમમાં લાલ
સુરાહી	= જ્ઞાન રૂપી વાસણાદ્વારા		થઈને (અહું બ્રહ્માસ્તિ રૂપી થયા)
સકા	= પીવડાવવાવાળા	પી	= પાન કરકે
	મહેબૂબ-પ્રિયતમ		
પીવતે-પીવતે	= વારંવાર પીતાં-	મરસ્ત	= ચૌંબન પૂર્ણ તૃપ્ત (મદમરસ્તી)
	પીતાં		
પીઉકે	= પ્રિયતમના	બકા	= અખંડ ઘામની

ભાવાર્થ -

આ સંસાર સાગર રૂપી ખેલમાં અક્ષરાતીત ઘામના ખ્યારા ધની - પ્રિયતમ સંબંધી જેટલી પણ સભિયો છે, તે પોતાના પ્રાણાખ્યારા પ્રિયતમના પ્રેમની પૂર્ણ ખ્યાસી અર્થાત् ગહેરી ખ્યાસી છે. અતઃ શ્રી તારતમ જ્ઞાન દ્વારા પોતાના ઘામધનીના સાથની પૂર્વ સંબંધની જાણકારી પ્રાપ્ત કરતાં જ તે પોતાના ધનીના હાથો દ્વારા સ્વચ્છ-અધૂત, પવિત્ર પ્રેમ રૂપી શરાબ (મદિરા)નું પાન

* હુબ્ મેહેબૂલકી આસક *

કરવાની બહુ જ દીર્ઘુક બની ગઈ છે. પોતાના ધની - સ્વામીની સાથે તે મસ્તી પૂર્ણ પ્રેમનું આસ્વાદન કરવા ચાહે છે. નિજધનીના હાથથી વારંવાર પ્રેમ રૂપી મદિરાનું પાન કરતાં-કરતાં તે વાસ્તવિક પ્રેમની આયેશ વિભોર મસ્તીમાં તદોગત પરિણત થઈ ગઈ છે. તે આવા સંસારની વચ્ચે પંચભૌતિક શરીર દ્વારા જ ધામના વાસ્તવિક પ્રેમના નશાના ખુમારમાં પોતાના ધની - સ્વામીની સાથે પ્રેમ રૂપ રંગાઈ ગઈ છે. ધામની એ બ્રહ્માત્માઓ અહીં ધનીના પ્રત્યક્ષ પ્રેમના આસ્વાદન કરી પૂર્ણ મસ્તીમાં પ્રેમોન્ભત થઈ ગઈ છે.

**દિલ પરસ સરસ ભયો અરસ ઈલાહી,
દોડી ચુલ રહે દિલસો દિલમિલ ।
ન્યારી ના હોએ પ્યારી આપમારી,
ચલ વિચલ ના હોએ વાહેદત અસલ ॥૨॥**

શબ્દાર્થ :-

દિલ = અન્તઃ કરણ રૂપી દિલ (તે આત્માઓના)	તારતમ જ્ઞાનથી
પરસ = પ્રેમ રૂપી શરાબના સ્પર્શથી	દોડી = પ્રિયતમ-શ્રીરાજજી
સરસ = અતિ સુંદર યોગ્ય પાત્ર	પ્રિયતમા-સજિયો
ભયો = બની ગયા	બંનેય
અરસ = શ્રી પરમધામના	ચૂલ રહે = ગહેરા પ્રેમમાં ઓત પ્રોત થઈ ગયા
ઈલાહી = અક્ષરાતીતના	દિલસો = પ્રિયતમના દિલથી
	દિલ = દિલ (સજિયોના)

* અધ્યાદશોડદ્વારાચઃ *

મિલ = મળતાં જ એક બીજામાં	ચલ વિચલ = શંકા-ઉપશંકા
એકાત્મ થઈ ગયા	રૂપી ચક્કરમાં
ન્યારી = અલગ, હવે	ફસાઈને સમર્પિત
ના હોએ = રહેશે જ નહીં	થવામાં
ખ્યારી = ઘનીની પ્રિયતમા	ના હોએ = નહીં થઈ
સભિયો	વાહેણા = અદ્રેત ભાવ
આપમારી = અપને આપ (પોતાને મિટાવીને)	(સ્વકીયા ભાવમાં)
પ્રિયતમના પ્રતિ	અસલ = મૂલ સંબંધના પ્રતિ
સમર્પિત થઈને પણ	દઢ રહ્યા, વિચલિત ન થયા.

ભાવાર્થ-

પ્રિયતમ પરમાત્મા શ્રી રાજ્ઞુના મધુર પ્રેમના રૂપર્શ માત્રથી જ અંગના-બ્રહ્માત્માઓના હૃદય નિજ પ્રિયતમના સુનંદરધામ બની ગયા. જે નાથી તે સભિયોના દિલ પ્રિયતમના દિલની સાથ મળીને એકાકાર-એકદિલી થઈ ગયા. એના પછી પોતાના “મૈ પણ અહું ભાવ” ને તિલાજંલી આપીને સ્વચ્છને સમર્પિત કરવાવાળી બ્રહ્મધામની એ સભિયો પોતાના ઘણીથી ક્યારેય પણ, કોઈપણ કાણ અલગ થઈ નહીં. તે સભિયોના અદ્રેત ભાવમાં ન ક્યારે કમી આવી સકી અને ન એ ક્યારેય પોતાના મૂલ સંબંધથી વિચલિત થઈ ગઈ, અવિચલ રહી.



* હંબ મેહેબુબકી આસક *

લગી સો લગી આતમ અંદર લગી,
 યો અંતર આતમ જગી જુદી ન હોએ ।
 સરભર ભઈ પર આતમ યોં કર,
 યોં તેહે દિલી મિલી છોડ સકે ન કોએ ॥૩॥

શબ્દાર્થ :-

લગી સો લગી	= લાગી ગઈ તે	સરભર	= ઓતપ્રોત, સરાબોર
લાગી ગઈ (ક્યાં ?)		ભઈ	= થઈ (બરાબર- એકદિલી એ)
આતમા	= આત્માના	પરઆતમ	= પરાત્મા-પરમાત્મા
અંદર	= અન્તઃકરણમાં		સાથે આત્મા-
લગી	= લાગી ગઈ (ક્યાં લાગી?)		પરાત્મા
યોં	= આ રીતે (ગ્રેમ રૂપી શરાબના નશા)	યોં કર	= આ રીતે
અંતર	= અન્તઃકરણમાં	યોં	= આ પ્રમાણે તે
આતમ	= આત્માની	તેહે દિલી	= પ્રિયતમ- પરમાત્માના
જગી	= જાગ્રત થઈ ગઈ, આત્મા		દિલથી
જુદી	= અલગ	મિલી	= એ દિલ (તે આત્મા ઓના) મળી ગયા
ન હોએ	= નહીં થઈ, પોતાના સંબંધી ઘનીથી	છોડ સકે	= છોડી સકતા (હવે અલગ હોય નહિ)

* અધ્યાદશોડદ્વારાયः *

એકબીજથી)	પ્રિયતમામાંથી
ન કોએ = પ્રિયતમ અને	કોઈપણ નહીં.
ભાવાર્થ-	

અહીં જાગનીના ખ્રલાંડમાં શ્રી પરમધામ અક્ષરાતીતની સંભિયોમાં પ્રિયતમ ઘનીના પ્રતિ જે સ્વકીયા ભાવની લગન લાગી હતી, તે લગનના અંતરાત્મા સુધીની ગહેરાઈમાં પહોંચી જવાથી સુષુપ્તાવસ્થામાં સ્થિત એ આત્માઓ હવે જીવત થઈ ગઈ. આ પ્રમાણે આત્મ જાગૃતિ પછી એ આત્માઓ પોતાના પ્રિયતમ ધામધારીથી કોઈપણ હાલતમાં અલગ-જુદી રહી શકતી નથી અને રહે પણ નહીં. ઉક્ત પ્રકારથી સંપૂર્ણ જીવત સંભિયો પૂર્વ ત્રિકાલ સંબંધી પોતાના પ્રિયતમની સાથે પ્રેમ વિલોર અવસ્થામાં ઓતપ્રોત થઈ ગઈ. એ ખ્રલાત્માઓ અહીંથા જીવતવસ્થામાં આ રીતે સ્થિર થઈ ગઈને હવે તેમની સૂરતાને એક પલ ચા અર્દ્ધ ક્ષાળ માત્ર માટે પ્રાણા તેમના પણ પ્રિયતમથી છોડાઈ શકાતા નથી, છૂટી શકતા નથી.

મહામત દમ કદમ ન છૂટે ઈન ખસમ કે,
 હુઆ મોહોલ માસૂકકા મેરે દિલ માઈ ।
 એક અવલ બીચ આઈ સો એક હુઈ,
 આખર એક કા એક મોહોલ બીચ ઔર નાઈ ॥૪॥

પ્રકરણ-૧૦, ચૌ. ૫૦.

* હુલ મેહેબૂલકી આસક *

શબ્દાર્થ :-

મહામત = મહામતિ દર્જમાં	સાથે ધામમાં)
રહીને ઈન્ડ્રાવતી કહે છે કે	બીચ આઈ = વરચે આવીને (પ્રજ રાસમાં અલગ થઈ ગયા)
દમ = એક શ્વાસ માત્ર પણ	સો એક = ત્યાંથી આવીને એક થઈ ગયા
કદમ = ચરણ કમલ	હુઈ = (જાગનીના ભ્રમાંડમાં)
ન છૂટે = નહિ છૂટશે, મારાથી	આખર = ધામમાં ઉઠ્યા પછી
ઈન = મારા તે	એક કા એક = અમે બધા એક છે
ખસમ કે = અક્ષરાતીત પ્રિયતમના	જ
હુઆ = સુંદરશાચ્યા બની ગયા છે	મોહોલ બીચ = શ્રી પરમધામ રંગમહલમાં તો
મોહોલ = રંગમહલ - ઘર	ઓર = અમારા (શ્રી ચુગલ સ્વરૂપ અને બાર હજાર સિવાય)
માસૂક્કા = મારા પ્રિયતમના	નાહીં = બીજું કોઈ છે જ નહિ.
મેરે દિલ = મારું દિલ (મનમંદીર)	
માઈ = ની અંદર (અંત : કરણામાં)	
એકઅવલ = એક હતા પહેલાં (પ્રિયતમની	

ભાવાર્થ-

અગ્રગણ્ય સખી શ્રી ઈન્ડ્રાવતી મહામતિ દર્જમાં રહીને પોતાના ધામની સખિયોના પ્રતિ કહી રહી છે કે - હે મારી ધામની

* અષ્ટાદશોડદ્વારાયः *

સભિયો ! હવે તો મારા પ્રિયતમ શ્રી રાજુના ચરણાકમલ મારા કદય મંદિરથી એક કણ ચા પલમાત્ર માટે પણ દૂર રહી શકતા નથી કેમ કે મારા કદય-મન મંદિરમાં પ્રિયતમના મનોનુકૂળ મનમોહિત સુખ-શાચ્યા સજેલી છે. હે સભિયો ! મૂલ અક્ષરાતીત શ્રી પરમધામમાં અમે બધા એક જ તો હતા (અમે ઘનીમાં, ઘની અમારામાં), તત્પરશ્યાત્ પરચે અર્થાત् પ્રજ તથા રાસલીલામાં પૂર્વ વિરમૃતિના લીધે અમે બધા સાથે હોવા છતાં પણ ઘનીથી અલગ થઈ ગયા. પરંતુ અહો ! આ જીગનીના બ્રહ્માંડમાં તો ઘનીની કૃપા અર્થાત् તારતમ દ્રારા જગૃત થતાં જ ઘનીની સાથે એકાત્મ થઈ ગયા. હવે અંતમાં પણ અર્થાત् શ્રી હિંદ્ય અક્ષરાતીત પરમધામમાં પણ અમે જાગ્રત થયા પછી પૂર્વવત્ અન્નેત જ રહેવાવાના છે. ત્યાં તો ઢેત ભાવનું અસ્તિત્વ જ ક્યાં છે.

* ચતુર ચૌક્સ ચેતન અતિ ચોપસો *

ચતુર ચૌક્સ ચેતન અતિ ચોપસો

કૂપત કર સબ અંગ કમર કસે ।
સુંદર સેજ્યા સનકૂલ તન રુણ રચી,
માસૂક હિલ મોમિન મોહોલ માંહે બસે ॥૧॥

શાબ્દાર્થ :-

ચતુર	= ચતુરાઈ પૂર્ણ	ચેતન	= ચિદ્ધન સ્વરૂપ છે
ચૌક્સ	= નેહેચલ, એકરસ	અતિ	= અધિકાધિક

* ચતુર ચોક્સ ચેતન *

ચોપસો	= મનમોહક પ્રેમ પૂર્ણ	સનકૂલ	= પ્રસન્નતા પૂર્વક
ભાવથી ઓતપ્રોત		તન	= પોતાના શરીરના દિલમાં
કૂપત	= પૂર્ણશક્તિ	રૂણ	= બાર હજાર રૂહોં
કર	= લગાડીને		(બ્રહ્માત્માઓ) એ
સબ અંગ	= સંપૂર્ણ અંગાદિથી	રચી	= બનાવી લીધી છે
કમર	= હિમત	માસૂક	= ઘામ ઘની (શ્રી રાજજી)
કસે	= બાંધેલી છે (એવા પોતાના ઘનીને)	દિલ મોભિન	= દિલ રૂપી
સુંદર	= દિલ રૂપી હૃદય ઘામના સુંદર મહેલમાં	મોહોલ	= હૃદય ઘામની
સેજયા	= સુખ શેજયા (શાચ્યા)	માંહે બસે	= અંદર વિરાજમાન થયા

ભાવાર્થ-

પ્રિયતમ ઘામઘની શ્રી રાજજીનું સ્વરૂપ ચતુરાઈયુક્ત અત્યંત ચતુર, મનમોહિત તથા એકાશ્રતા પૂર્ણ દફ નિશ્ચયતાનો ભાવ લઈને છે. સાથે તેમના સર્વાંગ પૂર્ણ શક્તિસંપન્ન કમર બાંધેલ શૂરવીરની જેમ ટેખાય છે. સ્વયંસિક્ષ પ્રિયતમ પોતાના સંપૂર્ણ ગુણો તથા શક્તિઓથી સંપન્ન, આદિ અંતથી રહિત પૂર્ણાત્પૂર્ણ રૂપેણ સુસજ્જિત રહે છે. એવા અમારા પ્રિયતમ પોતાની અંગભૂતા સ્વરૂપ અમે અંગનાઓના પંચભૌતિક શરીરને પ્રસન્ન હૃદય ઘામને પોતાની સુખશાચ્યા બનાવીને વિરાજમાન થઈ ગયા છે.

* અષ્ટાદશોડદ્યાયः *

મન તન જોવન ચઢતા નૌતન,
 આયા અમરદ આસક ઈસક ગંજ લે ।
 અધુર અમૃત મુખ દંત રસના રસ,
 નિત નએ સુંદર સબ હેખે ચઢતે ॥૨॥

શાન્દાર્થ :-

મન તન જોબન = મન, શરીર	મુખ દંત = ચમકીલું મુખારવિંદ
તથા	તથા સુંદર
યોવનાવસ્થા	દંતપંક્તિઓ
ચઢતા = પલ-પલ વધતાં, ઉમડતાં	રસના = અને મધુર મિઠાસચુક્ત જિહ્વા
નૌતન = નવા-નવા જોવામાં આવે છે	રસ = પ્રેમ ભરી તથા
આયા = આવ્યા છે (ખેલમાં)	નિત નએ = નિત્યપ્રતિ નવા-
અમરદ = કિશોરાવસ્થાવાળા	નવા
આસક = બ્રહ્માત્માઓની પાસે	સુંદર = અતિ સુંદર શોભાપૂર્ણ
ઈસક = પ્રેમ રૂપી	સબ = સવર્ગિમાં
ગંજ લે = ખજાના લઈને	હેખે = જોવે છે (જુએ છે)
અધુર = માસૂકના અધર (હોઠ)	ચઢતે = ઉત્તરોત્તર વધતાં
અમૃત = અમૃતમય પ્રેમભર્યા	ઉમડતા જ રહે છે.

ભાવાર્થ-

પ્રિયતમ સ્વરૂપના તન, મન અને ચૌધનાપસ્થાની શોભાસુન્દરતા ક્ષણા-પ્રતિક્ષણા નીતનવા રૂપમાં વધતી તથા ઉમડતી હેખાય છે. આ જાગનીના બ્રહ્માંડ અથવા ખેલમાં કિશોરાપસ્થાથી ચુક્ત પ્રાણપત્રભ પ્રિયતમના અપાર અમૃત ભર્યા હોઠ, સુંદર ચમકીલી દંતપંક્તિ મુખારવિંદ તથા મધુર મિઠાશ રસચુક્ત જિહ્વા સર્વાંગ સહિત નિત્ય પ્રતિ ઉત્તરોત્તર વધતી તથા ઉમડતી શોભા-સુન્દરતાથી સુસજ્જિત જોવામાં આવે છે.

નિલપટ બંકે નૈન નાસિકા શ્રવન,
 કૌલ ફૈલ હાલ નિત નવલે હેખાએ ।
 રૂહ ભી રંગ રસ ચંચલ ચપલ ગત,
 મોહન મોહી મોહની મહ હો જાએ ॥૩॥

શબ્દાર્થ :-

નિલપટ	= લલાટ	હાલ	= વ્યવહાર કરવો.
બંકે	= ટેઢી (વાંકી)	નિત	= નિત્ય પ્રતિ
નૈન	= નજર	નવલે	= નવા-નવા જ
નાસિકા	= નાક	હેખાએ	= હેખાઈ આવે છે.
શ્રવન	= શ્રવણ, કર્હા	રૂહ ભી	= બાર હજાર સભિયો પણ
કૌલ-ફૈલ	= કહેવું, ચાલચલન	રંગ રસ	= પ્રેમાનંદમાં
અને		ચંચલ	= ચંચલતાપૂર્ણ

* અષ્ટાદશોડ્યાયઃ *

(માસૂકના મિલનમાં)	મોહની = બ્રહ્માત્માઓ પણ
ચપલ = મોહિની ચાલ	મહુ હો જાએ = અદ્રેત એક થઈ
ગત = ધારણ કરે છે	ગઈ, મળી ગઈ.
મોહન મોહી = ધનીને મોહિત કરતાં	(પ્રિયતમ ધની સાથે)

ભાવાર્થ-

પ્રાણ પ્રિયતમ ધની જ્યારે તિરછી (ત્રાંસી) નજરથી જુએ
છે, ત્યારે તેમની તિરછી નજરની સાથે-સાથે તેમના વિશાલ લલાટ,
નાક-કાનાદિ બધા અંગ ત્રાંસા દેખાય છે. તેમની બોલ-ચાલ, ચાલ-
ઢાલ, તથા એક-બીજાથી થવાવાળો વ્યવહાર પણ ટેકો તથા દિન-
પ્રતિદિન નવા-નવા જ દશ્યમાન થાય છે. પ્રિયતમના ઉપરોક્ત
રંગ ઢંગ જોઈને બાર હજાર પ્રિયતમાઓ પણ પ્રેમ રૂપી આનંદરસમાં
વિભોર થઈને અતિ ચંચલ અને મનમોહિત ગતિમાં પરિણાત થઈ
ગઈ. તત્પત્રાત્ પોતાના પ્રાણવલ્લભ પ્રિયતમને મનમોહિત કરતાં
બ્રહ્માત્માઓ - પ્રિયતમાઓ પણ પ્રિયતમની સાથે અદ્રેત એકાકાર
થઈ ગઈ.

ભાષતી મહામતિ અરસ રૂહેં ઉમતી

પૂરન કર પ્રીત પ્રેમેં પોહોંચાઈ ।

અરસ વાહેદત ખિલવત ખસમકી,

હુજત નિસબત લિએ ઈત આઈ ॥૪॥

પ્રકરણ-૧૧, ચૌ. ૫૪.

* ચતુર ચૌક્સ ચેતન *

શાબ્દાર્થ :-

ભાષતી = ઈન્ડ્રાવતી સખી કહે	બ્રહ્માંડથી)
છે	પોહોંચાઈ=ધામમાં પહોંચાડે છે
મહામતિ = મહામતિ દર્જામાં	અરસ = અખંડ અવિનાશી
થઈ	ધામ
અરસ ઝુંદે = ધામની તે	વાહેણત = અદ્રેતમાં
આત્માઓ	ખિલવત = ઘર છે (અક્ષરાતીત બ્રહ્મધામ)
ઉમતી = રૂપી જમાતને	ખસમકી = પ્રિયતમ ઘનીજુના,
પૂરન = બધી બાજુથી પૂર્ણ	તે ઘરમાં
(તારતમ જ્ઞાનની	હુજત = દાવા
સમજદ્વારા)	નિસબ્દત = પૂર્વ સંબંધના
કર = કરીને	લિએ = લઈને
પ્રીત = પ્રેમ (ધામધનીના	ઈત = અહીં (અદ્રેત ધામમાં)
સાથ પૂર્વના)	આઈ = આવી ગઈ બ્રહ્માત્માઓ
પ્રેમેં = પ્રેમ દ્વારા જ (જાગનીના	

ભાવાર્થ-

મહામતિ દર્જામાં થઈને શ્રી ઈન્ડ્રાવતી કહે છે કે સુષ્ટિ પૂર્વ સનાતન બ્રહ્મધામ (પરમધામ)ની બ્રહ્માત્માઓને આ સંસાર પણ આ રીતે તારતમ જ્ઞાનના માદ્યમથી પૂર્ણ પ્રેમ પ્રદાન કરી ધામધનીએ તેને પ્રેમપૂર્વક હિન્દુ પરમધામમાં આ શરીરમાં જ હોવા છતાં પહોંચાડી દીધાં. અદ્રેત પરમધામના એકાંત સ્થાન (મૂલ મિલાવા)માં બેહેલી તે આત્માઓ પોતાના ઘની તથા ધામના

* અષ્ટાદશોડદ્વારાયः *

સંબંધનો પૂર્ણ દાવો લઈને આ નક્ષત્ર સંસારથી પોતાના ધામમાં
પાછી આવી, જે ધામથી જેલ જોવા માટે સૂરતાના રૂપમાં આવી
હતી.

* નૂર નગન ચેતન ભૂખન રચે *

નૂર નગન ચેતન ભૂખન રચે,
અંગ સંગ દેખે સબ ચઢ્ઠે રોસન ।
યો ખેંચ ખડી કરી ઈલમ ખસમ કે,
લઈ જોસ ફરામોસ સે હોસ વતન ॥૧॥

શબ્દાર્થ :-

નૂર = પ્રકાશ રૂપી (શ્રી રાજજુના) સિનગારમાં	દેખે = એવા દેખાય છે, પ્રતીત થાય છે કે
નગન = નંગાદિ છે	સબ = પહેરેલાં બધા
ચેતન = ચિદ્ધન(ચેતન સ્વરૂપ)	ભૂખણોમાંથી
ભૂખન = પહેરેલાં ભૂખણાદિ પણ	ચઢ્ઠે = ઉત્તરોત્તર ઉમડીને
રચે = સજેલાં છે	વધતાં
અંગ = શ્રી રાજજુના અંગોના	રોસન = તેજયુક્ત, જોત,
સંગ = સંગ (સ્પર્શ) પ્રાપ્ત કરી	પ્રકાશ
	યો ખેંચ = આ પ્રમાણે આકર્ષિત કરી (આસિકના)

* નૂર નગન ચેતન *

દિલને)	જોસ = જોશ
ખડી કરી = આત્મા જાગૃત કરી	ક્રામોસ સે = અજ્ઞાન જન્ય
સચેત કરી દીધાં	નિદ્રાવસ્થામાંથી
ઈલમ = નિઃશંક તારતમ જ્ઞાને	હોસ = જાગૃતાવસ્થામાં
ખસમ કે = ઘનીના (બેસક ઈલમે)	પરિવર્તિત કરી દીધાં
લઈ = અંગીકાર કરી લીધા	વતન = પોતાના ધામની
	અવસ્થામાં

ભાવાર્થ-

પ્રિયતમ શ્રી રાજજીના શુંગાર માટે ચુનેલાં (વીણોલાં) દિવ્ય નંગોથી સજેલાં આભૂષણ ચૈતન્ય ગુણોથી પરિપૂર્ણ છે. શ્રી રાજજીના અંગોમાં સુશોભિત થવાને કારણે તે ભૂષણોની શોભા તેમાં પણ સોનામાં સુગંધ ભળેની જેમ બે ગુણા વધારે અધિક વધી ગઈ છે. તે પ્રમાણે પ્રિયતમના નૂર ફુંઝ રૂપી અખંડ તારતમજ્ઞાને બ્રહ્માત્માઓને આ જાગનીના બ્રહ્માંડમાં જાગૃત કરી પોતાની ઘનીજીની સંભુખ -પ્રત્યક્ષ ઉભા કરી દીધાં છે. પ્રિયતમે પોતાના જોશ દ્વારા તે સખિયોની આત્માની નીંદ રૂપી ક્રામોસી અર્થાત् માચા હટાવી (ખેંચીને) તેમની સુખુમાવસ્થાને નિર્મૂળ કરી તેમને જાગૃતાવસ્થામાં પરિણાત કરી દીધાં અને સ્વધામની પૂર્ણરૂપે પહેચાન-ઓળખાણ કરાવી દીધી.

* અષ્ટાદશોડધ્યાયः *

સબ અંગ આસક કે, ઈસક સો રસ બસે,
બઢત બઢત બીચ આએ બકા ।
યોંઆઈઉમત ઈસક ભરી અરસ મેં,
પીવે સાફ સરાબ સુરાહી સાંઈ હાથ સકા ॥૨॥

શબ્દાર્થ :-

સબ અંગ = આહે ય અંગ	અક્ષરાતીત ધામાં
આસક કે = પ્રિયતમા-બાર	યોં = આ રીતે
હજાર	આઈ = આવી પહોંચી
બ્રહ્માત્માઓના	ઉમત = ૧૨ હજાર સખિયોની
ઈસક સો = પ્રિયતમના પ્રેમ	જમાત
ઝપી શરાબથી	ઈસક ભરી = પ્રેમલયું દિલ
રસ બસે = ઓતપ્રોત, એકરસ	લઈને
થઈ ગયા	અરસ મેં = પોતાના અખંડ
બઢત-બઢત = વધતાં- વધતાં	ધામાં
પ્રિયતમાના	પીવે = પીતાં-પીતાં
દિલમાં	સાફ = નિર્મણ, સ્વચ્છ(અછૂત)
પ્રિયતમના પ્રતિ	સરાબ = પ્રેમ ઝપી શરાબ
પ્રેમ	સુરાહી = જ્ઞાન ઝપી બરતન દ્રારા
બીચ આએ = ધામની વચ્ચે	સાંઈ = પોતાના ધનીના
આવી પહોંચ્યો	હાથ = હાથોથી
બકા = અખંડ અવિનાશી	સકા = પીવડાવવા વાળા

ભાવાર્થ-

સ્વધામની તે પ્રેમી આત્માઓના સવાગિ, પ્રેમાસ્પદ શ્રી રાજજીના પ્રેમ રસમાં સરભર થઈ ગયા છે. એમાં પૂર્વ પ્રેમરસ એટલો અધિક વધી ગયો કે અદ્ભુત ધામની સભિયો અંતતઃ પોતાના શ્રી અક્ષરાતીત ધામમાં તુરંત પહોંચી જ ગઈ. આ પ્રમાણે પોતાના પ્રિયતમ - ધનીજીના પરમ પાપન જ્ઞાન ઇપી હસ્તકમલ દ્વારા સ્વરચ્છ-અછૂત પ્રેમ ઇપી મહિરા પીતાં-પીતાં પ્રેમમાં મદમસ્ત-ઉન્મતા અર્થાત્ મહામતિ થઈ, એ બ્રહ્માત્માઓ દિવ્ય પરમધામમાં આવી પહોંચી.

હકેં અબ લિએં ફેર અંધેર સે ઈન બેર,
 ઇહેં મોમિન પોહોંચિયાં અરસ માંહે તન ।
 પ્રજ રાસ જાગની તીનોં સુખ ટેય કે,
 મોમિન તન કિએ ધન ધન ॥૩॥

શબ્દાર્થ :-

હકેં અબ = અદ્ભુત બ્રહ્મ ધનીએ	ધામની સૂરતાઓને
એ વખતે જાગનીના	અજ્ઞાન ઇપી માચાથી
બ્રહ્માંદથી	ઈન બેર = આ સમયે (૧૧ વી
લિએં ફેર = ફરાવી દીઘાં	સદીમાં, સુરતાઓના
અંધેર સે = ઈલમ (જ્ઞાન)ના	(જ્ઞાન દ્વારા)
દ્વારા પોતાના	ઇહેં મોમિન = બ્રહ્મની
	આત્માઓ

* અષ્ટાદશોડદ્વારાયः *

પોહોંચિયાં = પહોંચી ગઈ	જાગની = જાગૃતાપસ્થા
પોતાના ધામમાં	તીનોં = ત્રણોચ પ્રકારના
અરસ = મૂલ ભિલાવાની	સુખ = સુખાનુભવ
માંહે = અંદર (પરાત્મામાં)	ટેચે = કરાવીને
તન = શરીરને (સૂરતાઓએ)	મોમિન = બ્રહ્માત્માઓને
જોઈ લીધાં.	તન = પાંચ તત્ત્વોથી
પ્રજરાસ = પ્રજ-ધોર	બનેલાં તનને પણ
નિદ્રાપસ્થામાં	ધન ધન = ફૃતફૃત્ય
= આધી નિદ્રાપસ્થા	કિએ = કરી દીધાં.
થઈ	

ભાવાર્થ-

અક્ષરાતીત પ્રિયતમ ધનીએ આ જાગનીના બ્રહ્માંડમાં તારેતમ ઈલમ દ્વારા બ્રહ્માત્માઓની સૂરતાને અજ્ઞાનાંઘકારથી શ્રી પરમધામની તરફ ફેરવી દીધાં. જેનાથી તે બ્રહ્માત્માઓ જાગૃત થઈને તે હિંદ્ય પરમધામની બેઢકમાં સ્થિત પોત-પોતાની પરાત્મા સ્વરૂપમાં પ્રત્યક્ષ પહોંચી ગઈ. અર્થાત્ પોતાના ખેલની આત્મા દ્વારા જ તેઓએ પોતાની પરાત્માને નિશ્ચિત કરી લીધાં. આ પ્રમાણે પ્રિયતમ ધામધનીએ પ્રજ-રાસ અને જાગની તે ત્રણોચ બ્રહ્માંડોના સુખોના અલગ-અલગ અનુભવ કરાવીને પોતાની પ્રિયતમાઓને પંચભૌતિક તનને પણ ફૃતફૃત્ય સાબિત કરી દીધાં.

* નૂર નગર ચેતન *

ભનત મહામતિ હક દિલ મારફતકી,
પોહોંચાઈ ઈન ન્યામતે ઉમત જિલવત ।
કયોં કહું સિફત બરકત વાહેદતકી,
લજ્જત આઈ ઈમામત ક્યામત ॥૪॥

શાસ્ત્રાર્થ :- પ્રકરણ-૧૨, ચૌ. પ૮.

ભનત = કહે છે (ઇન્દ્રાવતી સખી)	જિલવત = સ્વધામ અક્ષરાતીતમાં
મહામતિ = મહામતિ દર્જમાં સ્થિત	કયોં કહું = કેમ અને કેવી રીતે કહું?
હક દિલ = શ્રી રાજજીના દિલની સિફત = મહત્વ, પ્રશંસા આ	તારતમ જ્ઞાનની
મારફત કી = ગુહ્ય પહેચાન, ગુહ્ય વાતો	બરકત = શક્તિ - તાકાતની
પોહોંચાઈ = પહોંચાડીને આત્મા પરાત્માને	વાહેદતકી = અદ્રેત,
ઈન ન્યામતે = આ તારતમ જ્ઞાન દ્વારા જાગૃત કરીને પ્રત્યક્ષ કરાવી દીધાં	બ્રહ્મધામથી આવેલાં તારતમ જ્ઞાનના
ઉમત = બાર હજાર બ્રહ્માત્માઓની જમાતને,	લજ્જત = સ્વાદ-સુખને આઈ = દિલમાં જાગ્રત થયા
	ઈમામત = મારફત જ્ઞાન થતાં જ દિમાગમાં ચાદ આવી
	ક્યામત = આત્મ જાગૃત થઈ

* અષ્ટાદશોડધ્યાયः *

ભાવાર્થ-

શ્રી પરમધામની અગ્રગણ્ય સખી શ્રી ઈન્દ્રજાપતી સખી કહે છે કે હું અદ્રેત બ્રહ્મ શ્રી રાજુ અર્થાત् અમારા પ્રિયતમના દિલની અંદરની “મારફતી” ગુહ્યાતિગુહ્ય વાતોને પોતાના જૂથ બાર હજાર સંખ્યાઓની આગળ મૂકી રહી છું. આ રીતે તે પોતાના ધામની સખ્યોને પ્રિયતમના દિલની ગુહ્યાતિગુહ્ય વાતો બતાવીને, નિઃશંક બનાવીને જૂઠા ખેલમાં ફસાચેલી તેમની સૂરતાઓને તારતમ જ્ઞાન દ્વારા ફેરવીને સ્વધામમાં પહોંચાડી રહી છું. અક્ષરાતીત અદ્રેત ધામથી આયેલાં તારતમ જ્ઞાનનું સામર્થ્ય, તાકાતના વખાણ હું કેવી અને કઈ રીતે કરું ? એના વખાણ શબ્દાદિ વિષયોથી પરે છે, કેમ કે આ નિઃશંક બેસક જ્ઞાનની સમજ પ્રાપ્ત થતાં જ એ સખ્યોની આત્મા જાગ્રત થઈ ગઈ અને તે સ્વધામના નિજાનંદના સ્વાદના આસ્પદમાં પ્રવિષ્ટ થઈ એકાકાર થઈ ગઈ.

* મિલી માસૂક કે મોહોલ મેં માનની *

મિલી માસૂક કે મોહોલમેં માનની,
આસક અંગ ન માંહે અંગ ।
જાનું જમની બીચ જુદી હુતી હક જાત સો,
પેહેચાન હુઈ પ્રાત હુએ પીઉ સંગ ॥૧॥

શબ્દાર્થ :-

મિલી = મળી ગઈ

| માસૂક કે = પ્રિયતમ - ધનીના

* મિલી માસૂક કે મોહોલ *

મોહોલ મેં = હૃદય રૂપી ધામમાં	(ધનીની પહેચાન ન થવાને લીધે)
માનની = માનવંતી બાર હજાર	
આસક = પ્રિયતમા-	હક = અદ્રેત પ્રેમસ્વરૂપના
ભલ્લાતમાઓના	જત સો = સંબંધથી
અંગ = અંતઃકરણમાં	પેહેચાન = સમજ પહેચાનની
ન માંહે = નહીં સમાતા	હુઈ = થઈ જયારે
અંગ = ઉંમંગ-ઉદ્ઘાસ (ઇલમ દ્વારા જો પ્રાપ્ત થયા)	પ્રાત હુએ = જ્ઞાન રૂપી પ્રાતઃ થતાં જ
જાનું = જાણતી હતી	પીઉસંગ = પ્રિયતમના સાથે જ
જામની બીચ = રાત્રી-પ્રજ અને રાસની વરચે	છ. એ જ્ઞાત થયું મૂલ -પ્રજ તથા રાસમાં તો હતાં જ, હમણાં અહીં પણ છે
જુદી હુતી = અલગ હતી	
	ભાવાર્થ-

આ જગનીના ભ્રાંડમાં તારતમ બેસક ઇલમ દ્વારા જ્ઞાન
પ્રાપ્ત થતાં જ જાગૃત થઈને ધામની ભલ્લાતમાઓ પોતાના
પ્રિયતમના રંગમહલમાં જઈને તેમની સાથે એકાકાર થઈ ગઈ.
પ્રિયતમથી મિલનનો આ આનંદ તેમના અંતઃકરણમાં સમાઈશકતો
નથી. તેમને જોઈને એવું પ્રતીત થઈ રહ્યું છે કે માનો એ આત્માઓ
પ્રજ-રાસની રાત્રીના સમય એકબીજાની ઓળખાણ ન થવાને લીધે
તેમનાથી બિછડ (વિખૂટી પડી) ગઈ હતી અને તેમના વિયોગમાં
પડેલી એ ભલ્લાતમાઓ તારતમ જ્ઞાન દ્વારા પ્રાતઃ અર્થાત् જાગૃત
થતાં જ પોતાના પ્રિયતમની પહેચાન કરી તેમાં એકાકાર થઈ ગઈ
છે.

* અધ્યાત્મોડદ્યાચः *

મન સુકન તન ભાએ સબ એકે,
 એકે જાત સિફાત સબ બાત ।
 એકે અંગ સંગ રંગ સબ એકે,
 સબ એક મતા અરસ બકા વિસાત ॥૨॥

શબ્દાર્થ :-

મન સુકન = તારતમ ઈલમની	થઈ ગયા.
સમજ મળવાથી	એકે અંગ = બાર હજાર બ્રહ્માત્મા
મન પચન અને	ઓ એક જ સ્વરૂપના
તન ભાએ = શરીર પણ એક	અંગ છે
જ તરફ અર્થાત्	સંગ રંગ = તેમની સાથે એક જ
ઘનીની તરફ જ	રંગમાં રંગાઈ ગઈ છે
સબ એકે = બધા એકી તરફ	સબ એકે = એક જ પ્રેમને
લાગ્યા છે	ચાહ્યાવાળા એક
એકે જાત = બ્રહ્મસૂદ્ધિઓની	તનવાળા છે
એક જ જાતિ	સબ એક = બધાના એક ઘની જ
સિફાત = સિફિત - મહત્ત્વ છે	મતા = એક માત્ર ઘન છે
સબ બાત = બધી વાતોથી	અરસ બકા = ઘામઘનીની
તેમના એક દિલી	અખંડ
પ્રેમ - સ્વરૂપના જ છે	વિસાત = સાધના રૂપી રૂપ પક્ષ
અર્થાત् ઘની રૂપ જ	સામગ્રીઓ છે

* મિલી માસૂક કે મોહોલ *

ભાવાર્થ-

પ્રિયતમ અને પ્રિયતમાના સંચોગમાં અધિકાધિક આનંદ ઉમડવાને લીધે એમના તન, મન અને વચન અણે પ્રેમાનંદમાં વિભોર થઈને એક રસ થઈ ગયા છે. બંનેના સ્વરૂપ, વિશેષતાઓ અને વાતો પણ એકાકાર થઈ ગઈ છે. તેમના રંગ-ઢંગ, સંગ અને અંગ-પ્રત્યંગ પરસ્પર અદ્રેત રૂપ ધારણ કરી લેવાને લીધે એક રસ થઈ ગયા છે. તેમના પ્રેમ અને આનંદ પણ એકાકાર થઈ ગયા છે. એટલું જ નહિ અખંડ પરમધામના પરચીસ પક્ષ તથા ધામ ધની આદિ ચાવત સમ્પદા પણ ધનીજુમાં જ એકાકાર થઈ ગઈ છે.

નાહીં જુદા કાંહી જાંહી અરસ માંહી,
 મિલે રૂણ બેલે દિલ એક હુએ ।
 તો કલૂબ કિબલા થયા મકબૂલ અલ્લા કહ્યા,
 અવલ આખર મિલે એક હુએ ન જુએ ॥૩॥

શબ્દાર્થ :-

નાહીં જુદા	= અલગ થયા જ નહીં	(ચરણ તલે જ તો
કાંહી જાંહી	= એ આત્માઓ ક્યારે	છે ને !)
પણ, જથ્યાં ક્યાંથાં		મિલે રૂણ = મળી ૧૨૦૦૦ રૂણો
પણ બેઠી છે.		આપસમાં
અરસ માંહી	= ધામમાં સ્થિત મૂલ મિલાવાની	ભેલે = જાગનીના ભણાંડમાં
અંદર		એકત્ર થયા
		દિલ એક = એ દિલ પોત-

* અષ્ટાદશોડધ્યાયः *

પોતાની પરાતમા	કબૂલ કરી તેમાં
સાથે એક (એકદિલી, એકાતમ)	વિરાજમાન થઈ
હુએ = થઈ ગયા	ગયા
તો કલુબ = ત્યારે એ	અવલ આખર = અવલ- મૂલ
આત્માઓના મારું	ધામમાં સાથે
હુદય	હતા અને
કિબલા = ધામ (ધર)	આખર પ્રજ,
ભયા = થયા (પ્રિયતમના)	રાસ અને
મકબૂલ = કબૂલ - મજુંર કર્યું, (ખુદાએ)	જાગનીના
અલા કહ્યા = અદ્રૈત બ્રહ્મ	બ્રહ્માંડમાં પુનઃ
એમના દિલોને	મિલે = મળી ગયા, સંયોગ થઈ
	ગયો
	એક હુએ = એકાતમ થઈ ગયા
	ન જુએ = અલગ થયા જ નથી.

ભાવાર્થ-

દિવ્ય બ્રહ્મધામ શ્રી પરમધામમાં ક્યાંચ પણ વિયોગ થયો જ નથી. ધામધનીની સાથે મળીને બ્રહ્માત્માઓ જાગનીના બ્રહ્માંડમાં એક દિલી રૂપ થઈ ગઈ છે. એટલા માટે બ્રહ્માત્માઓના હુદયને ધામધનીએ આપણા ધામના રૂપમાં સ્વીકાર કરી લીધાં, જેલ જોવા આવવાના પૂર્વ પણ એ બ્રહ્માત્માઓ ધામધનીની સાથે અદ્રૈત રૂપમાં હતી અને હવે જેલમાં તારતમ જ્ઞાન દ્વારા જાગૃત થઈને પણ તે પુનઃ પૂર્વવત् અદ્રૈત ભાવમાં આ રીતે પ્રવેશ થઈ છે કે માનો તે ક્યારે પણ અલગ થઈ જ નહિ.

* મિલી માસુક કે મોહોલ *

હક અરસ પરસ સરસ સબ એક રસ,
વાહેદત જિલવત નિસલત ન્યામત ।
મહામત અલમસ્ત હોએ આવે ઉમત લિએ,
પીવત આવત હક હાથ સરબત ॥૪॥

પ્રકરણ-૧૩, ચૌ. ૬૨.

શબ્દાર્થ:-

હક	= બ્રહ્માત્માઓ શ્રી પ્રિયતમની સાથે	થતાં જ એકાકાર થઈ ગયા
અરસપરસ	= ઓતપ્રોત થઈને (તારતમજ્ઞાન દ્વારા)	મહામત = મહામતિ દર્જમાં ઈન્ડ્રાવતી
સરસ	= સુંદર ઢંગથી, સરલતાથી,	અલમસ્ત = પ્રેમ મદમાં મસ્ત થઈને પ્રેમ વિભોર અવસ્થામાં
સબ	= ૧૨ હજાર બ્રહ્માત્માઓ	આવે = આવી રહી છે (ધામમાં)
એક	= એક જ પ્રિયતમના પ્રેમમાં	ઉમત લિએ = જમાત (પોતાની ૧૨૦૦૦ આત્માઓને) લઈને
રસ	= પ્રેમાનંદમાં નિમગ્ન થઈને	પીવત = પીતાં -પીવડાવતાં
વાહેદત	= અદ્રેત-એકદિલી	આવત = આવી રહી છે
જિલવત	= મૂલ ઘર	હક હાથ = પ્રિયતમ (શ્રી રાજજી) ના દિલ રૂપી હાથથી
નિસાબત	= પૂર્વ સંબંધી રૂપી	
ન્યામત	= ધની રૂપી ધન પ્રાપ્ત	

* અષ્ટાદશોડદ્યાયઃ *

સરબત = પ્રેમ રૂપી શરબતના

જૂલતી મસ્તીમાં

નશામાં જૂલતા-

ભાવાર્થ-

હવે તો વર્તમાન શ્રી પરમધામની સખિયો આ જાગનીના બ્રહ્માંડમાં પૂર્ણ રૂપથી જાગૃત થઈને પોતાના પ્રેમાસ્પદ રસરાજ ઘનીની સાથે એકાત્મ થઈ ગઈ છે. અદ્ભુત નિજધામની મૂલ મિલાવા રૂપી બેઠક તથા ત્યાંની સંપૂર્ણ સંપદાઓ એક ધામધનીથી જ સંબંધિત છે. અગ્રગણ્ય સખી શ્રી ઈન્દ્રાવતી મહામતિ દર્જામાં પહોંચીને આહૃપાન કરે છે કે જાગનીના બ્રહ્માંડમાં આત્માનંદની મદમસ્તીમાં ઉન્મતા થઈ પોતાના ધામની તે આત્માઓને સાથે લઈને તેઓને પ્રેમાસ્પદ પ્રિયતમ શ્રી રાજુના દિલ રૂપી હાથ દ્વારા પ્રેમ રૂપી મદિરા પીતા-પીવડાવતાં મદિરાના નશામાં ચૂર જૂલતા-જૂલાવતાં પ્રેમ-વિલોર અવસ્થામાં પ્રવેશ કરાવીને આવી રહી છું.

* બાઈ રે ગોહેલો વાલો ગોહેલી વાત કરે *

બાઈરે ગોહેલો વાલો ગોહેલી વાત કરે,

એહને કોઈ તમે વારો ।

દૂરજન દેખતાં અમને બોલાવે,

નિલજ ને ધુતારો ॥૧॥

* બાઈરે ગેહેલો વાલો *

શબ્દાર્થ :-

બાઈરે	= હે સખિયો ! હે	ઉર્ચય ઘરાનાના
	સુનંદરસાથજુ !!	(ઉર્ચય કુળના)
ગેહેલો	= દિવાના	મચાઈજનો
વાલો	= પ્રિયતમ ખ્યારે	(પુરોહિત કુલગુલાઓ)
ગેહેલી	= દીવાનાની જેમ	દેખતાં = જોતાં-જોતાં (તેમની સામે)
વાત કરે	= વાતો કરે છે	અમને = મને
એહને	= તેમને (પ્રિયતમને)	બોલાવે = છેડતી કરતાં બોલાવે છે
કોઈ	= તમારામાંથી કોઈ તો સમજાવો	નિલજ ને = તેઓને લજજા-શરમ તો આવતી નથી, તે નિર્લજજ તથા બેશરમ અને
તમે	= આપ લોકોમાંથી કોઈ ન કોઈ તો અને	ધૂતારો = છલિયા, ઠગ, ચિત્તચોર (દિલ) છે
વારો	= રોકો, સમજાવી દો કે હવે પછીથી મારી સાથે આવી વાતો ન કરે	
દૂરજન	= દુષ્ટ લોકો કુલીન	

ભાવાર્થ -

હે સખિયો-સુનંદરસાથજુ ! પ્રેમદિવાના પ્રિયતમ કનૈયા।
સણ્ણગુરુ દીવાના જેવી વાતો કરે છે. તેમને આપ લોકોમાંથી કોઈ તો
મોકા જોઈને રોકો, કોઈ તો સમજાવો કે હવે પછીથી મારી સાથે
આવી વાતો અથવા છેડખાની ન કરે. તે દીવાના તો લોકમચાઈએ

* અષ્ટાદશોડદ્યાયः *

પૂર્ણ ગામ - ધરના મર્યાદીજનો, કુલધર્મના કંઈ લોકોને જોતાં - જોતાં
પણ મને બોલાવે છે. અને મારો પીછો કરે છે. અરે ! એને કોણ
સમજાવી શકે અને કોણ મનાવી શકે ? એ તો બહુ નિર્લજ્જ તથા
બેશરમ છે. એટલું જ નહિ બહુ ચતુર, ચિત્તચોર તથા છગોનો
બાદશાહ તેમ જ છલિયા છે.

નિત ઉઠી આંગણ કે ઊભો,
આળ જ કરે અમારી ।
લોક માંહે અમે લજ્યા પામું,
હું કુલવધુઅા નારી ॥ ૨ ॥

શાબ્દાર્થ :-

નિત ઉઠી =	નિત્ય પ્રતિ સવારે	અમે	= મને
ઊઠીને		લજ્યા	= શરમિંદા
આંગણ કે =	ધરના પ્રાંગણમાં	પામું	= થવું પડે છે
ઊભો =	ઊભા - ઊભા (મારા દ્યતિજરમાં રહે છે)	હું	= હું તો સંસારની મર્યાદામાં બંધાઈ
આળ જ =	છેડતી - મશકરી	કુલવધુઅા	= કુળવધૂ, ધર્મ રક્ષક
કરે	= કરવા લાગે છે, દૂરથી જોતાં જ	(શાદીશુદા અને કુંવારીનું તેને ભાન જ નથી)	
અમારી =	મારી	નારી =	સ્ત્રી છું, ઓરત છું
લોક માંહે =	મર્યાદીજનોની અંદર		(મારી મર્યાદા પર દાગ લાગે છે).

* બાઈરે ગેહેલો વાલો *

ભાવાર્થ-

હે સખી ! સુન્દરસાથજુ !! એ છલિયા કનૈયા, ચિત્તચોર મારા
સદ્ગુરુ નિત્ય પ્રતિ સવારે ઊઠીને મારા ધરના આંગણમાં આવીને
મારા દીતંજારમાં ઊભો થઈજાય છે, અને તાકજાક કરે છે. મને જોતાં
જ કમર બાંધીને તેચાર થઈજાય છે તથા મશકરી - છેડતી કરતાં પૂછે
છ કે આજે મોદું કેમ કર્યું? શું સારી દુનિયાનો ભાર તારા ખભા
(કંધા) પર છે? આગળ - પાછળ ઊભેલાં કોઈપણ વ્યક્તિના
વિષયમાં તે વિચાર - વિવેક કરતો નથી. મારાથી દીવાનાની જેમ
વાતો કરવા લાગે છે. ગામ - ધરના મુખિયા, મર્યાદીજનોનો તો
તેને ખ્યાલ જ રહેતો નથી અને ચિંતા પણ રહેતી નથી તે કોઈની
પણ સામે મનમાની બોલે છે, દિલ્લગી તથા હંસી - મજાક કરે છે.
જેના કારણો મને બધાની સામે બેઇજજત, લજ્જત અને શરમિંદા
થવું પડે છે. હું સાંસારિક મર્યાદાઓમાં બંધાયેલી સાંસારિક મર્યાદા
નારી છું. મર્યાદા અને કુલ મર્યાદા પર પ્રતિષ્ઠિત હોવાને લીધે
કુલધર્મથી ડરું છું.

નાસંતી ક્યાંહે ન છૂટું એથી,
આડ જ બાંધે આવી ।
હું જણું રખે સાસુડી સાંભલે,
થાકી કહી કેહેવરાવી ॥૩॥

* અષ્ટાદશોડદ્યાયः *

શાબ્દાર્થ :-

નાસંતી	= લુકછિપીને ભાગવાથી	છું, ભાગું છે કે
પણ		રખે = એવી વાતો ન ફેલાય અને
ક્યાંહે	= કઈ રીતે પણ, ક્યારે	સાસુડી = મારા પુરોહિત
પણ		કુલગુજુલુપી સાસ
ન છૂટું	= બચી શકતી નથી	સાંભળે = સાંભળી લે(એની
એથી	= એ દીવાનાથી	એવી વાતો)
આડ જ	= હંસી-મજાક-મશકરી	થાકી = થાકી ગઈ છું (હું તો)
માટે		કહી = એને કહી-કહીને અને
બાંધે	= કમર કસીને (ધીતજારમાં કેછેવરાવી	(કહેવડાવી-
રહે છે)		કહેવડાવીને કે
આવી	= મારી પર તૂટી પડે છે	આવી હરકત ના
હું જાણું	= હું એ વિચારીને ડરું	કરે).

ભાવાર્થ -

હે સખી ! હે સુન્દરસાથજી !! એનાથી પોતાની ઈજીતની રક્ષા હેતુ છુપાઈને ભાગી અને પિંડ છોડાવી શકાતું નથી. હું ઈજીત બચાવવાની કેટલી કોશિશ કરું છું, પરંતુ બચી શકતી નથી અરે ! પ્રેમ દીવાના સદ્ગુરુ તો મારા દોષ્ટોની સામે જ મને ઘમકાવવા અને ફટકારવા લાગે છે. પ્રેમદીવાના બાબા (સદ્ગુરુ) ને શું ? એને તો કોઈ વાતોની ચિંતા - ફિકર જ નથી. મારા મિત્રગણ આવો વ્યવહાર જોઈને આપસમાં વાત કરતાં કહે છે કે અરે ! જુઓ !

* બાઈરે ગેહેલો વાલો *

જુઓ !! દિવાનનો છોકરો બાબાની પાછળ ! હે સખી ! કનૈયો તો કમર બાંધીને મારા પાછળ પડી ગયો છે, તે મને જોતાં જ મારાથી હંસી - મજાક, મશકરી કરવા લાગે છે અને એની આવી આદત જાણીને જ હું કાંપું છું, ભાગું છું અને ડરું છું કે ક્યાં આવી ચરિત્રપત્ર વાતો મારા કુલગુરુ રૂપી સાસુજીના કાનોમાં ન પહોંચી જાય, જેનાથી મને તેના આશિર્વાદ રૂપી બે-ચાર વચન હજમ કરવા પડશે. હું તો નગર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિની સંતાન, મર્યાદી કુલધર્મ રક્ષક અને સંસારી વ્યક્તિ છું. એટલા માટે એવો વ્યવહાર ન કરે, આ વિષયમાં મેં કેટલીય વાર હાથ જોડીને વિનંતી કરી છે. એને સમજાવતાં - સમજાવતાં તથા બીજાના દ્વારા સમજાવવાના કંઈયો - કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ હેરાન પરેશાન થઈ ગઈ, થાકી ગઈ, નિરાશ થઈ ગઈ. તે માને, તો ન !

વારતાં વળગતાં વાલે,

જોરે સાંઈડા લીધાં ।

કહે મહામતિ સુણો રે સખિયો,

વાલે એહી પેરે ગેહેલડા કીધાં ॥૪॥

શબ્દાર્થ :- પ્રકરણ-૧૪, ચૌ. ૬૬.

વારતાં = રોકતા, રોકવતો

વળગતાં = ઝપટી જ લે

વાલે = દીવાના-ખ્યારાએ

જોરે = જબરદસ્તી મને

સાંઈડા = પરમાત્મા પ્રિયતમે

પકડી લીધાં અને

લીધાં = પોતાના બનાવીને જ

ઇડ્યા

* અષ્ટાદશોડદ્યાયઃ *

કહે	= બધાને સાવચેત	સભિયો	= મારી સભિયો	
	કરતાં કહે છે	વાલે	= પ્રિયતમ ખ્યારાએ	
મહામતિ	= મહામતિ દર્જામાં	એણી પેરે	= આ રીતે મને પણ	
	થઈને ઈન્દ્રાવતી	ગેહેલડાં	= પોતાના જેવી	
સુણોરે	= સાંભળો હે		પ્રેમદીવાની બનાવી	
			કીધાં	= આહલાદિત કરી દીધાં.

ભાવાર્થ-

હે ઘામસ્થ સાથજુ ! હે મારી સભિયો !! સાંભળો ન, રોકટોક
કરતાં - કરતાં, ભાગતાં - બચતાં પણ બાબા સદગુરુએ ઝપટીને
મને પકડી જ લીધાં. અરે ! તે પરમાત્મા રૂપી ખ્યારા દીવાના પ્રિયતમે
મને જબરદસ્તી પોતાના બનાવી જ છોડ્યા હવે તો હું તેમની થઈ
ગઈ. ઉક્ત પ્રકારથી મહામતિ દર્જામાં અગ્રગણ્ય સખી ઈન્દ્રાવતી
પોતાની જમાત પ્રત્યે ખુલ્લા આહવાન કરે છે કે હે મારી
બ્રહ્મપ્રિયાઓ! સાંભળો ન !! મારા ખ્યારા પ્રિયતમે આ પ્રમાણે
મને પણ સ્વયં પોતાની જેમ પ્રેમ દીવાના જ બનાવી દીધાં મને
આહલાદિત કરી નિહાલ કરી દીધાં. હવે તો કંઈ પણ બાકી રહ્યું
નહિ.

* બાઈ રે વાત અમારી હવે કોણા સુણો *

બાઈ રે વાત અમારી હવે કોણા સુણો,
અમે ગેહેલાને મળિયા ।
એહનો નેહેડો સુણીને હું તો ઘણુએ નાઠી,
પણ સું કીજે જે પાંણો પડિયા ॥૧॥

* બાઈ રે વાત અમારી હવે *

શબ્દાર્થ :-

બાઈ રે = હે સખી તથા	સુણીને હું તો = સાંભળીને હું તો
સુંદરસાથજી!	ઘણુએ નાઈ = ભાગવાની બહુ
વાત અમારી = મારી વાતોને	જ કોશિશ કરી
હવે કોણા સુણો = હવે કોણા	પણ સું કીજે = પરંતુ શું કરું?
સાંભળશો ?	અથવા કેવી
અમે ગોહેલાને = મને તો દિવાના	રીતે કરું ?
જ	જે પાંછો = જે એ તો હાથ ધોઈને
મળિયા = મળી ગયા	પડિયા = મારી પાછળ પડયા
એહનો નેહેડો = એનો પ્રેમ	છે.

બાવાર્થ -

હે સખી તથા સુંદરસાથજી ! હવે તો મારી વાતો કોણા સાંભળશો અને કોણા મારાથી વાત કરશો ? કેમ કે મારી સંગત તો એક મદમસ્ત ઉનમાઈ (ગાંડા-ધેલા) સાથે થઈગઈ છે. તેના પ્રેમમય ચાલ-ચલનને જોઈને મેં તેનાથી દૂર ભાગવા માટે કઈયો પ્રયાસ કર્યા, કેટલીય કોશિશ કરી, પરંતુ શું કરું-કેવી રીતે કરું? તેનાથી કેવી રીતે બચું ? તે તો સ્વયં જ મારી પાછળ પડયા છે.

હું માં હુંતી ચતુરાઈત્યારે પાંચમાં પુછાતી,
 તે ચિતડાં અમારાં ચલિયાં ।
 માન મોહોત લજ્યા ગઈ રે લોપાઈ,
 અમે માણાસ માંહેથી ટળિયાં ॥૨॥

શબ્દાર્થ :-

હું માં હુતી = મારામાં હતી જ્યારે	આવી ગયું
ચતુરાઈ = રાજનીતિક ચતુરાઈ	છે.
હોશિયારી	માન મોહોત = માન સન્માન,
ત્યારે પાંચમાં = ત્યારે તે સમયે	પ્રતિષ્ઠાદિ
તો પાંચ જણ (લોકો)	લજ્યા ગઈ = લાજ-શરમ બધું નિર્મળ થઈને
પુછાતી = પૂછતાછ, જાંચ	રેલોપાઈ = અરે ! અદશ્ય થઈ
પડતાલ કરવા આખ્યા	ગયું છે
કરતાં હતાં	અમે માણસ = હું તો સ્વયં
તે ચિતડાં = તે સમયના ચિત્તમાં	મનુષ્ય
જ	માહેંથી = થી પણ અનુઠા જ
અમારાં ચલિયાં = મારું	ટળિયા = લિન્ન જ બની ગયો
પરિવર્તન	છું.

ભાવાર્થ -

જ્યારે મારામાં અગાધ ચતુરાઈ - હોશિયારી હતી, ત્યારે મને દસ-દસ બુદ્ધિજીવી વિદ્ધાન આદિ ઈજ્જત આપ્યા કરતાં હતાં અને મારાથી સલાહ લેતાં હતાં, હવે મારું તે ચિત્ત જ ડગમગી ગયું છે. મારી તે ચતુરાઈ, હોશિયારી વગેરે બધું જ ચૂર-ચૂર થઈ ગયું છે. તે સમય જો જેટલું પણ માન-સન્માન, શાનશોકત, ગૌરવ - બડપન, ઈજ્જત - બડાઈ (મોટાઈ), નામ-યશ વગેરે હતું અરે ! તે બધું જ વિલીન-અદશ્ય થઈ ગયું છે. હવે મને તે મર્યાદીજનો,

* બાઈ રે વાત અમારી હવે *

બુદ્ધિજીવીઓમાં કેવી રીતે ગણવામાં આવે. હું તો હવે ગણવા ચુક્ત રહ્યો નહિ.

માણસ હોએ તે તો અમને માં મળજો,
જો તમે ગેહેલાઈએ હલિયા ।
ઓલ્યા વારસે વઢસે ખીજસે તમને,
તો હે આવસો તે આંહી પલિયા ॥૩॥

શબ્દાર્થ :-

માણસ = યદિ રાજનીતિજ્ઞ	સર્જનો,) ને તે
હોએ = મચાઈ બુદ્ધિજીવી	રાજ નિતિજ્ઞ
મનુષ્ય હોય	સાંસારિક જન
તે તો અમને = તમે લોકો, તો	રોકશો
મારી સંગત	
કરશો નહિ	
માં મળજો = મને ન મળશો	વઢસે ખીજસે = મના કરશો,
જો તમે = અગર જો તમે લોકો	નારાજ થઈ
પણ મારા જેવા	જશો, અને
ગેહેલાઈએ = દીવાના બનીને જ	લડશો પણ
હલિયા = ઘૂમવા-ફરવા ચાહતા	
હોય	તમને = તમને લોકોને
ઓલ્યા વારસે = તે (મચાઈ	તોહે આવસો = ત્યારે પણ તે
	તને છોડશો નહીં
	પાછળ પડી જ
	રહેશો

* અષ્ટાદશોડધ્યાયः *

તે	= તે લોકો	પણ તમારો
અંહી પલિયા	= અહીં સુધી	પીછો કરશે.
ભાવાર્થ-		

એટલા માટે હું બધાને આહવાન (પડકાર) કરતાં કહી રહ્યો છું કે-જુઓ ! સાંભળો !! જેને -જેને સમાજમાં મર્યાદી, પ્રતિષ્ઠિત બની રહેવું છે. તે તો મને ન મળે. મારાથી બચીને રહે, મારી પાસે ન આવે, અગર જો કદાચિત તમને લોકોને પણ એ દીવાનાપન પ્યારું લાગે છે, તો જ તમે લોકો મારી સંગતમાં આવવાની ચોષ્ટા કરજો. ચધપિ તે ચતુર બુદ્ધિજીવી, મર્યાદીજન - રાજનીતિજ્ઞ લોકો તને રોકશો, ફટકારશો, પાછળ પડીને પણ ઘમકાવશો, અંતક મચાવશો, તમારા લોકોથી ઝઘડા કરશો, લેકિન તમે પણ દીવાનાની જેમ જ વ્યવહાર કરવા લાગશો. તમારા જીવનમાં પણ મારી જેમ જ પરિવર્તન આવી જશો. તમારું જીવન જ પલટી જશો.

ગેહેલે વાલે અમને કીધાં ગેહેલડાં,
મળીને ગેહેલાઈએ છલિયા ।
જાત કુટમથી જુઆ થયાં,
હદ છોડીને બેહદમાં ભળિયા ॥૪॥

શબ્દાર્થ :-

ગેહેલેવાલે	= મારા દિવાના	દીધાં હોય
ખ્યારા પ્રિયતમ	= ગેહેલડાં	= દિવાના જ
અમને કીધાં	= મને પણ બનાવી	મળીને = આપ દિવાના

* બાઈ રે પાત અમારી હવે *

ગોહેલાઈએ = ના સમાટે મને	બનાવી દીધાં
મળીને મને ઠગી લીધું	હદ છોડી = હદનું સ્કેત્ર (એરિયા) છોડીને હું તો
છલિયા = મારાથી છલ કીધું	બેહદમાં = બેહદ-પ્રેમમય
જાત કુટમથી = જાત-પાત, કુળ કુટુંબ, કબિલા વગેરેએ પણ	ભૂમિકામાં જ ભળિયા = એકાત્મ સ્વરૂપ બની ગયા (બનાવી દીધાં).
જુઆ થયાં = અલગ, અંજાળ	

ભાવાર્થ-

હે સખી, સુંદરસાથજી ! તે મદમસ્ત દિવાના પ્રિયતમે તો
મને પણ મદમસ્ત દીવાના બનાવી દીધા. મને છલીને ઠગી લીધું.
હવે તો અમારી નાકમાં જાત-પાત, કુટુંબ-પરિવાર વગેરેના બંધન
રૂપી નથણી હતી, તે પણ કાપીને પડી ગઈ છે. અતઃ હવે હું માચા-
મગતા રૂપી હદ ભૂમિકાના બંધનને લાંઘી (ઉલ્લંઘન) કરીને બેહદ
માચાતીત ભૂમિકામાં નિઃશંક રૂપેણ પહોંચી જઈશ.

દૈખીતાં સુખડાં મેંતો નાખ્યાં ઉડાડી,
કુટેતર કુખે નવ બલિયા ।
ઓહની ગોહેલાઈએ અમને એવા કીધાં,
જઈને અક્ષરાતીતમાં ગલિયા ॥૫॥

* અષ્ટાદશોડદ્યાયः *

શબ્દાર્થ :-

દેખીતાં સુખડાં = જોતાં-જોતાં	દીવાનાપને
જ પ્રત્યક્ષ	અમને એવા = મને પણ તેવા જ
ભૌતિક	દીવાના
સુખને	કીધાં = બનાવી દીધાં, જેના ફલ
મેં તો નાખ્યાં = તો મેં તો	સ્વરૂપ
પરિત્યાગ કરી	જઈને = હું તો સજિલે (સરલ)
દીધાં, હુકરાવી	અક્ષરાતીતમાં = અક્ષરાતીતમાં
દીધાં	અક્ષરાતીત
ઉડાડી = ઉડાવી દીધાં.	અદ્રેત બ્રહ્મ
દુસ્તર દુખે = દુઃસાધ્ય, વિકટ,	શ્રી રાજજી
અથાહ દુઃખ	સ્વરૂપમાં
કષ્ટમાં પણ	ગાલિયા = જઈને એકાકાર થઈ
નવ જાલિયા = ન હડબરાઈ, ન	ગઈ (પ્રત્યક્ષ
તો ગબરાઈ પણ	ધણીના ગળે વળગી
એહની ગેહેલાઈએ = તેના	ગઈ).

ભાવાર્થ-

જુઓ - સાંભળો ! મેં તો જોતાં - જોતાં જ સાંસારિક સુખ-
ચેન, અત્યંત આનંદદાયક સુખ પ્રદાન કરવાવાળા જીવનને
તિલાંજલી આપી દીધી. એના બદલામાં મળ્યા અતિ ભયંકર,
દાર્ઢણા (ભયાનક, તીવ્ર) કઠોર, કંપાયમાન દુઃખ કષ્ટને પરિલંઘન

* બાઈ રે વાત અમારી હવે *

કરીને નીકળવા માટે કમર બાંધવા વિષયમાં હું ન હડબડાઈ અને ન ગલરાઈ પણ લેક્કિન એના દીવાનાપને તો મને સમસ્ત સંસારના પ્રત્યે જ એવા અનુઠા અને ટેઢા બનાવી દીઘાં કે હું ગિરનાર પર્વત પર ચઢીને (અક્ષરધામ સુધી પહોંચીને) ત્યાંથી છલાંગ લગાડી (કુદ્કો - ભૂસકો મારી) ને આગળ અક્ષરાતીતમાં સ્થિત પોતાના પ્રિયતમને મળવા માટે મદમસ્ત રૂપથી તદ્વીન થઈને ગળે વળગી ગઈ.

બાઈ રે ગ્યાન સબદ ગમ નહીં રે નવદ્યાને,
વેદ પુરાણો ન કલિયા ।
એ વાત ગોહેલડી કરે રે મહામતિ,
મારે અખંડ સુખ કુલે ફલિયા ॥૫॥

શબ્દાર્થ :- પ્રકરણ-૧૫, ચૌ. ૭૨.

બાઈ રે = હે ઘામસ્થ સુંદરસાથ	ઝપી સાધનાની તો
અને હે સભિયો !	વાત જ શું કરવી ?
ગ્યાન સબદ = જ્યાં જ્ઞાન અને	વેદ પુરાણો = વેદ, પુરાણ આદિ
શબ્દોને	કોઈપણ ગ્રંથ
પહોંચવું જ	એને ખુલસ્ત
ગમ નહીં = દુર્લભ છે	રૂપણ કરી
રેનવદ્યાને = તો નવદ્યા ભક્તિ	ન કલિયા = શક્યા નહિ

* અષ્ટાદશોડદ્વારાયઃ *

એ વાત = આ વિષયની વાતો	અવિનાશી
તો	સુખ = પ્રેમાનંદ રૂપી
ગોહેલડી = પ્રેમ દીવાની સખી	સુખાનંદ રૂપી
શ્રી ઈન્દ્રાવતી	આત્મીય
કરે રે = કરે છે	કુલે ફંલિયા = કુલ ખીલીને ફળ્યું
મહામતિ = મહામતિ દર્જમાં	છે હવે તો હું
રહેલી	મદમસ્તી ઉંમત
મારે અખંડ = મારે તો હવે અખંડ	થઈ ગયો છું.

ભાવાર્થ-

હે સખી તેમ જ સુંદરસાથજુ ! જ્યાં જે જગ્યાએ જ્ઞાનનો મર્મ-
બેદ રહસ્ય અથવા તાત્પર્ય સુધીના પહોંચવા વિષયક શબ્દાદિની
તાકાત શક્તિને પહોંચવું જ અત્યંત દુર્લભ છે અને નવધા ભક્તિના
ભાવાદિથી પણ જે ભાવાતીત અગમ્ય છે. વેદ, શાસ્ત્ર, પુરાણા,
ઉપાનિષાદિના જ્ઞાન પણ જે રહસ્યને પ્રાપ્ત ન કરી શક્યા. અતઃ
એવા અવિનાશી સુખના પ્રત્યે મહામતિ દર્જમાં સ્થિત ધામસ્થ
અગ્રગણ્ય સખી શ્રી ઈન્દ્રાવતીજુ કહે છે કે તે પ્રેમાસ્પદ (પ્રેમ
સ્વરૂપ) પ્રેમોન્માદ પ્રાણાચ્ચારા મારા દિવાના પ્રિયતમે તો મને તે
પરાત્પર અક્ષરાતીત અદ્ભુત ભ્રલધામના અખંડ અવિનાશી મૂલ
સુખમાં પહોંચાડી દીધાં.



* પ્રીત પ્રગટ કેમ *

* પ્રીત પ્રગટ કેમ કીજિએ *

પ્રીત પ્રગટ કેમ કીજિએ,
કીજિએ તો છાની છિપાએ, મેરે પીઉજુ ।
તુંતો નિલજ નંદનો કુમાર
મેરે પીઉજુ // ૧૧

શબ્દાર્થ :-

પ્રીત પ્રગટ	= પ્રેમ જાહેર	શકીએ છીએ
કેમ કીજિએ	= કઈએ અને કેવી	મેરે પીઉજુ = મારા પ્રિયતમજુ
રીતે કરું ? કરી		તુંતો = આપ સ્વયં તો
શકાતો નથી		નિલજ = નિર્લક્ષ અને બેશરમ છે
કીજિએ તો	= કરવી હોય તો	નંદનો કુમાર = હે નનદનાનદન !
છાની છિપાએ	= ચુપચાપ	મેરે પીઉજુ = હે મારા પ્રિયતમ !
	છુપીને જ કરી	

ભાવાર્થ -

હે પ્રિયતમ, ધામઘની, સદગુર વાલાજુ ! પ્રેમ દેખાડવાની વસ્તુ નથી. પ્રેમનું પ્રદર્શન કોઈએ પણ કર્યું નથી. પ્રેમ તો કોઈ સુમસામ એકાંત સ્થાન પર બીજાઓથી છિપીને જ આપસમાં વ્યક્ત કરી શકીએ છીએ. હે નનદકુમાર, હે ધામ ધણી વાલાજુ ! આપ સ્વયં તો અત્યંત બેશરમ - નિર્લજજ જ ઠહર્યા. કંઈ પણ માનવા ચા

* અધ્યાદશોડદ્યાચઃ *

સાંભળવા નથી ચાહતા, ન આપને કોઈની લાજ-શરમ આવે છે
અને ન સંકોચ જ થાય છે. આપને બુદ્ધિ-સુદ્ધિ, માન-પ્રતિષ્ઠાની
તો ચિંતા જ નથી. દુનિયાની સામે લાપરવાહ મદમસ્ત થઈને કોઈને
કંઈ જ ગણતા અથવા માનતા જ નથી. અરે ! પ્રેમ તો અન્તઃપુરમાં
પણ પડાની અંદર આદાન-પ્રદાન કરવાની ચીજ છે. પ્રેમ કરવાથી
પહેલાં પ્રેમ કરવાની રીત તો સમજો !

તું દેખ ભયો મોહે બાવરો,
મૈં કુલવધુઆ નાર ।
તું રોક રહ્યો મોહે રાહમે,
ઘડી ભઈ દોએ ચાર ॥૨॥

શાસ્ત્રાર્થ :-

તું દેખ ભયો	= આપ (તમને)	નાર	= સ્ત્રી છું
તો જોઈને જ		તું રોક રહ્યો	= તમે રોકો છો
થઈ ગયા		મોહે રાહમે	= મારા રસ્તાને
મોહે બાવરો	= મને, દીવાના	ઘડી ભઈ	= સમય વ્યતીત જ
જેમ મોહિત			થઈ જાય છે.
મૈં કુલવધુઆ	= હું તો કુળવધુ	દોએ ચાર	= એક દોઢ કલાક

ભાવાર્થ -

હે નનદનનન ! તમે તો મને જોતાં જ પોતાનો હોશોહવાસ

* પ્રીત પ્રગટ કેમ *

(હોશ કોશ) ગુમાવી દીવાનોની જેમ બની જાવ છો ? હે મારા ઘણી ! આપ તો મને જોતાં જ મારા પ્રત્યે મનમોહિત થઈ દીવાના બની જાવ છો. અરે ! હું તો ઉચ્ચ કુળ ઘરાનાની કૂળવધુ છું. શું આપ (તમે) મને કુલટા સમજુ રહ્યા છો ? હું ઊંચા ઘરાના તેમ જ પ્રતિષ્ઠિત કૂળના રક્ષક દિવાનનો પુત્ર છું કન્હૈયા ! તમે મને જ્યાં મળો છે, ત્યાં મારો રસ્તો કેમ રોકો છો ? ઘંટા - દોઢ ઘંટા (કલાક બે કલાક) એમ જ બરબાદ કરી રહ્યા છો. હે ઘણી ! સચિવ (મંત્રી) નો છોકરો અર્થાત् ચાલાક, ચતુર હોવાં છતાં પણ આપ મને જોતાં મારી પર મોહિત થઈ જાવ છો ? મને છલ દ્વારા વશમાં કરીને ફસાવવામાં પોતાની ઈજીત, માન પ્રતિષ્ઠા જુઓ છો. મારા માટે, મારા ઈંતજારમાં ઘંટા દોડ ઘંટા સુધી ચર્ચા-કથા જ બંધ કરીને બેસી જાવ છો, મારી રાહ જોતાં રહો છો અને જ્યારે હું આવું છું, ત્યારે બ્યંગચ (કટાક્ષ) કરતાં મને ડાંટો છે. હું એક કુલીન (ખાનદાન), મર્યાદી કુળરક્ષક તેમ જ પ્રતિષ્ઠિત બ્યક્તિ છું, એને તો આપ (તમે) વિચાર જ નથી કરતાં .

ગલિયનમેં દુરજન દેખે,
તોમેં નહીં વિચાર ।
તું કામી કદ્દૂ ના દેખહીં,
પર સાસુડી દે મોહે ગાર ॥૩॥

* અષ્ટાદશોડધ્યાયः *

શાબ્દાર્થ :-

ગલિયનમે	= ગલી ગલીમાં	વ્યાકુળ	
દુરજન દેખે	= દુષ્ટ બદમાશ	કદ્ભૂ ના	= કંઈપણ ન જુએ
મયાઈજન જુએ છે		દેખ હીં	= બધું જ જોયું ન જોયું
તોમેં નહીં	= આપ(તમારા) માં	પર	= પરંતુ
નથી		સાસુડીદે	= સાસુજુની
વિચાર	= વિચાર-વિવેક		બક્ષિસ(ગાળો)
તૂં કામી	= આપ તો કામાતુર	મોહે ગાર	= મને દુર્વાચય ગાળો
			સાંભળવી પડે છે

ભાવાર્થ -

હે નન્દનન્દન ! આપને તો આ વાતનો પણ વિચાર કર્યો જ
નથી કે ગલી-ગલીમાં મર્યાદી પ્રતિષ્ઠિત દુર્જન છુપાયેલાં શોધતાં
રહે છે. આપ (તમે) તો વિચાર કર્યા વગર કામાતુર - વ્યાકુળ થઈને
બધું જ જોયું ન જોયું (અનદેખા) કરી દો છો, પરંતુ મને તો ઘરમાં
સાસુજુના દુર્વાચયયુક્ત ગાળો રૂપી બક્ષિસ ગ્રહણ કરવી અને સહન
કરવી પડે છે. હે ઘામધણી સદ્ગુરુ ! તમને તો આ વાતનું પણ
ધ્યાન નથી કે મર્યાદી પ્રતિષ્ઠિત ઘરાનાના સચિવ (મંત્રી) ના
છોકરાની પણ કોઈ ઈજ્જત હોય છે. આપને તો મારી ઈજ્જતની
પણ પરવા કરવી જોઈએ. રસ્તામાં મર્યાદીજન, બુદ્ધિજીવી લોકો
મને જુએ છે. કેટલાં તો મારી સાથે પણ આવે છે અને મને તમારી
પાસે જતાં જોઈને વિચારે છે કે અરે ! સચિવ (મંત્રી) નો છોકરો ક્યાં
જઈ રહ્યો છે? દીવાનનો છોકરો સાધુ બાબાની પાછળ-પાછળ ! એ

* પ્રીત પ્રગટ કેમ *

કહીને હસી-મજાક કરે છે આપ (તમે) તો જ્ઞાનની મસ્તીમાં મદમસ્ત
રહો છો. આપને તો મારા ધરાનાની, કુળાચારોની ઈજ્જતનો પણ
ખ્યાલ નથી. ઉપરથી મને આ પ્રકારના વચન પણ સંભળાવો છે.
મને કુલપુરોહિત રૂપી સાસુના દુર્વાચય - ગાળો સાંભળવી પડે છે,
સહન કરવી પડે છે કે “અરે ! કુળધર્મ, ઈજ્જત, માન-પ્રતિષ્ઠાનું
તો એને ધ્યાન જ નથી. સચિવ-દીવાન ધરાનાનો થઈને બાબાની
પાછળ ભટકી રહ્યો છે” એવું બધું સહન કરવું પડે છે.

કર જોરે કુચ મરોરે,
અંગિયા નખન વિડાર ।
અધુર ન છોડે દંતસો,
કરોગે કહા અબ રાર ॥ ૪ ॥

શબ્દાર્થ :-

કર જોરે = હાથથી જબરદસ્તી	ન છોડે = નથી છોડતા
કુચ મરોરે = સ્તનોનું મર્દન	દંતસો = દાંતોથી દબાવીને
કરો છો	જકડી લો છો
અંગિયા = ચોલીને	કરોગે કહા = કરવું છે શું
નખન = નખોથી	અબ રાર = હવે કેવું ચુલ્હ અથવા
વિડાર = છિન્ન-લિન્ન કરી દીધી	કેવા કલહ મચાવવા
અધુર = અધુરોઝોને	છે?

ભાવાર્થ-

હે નજદનજદન, હે પ્રિયતમ ધામધારી! આપના આ નટખટ સ્વભાવયુક્ત ચરિત્રનું હું કેવી રીતે વર્ણન કરું? તમે જબરદસ્તી તમારા હાથોથી મારા સ્તનોનું મર્દન કરી દીધું અને મારી ચોલી પણ તમારા નાખુનોથી છિન્ન-ભિન્ન કરીને ફાડી નાંખી. મારા અધુરોષ્ઠોને તમારા દાંતોથી મને જકડી રહ્યા છો. હવે આટલું કર્યા પછી પણ કોઈ બીજું ચુદ્ધ અથવા કલહ મચાવવાનું વિચારી રહ્યા છો? તમે તો જ્ઞાનમાં મદમસ્ત થઈને કામાતૂર -વ્યાકુળ થઈ જાવ છો. તમે તો ફોસલાવી - ફોસલાવી (પટાવી-પટાવી)ને જ મારા દિલ રૂપી કુચ્ચોને માયાથી છોડાવી - મરોડીને મૂલ ભિલાવામાં લગાવી દીધાં - ફેરવી દીધાં. આપને મારી કુળમચ્છિદા રૂપી ચોલીને જ્ઞાન રૂપી નાખુનોથી ઘજિયા (ચીથરા) ઉકાડીને તેને છિન્ન-ભિન્ન કરી દીધી તથા ઘૃણિત(ન કામી) બનાવી દીધી. મારી શંકા-ઉપશંકા રૂપી અધુરોષ્ઠોને તમારા (આપના) જ્ઞાન અને પ્રેમ રૂપી દાંતોથી જકડીને મને નિઃશંક વિશ્વાસના પાત્રે બનાવી દીધી મને જકડીને આપથી (તમારાથી) અલગ (જુદા) ન થવા દેશો તથા બચીને ભાગીને ન જાય તે માટે આ પ્રમાણો પોતાના વશમાં કરી લીધું કે હવે કશુંચ બાકી જ કચ્ચાં રહ્યું? હવે એના પછી શું કરવાનો વિચાર છે? શું બીજું પણ કંઈ લડાઈ - ઝડપ અથવા કલહ મચાવવાનો બાકી છે?



તું બાલક નેહ ન બુઝ હી,
મૈં બરજયો કેતીક બાર ।
મૈં મેરો કિયો પાઈયો,
અબ કાસોં કરો પુકાર ॥

શાબ્દાર્થ :-

તું બાલક	= આપ તો અબોધ બાળક છે	મૈં મેરો કિયો = મેં પોતાના
નેહ ન	= પ્રેમ - સનેહ નથી	નસીબ પ્રારંભ કર્મોના
બુઝ હી	= સમજુ શકતા	પાઈયો = પરિણામ - ફલ પ્રાપ્ત કરી લીધું
મૈં બરજયો	= મેં તો રોક્યા, મના કરી	અબ કાસોં = હવે કોણી સાથે
કેતીક	= કઈયો	કરોં = કેવી રીતે કરું ?
બાર	= વાર, વખત	પુકાર = વિનંતી

ભાવાર્થ-

હે નન્દકુમાર ! આપ (તમે) તો બિલકુલ અબુધ બાળકની ઉંમરના અવસ્થાના કારણે એવું કરો છો. તમારામાં અક્કલ, બુદ્ધિ હોય તો ને ? તમે તો કાચી અક્કલવાળા બાળકની જેમ છો. અતઃ નેહ, (ખ્યાર, નેડો) પ્રેમ જેવી વસ્તુ શું હોય છે, કેવી હોય છે, આ પાતની તો આપને તનિક પણ સમજ નથી, શું કરે! કાચો કોમલ - સુકુમાર ઉંમરનો નટખટ અબુધ - અબુઝ બાળક સનેહ - પ્રેમ જેવી

* અષ્ટાદશોડદ્યાયઃ *

થીજને શું સમજે ? મેં તો કેટલીય વાર રોક્ખો અને મનાઈ પણ કરી. વારંવાર કેટલાય પ્રકારથી બતાવવાની તથા સમજાવવાની પણ કોશિશ કરી, પરંતુ સમજે યા માનો તો ન ! હવે તો મેં પૂર્વ જન્મમાં જેવા પણ કર્મ કર્યા હતા, પૂર્વ પ્રારબ્ધ કર્માનું ફળ જ તો મળી રહ્યું છે. એ વિચારીને સંતોષ કરું છું. કેમ કે પૂર્વજન્મના કૃતકર્મ શુભ હો યા અશુભ, શિરોધાર્ય તો અવશ્યમેવ કરવું જ પડે છે. હવે હું કોની આગળ વિનંતી કરું અથવા નિવેદન ચઢાવું ?

સાડી ફારી કંઠસર તોડી,
તોડ્યો નવસર હાર ।
અબ ઘર કૈસે જાઈએ,
ઉલટાએ દિયો સિનગાર ॥૫॥

શબ્દાર્થ :-

સાડી ફારી = સાડીને ફાડીને	પણ
ચીંથરા - ચીંથરા	અબ ઘર = હવે એના પછી ઘરમાં
બનાવી દીધાં.	કૈસે જાઈએ = શું મોકું (મો)
કંઠસર = કંઠ (ગળા) નું ઘરેણું	લઈને જઉ?
તોડી = તોડી દીધું	ઉલટાએ = ઉલટા-પુલટા
તોડ્યો = તોડી દીધો	દિયો = કરી દીધો
નવસર હાર = નવ સેરનો	સિનગાર = મારો સિંગાર જ
સોનાનો હાર	

ભાવાર્થ-

હે નન્દનન્દન ! હે ધામધણી પ્રિયતમ !! આપને (તમે) તો
મારી સાડીને ફાડીને ચીથરા-ચીથરા કરી દીધાં અને કંઠ (ગળા)
માં સ્થિત કંઠસર પણ તોડી દીધી તથા તેની સાથે જ મારા સોનાનો
નવ સેરનો હાર પણ તોડી - તોડીને વિખરાઈ દીધો. હવે આ
અવસ્થામાં હું મારી ઘેર કેવી રીતે પ્રવેશ કરી શકીશ ? શું મોં લઈને
જાંઉં ? કેમ કે આપને તો મારા સિંગારના બધા અલંકારોને ઉલટા-
પુલટા કરીને છિન્ન-ભિન્ન કરી નાંખ્યા. આપને તો મારી લોકમર્યાદા
રૂપી સાડીને ફાડીને દ્વંસ કરી નાંખી અને વેદમર્યાદા રૂપી કંઠસરના
બાળ-બરચાં, પરિવારના પ્યાર-મમતા રૂપી મોતીઓને વિખેરીને
નષ્ટ કરી નાંખ્યા સાથે નવધા ભક્તિ રૂપી નવસેરના હાર પ્રત્યે
અર્થાત् ધાર્મિક પ્રેમ-શ્રદ્ધા પણ હટાવી દીધી. હવે હું આ હાલતમાં
મારી ઘેર કેવી રીતે, શું મોહું લઈને જઉં? મારી શું ઈજ્જત રહી ગઈ ?
મને જોઈને લોકો શું સમજશે અને શું કહેશે ? આપને તો મારો સિંગાર
જ ઉલટ-પુલટ કરી છોડી દીધો છે.

અબ મિલ રહી મહામતિ,
પીઉસોં અંગોં અંગ ।
અક્ષરાતીત ધર અપને,
લે ચલે હું સંગ ॥૭॥

પ્રકરણ-૧૯, ચૌ. ૭૮.

શબ્દાર્થ :-

અબ મિલ =	હવે તો આ જાગની	અંગ =	દિલ મિલાવીને,
રહી	= રાસમાં ધનીની		એક રૂપ થઈને
	સાથે એકાકાર		અક્ષરાતીત = અક્ષરબ્રહ્મથી
	થઈને મળી ગઈ		પણ પરે
મહામતિ =	મહામતિ દર્જમાં		અક્ષરાતીત
	સ્થિત શ્રી	ઘર અપને =	ઘરમાં પોતાના
	ઇન્દ્રાપતી		પ્રિયતમ ધનીએ
પીઉસો	= પોતાના પ્રિયતમ		પણ
	ધનીની સાથે	લે ચલે =	મને લઈને પ્રયાણ કર્યું
અંગો	= ધનીના દિલથી	હેંસંગ =	સાથમાં

ભાવાર્થ -

હવે તો આ જાગનીના બ્રહ્માંડના જાગની રાસમાં બાકી જ શું રહી ગયું? આ જાગનીના બ્રહ્માંડના જાગની રાસમાં મહામતિ દર્જમાં સ્થિત ઇન્દ્રાપતી પોતાના પ્રિયતમ ધનીના દિલથી દિલ તેમ જ સવાગ દ્વારા એકાકાર થઈને એક રૂપ થઈ ગઈ છે. તત્પર્યાત્મક કૂટસ્થ અક્ષરથી પણ પરે અક્ષરાતીત સ્વધામ, પોતાના પતિના ઘરમાં સ્વયં પ્રિયતમ ધનીએ પણ મને સાથે લઈને પ્રસ્થાન કર્યું.

* સરૂપ સુનદર સનકૂલ *

* સરૂપ સુનદર સનકૂલ સકોમલ *

સરૂપ સુનદર સનકૂલ સકોમલ

રહુ દેખ નૈના ખોલ નૂર જમાલ ।

ફેર ફેર મેહેબૂબ આવત હિરટેં

કિયા કિનને તેરા કૌલ ફૈલ એ હાલ ॥૧॥

શબ્દાર્થ :-

સરૂપ સુનદર = શ્રી રાજજી સ્વરૂપ મેહેબૂબ = પ્રાણાચારાના

સુનદર અત્યંત જ = સ્વરૂપનું સ્મરણ

મન મોહિત સુનદર આવત હિરટેં = ઉમડીને આવી
અને

રહ્યું છે, દિલ

અને દિમાગમાં

સનકૂલ = પ્રસન્ન, સંતુષ્ટ,

કિયા કિનને = કોને કરી દીધું ?

સકોમલ = હસમુખ અને

કોમલતા પૂર્ણ છે

તેરા કૌલ ફૈલ = તારું બોલવા-

રહુ દેખ = હે આત્મા ! નિહારીને

ચાલવાનું

જોઈ લે

(બોલ-ચાલ)

નૈના ખોલ = આંખો ખોલીને

અને ચલન

નૂર જમાલ = અક્ષરાતીત ઉત્તમ

વ્યવહાર તેમ જ

પુરુષ શ્રી રાજજીને

એ હાલ = આ હાલત ! એવી

ફેર ફેર = વારંવાર

સ્થિતિમાં પહોચાડી
દીધાં

* અષ્ટાદશોડદ્વાયઃ *

ભાવાર્થ-

મારા અક્ષરાતીત શ્રી રાજજુ - પ્રિયતમનું સ્વરૂપ અત્યંત જ સુનંદર અત્યાધિક સુમધુર કરુણામય પ્રેમ-સ્નેહ પૂર્ણ તથા બહુ જ સુકુમાર અર્થાત् કોમળમાં પણ કોમળ છે. હે ઈન્દ્રાપતી આત્મા ! તું એકીઠો (એકટક) આંખને સ્થિર કર્યા વગર નિહારીને જો. અંતમુખી થઈને પોતાની અંતરંગ આંખોને ખોલીને પોતાના અક્ષરાતીત અદ્ભેત પ્રિયતમના ચિન્તનીચ ચિન્મય આભા પૂર્ણ સ્વરૂપને જોઈ લે. પ્રિયતમનું તે પ્રતિભાયુક્ત સ્વરૂપ વારંવાર મારા હૃદયમાં અંકિત થઈને ઉમડી રહ્યું છે. હે આત્મા ! તારી બોલી - ચાલી, (બોલ-ચાલ), ચલન વ્યવહાર અને મનઃ સ્થિતિને એવી હાલત અને અવસ્થામાં પરિવર્તિત કરી તને અહીં સુધી પહોંચાડવાવાળા કોણ છે ?

જામા જડાવ જુક્યા અંગ જુગતે,
ચાર હારોં કરી અંબર ઝલકાર ।
જગમગે પાગ એ જોત જવેર જ્યોં,
મીઠે મુખ નૈનોં પર જાઉં બલિહાર ॥૨॥

શબ્દાર્થ :-

જામા જડાવ = ધૂંટણ સુધીની	જડિત
પોશાક (જામા)	જુક્યા અંગ = એક-બીજાથી
વિલિન્ન રતનોથી	અકેલાં અંગ -

પ્રત્યંગમાં,	જોત જવેર = કાંતિ ચુક્ત
જુગતે = અત્યંત મનભાવન	પ્રકાશિત જ્યો
શોભાચુક્ત સુશોભિત થઈ રહ્યા છે.	રટનોમાંથી
ચાર હારોં = ચારે હાર (માળા)	ચમચમાતી જ્યોત
કરી = કરી રહ્યા છે	ઉદીમ થઈ રહી છે
અંબર = અંતરિક્ષમાં ઝલ	મીઠે મુખ = મધુર, મીઠાશ ચુક્ત
ઝલકાર ઝલાકાર	નૈનોં = શોભા- સુંદરતાથી
જગમગો = જગમગાતા, પ્રચંડ ઝપેણા	પરિપૂર્ણ તેમનું
પાગ થો = ઝીલમીલાતા	મુખમંડલ અને
રટનોથી જડિત	કમલલોચન
પાગ(પાઘડી) થી	પર જાડોં = પર સમર્પિત
	બલિહાર = ન્યોછાપર થઉં છું.

ભાવાર્થ-

પ્રાણપ્રારા પ્રિયતમ શ્રી રાજુ દ્વારા ઘારણ કરેલાં વિલિન્ન
રટનોથી જડિત જામા (કુર્તા-ઝલ્ભો) તેમના અંગાદિ પર અત્યંત
ચુક્તિપૂર્વક જગમગાતા સુશોભિત થઈ રહ્યો છે. તેમના વક્ષસ્થળ
(છાતી) પર સ્થિત ગળાનો હાર અત્યંત સુંદર ઢંગથી સુશોભિત છે
અને તે ચારે હારોની ચમચમાતી હુઈ કાંતિપૂર્ણ ઝલક નીલા આકાશ
સુધી ઝીલમીલા રહી છે. પ્રિયતમ શ્રી રાજુના સિર પર સ્થિત લાલ
રંગની પગડી (પાઘડી)માં જડિત જગમગ-જગમગ જગમગાતી
વિલિન્ન રટનોનો જ્યોતિપુંજ માનો ચારે દિશાઓમાં ઝીલમીલા

* અધ્યાદશોડદ્વાયઃ *

રહ્યો છે. હું તો તે ધણીના મધુરાતિમધુર મુખારવિંદ અને અને
મનમોહક કમલ લોચન પર મન, ચિત્ત, બુદ્ધિ સહિત આત્મીય
ભાવયુક્ત ન્યોછાવર થાઉં છું.

લાલ અધુર હંસત મુખ હરવટી,
નાસિકા તિલક નિલવટ ભૌહેં કેસ ।
શ્રવન ભૂષણ મુખ દંત મીઠી રસના,
એ દેખ દરસન આવે જોશ આવેશ ॥૩॥

શબ્દાર્થ :-

લાલ અધુર	= લાલિમાચુક્ત હોઠ	રહી છે.
હંસત મુખ	= મંદ-મંદ મલકાતું મુખ	મીઠી રસના = મીઠાશ પૂર્ણ જિહ્વા (જીબ), તેમ જ
હરવટી	= મુસ્કાન પૂર્ણ ચિબુક (દાઢી-હડપચી) અને	નિલવટ = લલાટ સુધી પહોંચેલું ઉદ્વર્પુંડાકાર તિલક, જે
નાસિકા તિલક	= નાક સહિત તિલક	ભૌહેંકેસ = આંખોની ઉપરની ભંગરો (ભમર) ની પાંપણ પણ અત્યંત ચમચમે છે.
શ્રવન ભૂષણ	= કાનમાં કુંડળ (કર્ણફ્લ) અને	એ દેખ દરસન = આ મુખમંડલ
મુખ દંત	= મુખારવિંદમાં સ્થિત દાંતોની બંને પંકિતાઓ ચમકી	

* સરૂપ સુન્દર સન્કૂલ *

સહિત સંપૂર્ણાવે = ઉમડી આવે છે
 રૂપરંગને જોતાં | જોશ આવેસ = જોશ અને આવેશ
 જ અંતઃકરણામાં |

ભાવાર્થ-

અહો ! તે પ્રાણાખ્યારા પ્રિયતમ શ્રી રાજજીની લાલિમા ચુક્ત
 હોઠોથી નીકળતી માધુર્યપૂર્ણ મંદ-મંદ મુસ્કાન અને સુન્દરાતિસુન્દર
 ચિબુક (હડપચી), મનમોહિત કરવાવાળી નાસિકા તથા ઉપર
 મસ્તક પર ચમચમાતા તિલક તેમ જાંખોની ભંપરોની ચમચમાતી
 રુંપાની શોભા-સુન્દરતાનું વર્ણન હું કેવું અને કેવી રીતે કરું ? અરે !
 શ્રવણ અર્થાત् કાનના જ્યોતિ પૂર્ણ કુંડળ, અતિ સુંદર મુખમંડલમાં
 ચમકતી (ચમચમતી) દંત પંક્તિઓ તથા પ્રેમ પૂર્ણ અમૃતરસથી
 સરાબોર(ઓતપ્રોત) જીબ (જિહ્વા) ઉક્ત પ્રકારથી વર્ણિત અંગ
 -પ્રત્યંગના દર્શન માત્રથી જ આત્મામાં પ્રેમોન્માદ શક્તિ અને
 આવેશ જાગૃત થઈને ઉમડવા લાગે છે.

બાહેં ચૂડી બાજુબંધ સોહેં કુમક ,
 પોહોંચી કાંડો કડી હસ્ત કમલ મુંદરી ।
 નખકા નૂર ચીર ચઢ્યા આસમાનમે,
 જ્યોં હક ચલવન કરેં સબ અંગુરી ॥

શાબ્દાર્થ :-

બાહેં ચૂડી = બાંહોમાં ચૂડી વગેરે | બાજુબંધ = ભુજાઓમાં
 ભૂષન પહેરેલાં છે તો | (બાવડામાં) બાજુ

બંધ નામનું ભૂષણ	ઓથી નીકળતાં
પહેરી રાખ્યું છે	તેજ પૂર્ણ પ્રકાશને
સોહેંકુમક = તેમાં લટકતાં	ચીર ચઢ્યા = ચીર ફાડીને
જુમર અત્યંત જ	અર્થાત् વાંધીને
શોભનીય રૂપેણા	નીકળતી
લટકી રહ્યા છે	જ્યોત ઉપર
પોહોંચી કાંડો = પહોંચા	આસમાનમે = આકાશમાં
(કલાઈ) કાંડા	જ્યોંહક = જ્યારે - જ્યારે
પર સુશોભિત કડા	શ્રી રાજજી
કડી = અને મુંદરી તથા	ચલવન = સંચાલિત અથવા
હસ્તકમલ = કમલ સદશ	હલાવવાની કિયા
કોમળ હાથોમાં	કરે = કરે છે
મુંદરી = અંગૂઠી અંત્યત શોભા	સબ અગુંરી = હાથની બધી
લઈ રહી છે.	અંગળીઓ.
નખકા નૂર = હાથની આંગળી	

ભાવાર્થ-

તે અક્ષરાતીત શ્રીરાજજી - પ્રિયતમે બંને હાથોમાં ચુડા અને બાજુબંધ પહેરેલાં છે. આ બાજુબંધના જુમર તેમ જ જુમર (જબ્બો) ના ગુચ્છા લટકતાં ઝીલમીલા રહ્યા છે. તેમના કાંડા (પહોંચા) માં શોભિત કડા અને કમલ સદશ કોમળ હાથોમાં વિધમાન અંગૂઠીઓ અતિ ઉત્તમ ઢંગથી સુશોભિત થઈ રહી છે. જ્યારે પ્રાણપ્રાણ પ્રિયતમ હસ્તકમણને સંચાલિત (હલાવે)

* સરપ સુન્દર સન્કૂલ *

અથવા આંગળીઓ દ્વારા કંઈક સકેતાદિની કિયા કરે છે, ત્યારે તે અંગોથી ઉદીપ્તા (ચમકતી) થવાવાળી જ્યોતોને વેદીને (ભેદીને)-વીધીને નીકળવાવાળા નખના નૂરમય પ્રકાશની ઝલઝલાકાર ચુક્ત ઝલક નીલા અંબર (નીલાકાશ) માં વીજળીની ચમક સદશ પહોંચે છે.

રોસની પટુકેં કરી અવકાશમેં,
ચરન ભૂષણ જામે ઈજાર ઝાંઈ ।
કહે મહામત મોમન રૂહ દિલકો,
માસુક ખૈંચેં તોહે અરસ માહી ॥૫॥

શબ્દાર્થ :- પ્રકરણ-૧૭, ચૌ. ૮૪.

રોસની પટુકેં = પ્રકાશચુક્ત	ધુંટણા સુધીના જામા
ઝીલમીલ	(કુતર્ણ) ની
કરતાં પટુકા	ઇજાર = પગમાં પહેરેલાં
કરી અવકાસમેં = આકાશમાં	પાચજામામાં
ઝીલમીલા રહ્યા છે	ઝાંઈ = પરછાઈ (ઝાંચ)
ચરન ભૂષણ = કોમલ ચરણોમાં	પ્રતિબિંબ પડે છે.
ચાર આભૂષણ,	કહે મહામત = મહામતિ દર્જમાં
શોભાયમાન છે	સ્થિત શ્રી
અને	ઇન્દ્રાવતી કહે
જામે = મૂલ ભિલાવામાં પહેરેલો	છે કે

* અધ્યાદશોડદ્યાયः *

મોમન રૂહ = બ્રહ્માત્માઓ-	આકર્ષિક કરી
બ્રહ્મસૂચિઓને	ખેંચીને અથવા
દિલકો = દિલ-અન્તઃકરણ (મન-બુદ્ધિ-ચિત્ત સહિત આત્મા)	બોલાવી રહ્યા છે
ને	તોહે અરસ = આ પ્રમાણે તારા ધામ
માસૂક ખોચો = પ્રિયતમ શ્રી	માહી = ની અંદર (મૂલ ભિલાવા) માં જ્યાં તારી
રાજજી	પરાત્મા બેઠેલી છે.

ભાવાર્થ-

અહો! પ્રિયતમ શ્રી રાજજીના કુમરમાં બાંધેલો વિભિન્ન ચમકદાર રત્નનોથી જડિત પદુકો તથા ચરણકમલમાં પહેરેલાં આભૂષણોના તેજ જ્યોત તેમ જ ઈજાર (પાયજામા)ની ઝીલમીલાતી આભા બધાથી વધારે (અધિક)ચમકી રહી છે. મહામતિ દર્જમાં સંપત્તિ સર્વાગ્રહણ આત્મા ઈન્દ્રાપતીજુ કહી રહી છે કે અક્ષરાતીતમાં સ્થિત અમારા પ્રિયતમ પોતાના અભૂતપૂર્વ સૌંદર્યથી સંપત્તિ સ્વ-પ્રિયતમા મોમિન આત્માઓના દિલ-દિમાગ સહિત આત્માને સ્વ-અરસ શ્રી પરમધામની તરફ આકર્ષિત કરતાં ખેંચી રહ્યા છે. આ પ્રમાણે તે પોતાની આત્માઓને સ્વધામમાં બોલાવી રહ્યા છે.

* પર ન આવે તોલે *

* પર ન આવે તોલે એકને *

પર ન આવે તોલે એકને,

મુખ શ્રીકર્ણ * કહેત ।

શાબ્દાર્થ :-

પર ન આવે = પરંતુ આવે જ
નહીં

મુખ શ્રી કર્ણ = મુખથી શ્રી
કૃષ્ણ

તોલે એકને = તુલ્ય સદશ
એકવાર પણ

કહેત = નામોચ્ચારણ કરવાથી
પુણ્યની બરાબર

ભાવાર્થ -

એક બાજુ સંસારની અન્ય વિલિન્ન પ્રકારની સાધનાઓ છે,
તો બીજુ બાજુ અક્ષરાતીત શ્રી કૃષ્ણ નામોચ્ચારણ રૂપી સાધનાનું
માપ - તોલ કરી સંતુલન કરી એ સિદ્ધ થાય છે કે માત્ર એકવાર જ
અક્ષરાતીત શ્રી કૃષ્ણ નામોચ્ચારણ કરીએ તો પણ તે નામોચ્ચારણ

* કૃષ્ણોતિ મંગલં નામ યસ્ય વાચિ પ્રવર્તતે ।

ભર્મી ભવન્તિ સધસ્તુ મહાપાતક કોટ્ય : ॥

- (વિષણુ ધમોતર પુરાણ).

અર્થ :- મંગલમય અક્ષરાતીત શ્રી કૃષ્ણ નામના ઉચ્ચારણ
માત્રથી જ કરોડો પાપ-રાશિઓ ભર્મ થઈ જાય છે, તો અન્ય
પાપોની તો વાત જ શું કરવી ! અરે ! ‘પંચ મહાપાતક’ જેવા ભયંકર
તેમ જ મોટામાં મોટું પાપ તથા એવી કરોડો પાપરાશિઓ માત્ર
એકવાર અક્ષરાતીત શ્રી કૃષ્ણ નામોચ્ચારણથી તત્કાળ જ ભર્મીભૂત
થઈને નષ્ટ થઈ જાય છે.

* અષ્ટાદશોડદ્યાયः *

પ્રસિદ્ધ પ્રગટ પાદરી

કિંવતા^x કિંવ કરંત ॥૧॥

શબ્દાર્થ :-

પ્રસિદ્ધ પ્રગટ	= પ્રત્યક્ષ અતિ	દિલ-દિમાગમાં
પ્રખ્યાત	કિંવતા કિંવ	= કાવ્ય વિષયક
કહેવડાવવું		ધુરંઘર તેમ જ
પાદરી	= સીધા-સાદા	પ્રસિદ્ધ કવિ
	સાધારણ જનના	કરંત = રચનાકાર જ કેમ ન બને
		ભાવાર્થ -

રૂપી પુણ્ય ફળની તુલનામાં બીજું કોઈપણ સાધન અથવા ઉપકરણાનું પુણ્ય સંતુલિત રહેતું નથી. એ વાત જગત પ્રસિદ્ધ, સર્વ

^x ખડ્કાદિવેદો મુજે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાદિ ગદં સુપદં કરોતિ ।

યશોદા કિશોરે મનો વેન લગનં, તતઃ કિં, તતઃ કિં તતઃ કિં તતઃ કિંમ् ॥

-(શાસ્ત્ર).

અર્થ :- છ અંગાદિ સહિત વેદ શાસ્ત્રાદિના પારંગત વિજ્ઞાન હોય અથવા અત્યંત સુનદર મિઠાસ પૂર્ણ, અત્યંત મધુર સ્વાદિષ્ટથી પણ સ્વાદિષ્ટ ગદ, પદ્ધમય કાવ્ય રચનામાં નિઃસેદેહ જ નિપુણ કેમ ન હોય, પરંતુ અગર જો તેનું મુખ યશોદાનનદનનના નામોચ્ચારણ કરવામાં અસમર્થ હોય, તો તે મનુષ્ય ઉક્ત વર્ણિત બધા વિષયોમાં નિકમ્ભા -નિકૃષ્ટ સિદ્ધ (સાબિત) થશે. તેને મળેલું માનવજીવન પણ દિક્કારને પાત્ર છે. તથા તે પૃથ્વી પર ભાર રૂપ અર્થાત् વ્યર્� છે.

* પરન આવે તોલે *

જાત તેમ જ પ્રખ્યાત રૂપમાં અકાટય સત્ય છે. અનેકો કવિઓ, અગણિત વાણી વિશારદો (નિપુણો) તથા પ્રખ્યાત વેદવક્તા વગેરે આચાર્યોએ પોત-પોતાના સદ્ગ્રન્થાદિ વચ્ચનોમાં રૂપદ્ર એવં પ્રત્યક્ષ રૂપમાં આ વાતનું પ્રમાણ આપ્યું છે કે હે સાધનશીલ સાધકો! આ વિશાલ સંસારની વચ્ચે જનસાધારણાના દિલ-દિમાગ દ્વારા તમે ભલે ન અતિ પ્રખ્યાત કહેવડાવો, વિભિન્ન કાબ્યોની રચના કરીને અત્યંત પ્રસિદ્ધ એવં ધૂરંઘર કવિ જ કેમ ન બની જાય, પરંતુ તે બધા પુણ્યોનું ફળ એકવાર ઉચ્ચારિત અસરાતીત શ્રી કૃષ્ણાનામ રૂપી સાધનના પુણ્યના તુલ્ય કદાપિ (ક્યારેચ) આવી શકતું નથી.

કોટ કરો નરમેદ્ય * ,

અશવમેદ અનંત ।

શબ્દાર્થ :-

કોટ કરો = કરોડોવાર કરો	અશવમેદ = ઘોડાની બલિ આપો
નરમેદ્ય = મનુષ્યની બલિ ચઢાવો	અનંત = સંખ્યાતીત, અસંખ્ય વાર

ભાવાર્થ -

અહો ! જુઓ ! વિભિન્ન સાધનશીલ સાધુઓ !! કરોડો નરમેદ્ય યજા ભલે ન અતિ ઉત્તમ રીતિ-રિવાજો સહિત સંપત્ત કરો, (કરતાં હશો) અનગણિત-અસંખ્ય અશ્વમેદ યજા પણ ધાર્મિક વિદ્યાનની રીતિઓની અનુકૂળ સંપત્તન કરો, પુનઃ સંસાર-સંબંધી બતાવેલાં

૧* એકોડપિ કૃષ્ણાસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૂથેન તુલ્યઃ।
દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય ॥
- (મહાભારત, શાન્તિ પર्व).

* અષ્ટાદશોઽદ્યાયः *

અનેક ધરમ ધરા વિષે, તીરથ વાસ વસંત ॥૨॥

શબ્દાર્થ :-

અનેક ધરમ = અનેકો ધર્મ,	તીરથ વાસ = તીર્થવાસી
જેટલાં પણ	બનીને
ધરા વિષે = પૃથ્વી પર છે, તે	વસંત = જિંદગીભર કેમ ન રહો-
બધાને કુમશા:	બેસો.
ધારણ કરીને	

ભાવાર્થ -

તથા કરતાં (કરેલાં) બધા ધર્માચારણોના પાલન નિયમાનુસાર જ
કેમ ન કરો (કરતાં હશો), તેમ જ પોતાનું સંપૂર્ણ જીવન જ

અર્થ:- અહો ! માત્ર એકવાર અક્ષરાતીત શ્રી કૃષ્ણા
નામોચચારણ તથા પ્રણામ કરવાથી પુણ્યનું મૂલ્યાંકન દસ
અશ્વમેઘ યજાના ફળના બરાબર થાય છે. પરંતુ રહસ્યની વાત તો
એ છે કે દસ અશ્વમેઘ યજાના ફળનું પુણ્ય કમાવાવાનાને પણ ફરી
જન્મ ધારણ કરવો પડે છે, કિંતુ અક્ષરાતીત શ્રી કૃષ્ણા નામોચચારણા
એવં પ્રણામ કરવાવાળાને તો ફલત : મૂલ્યાંકન જન્મ- મરણના
અક્ષર જ સદાય માટે નિર્મળ થઈ જાય છે.

૨. ગોકોટિદાનં ગ્રહણોષુ કાશી પ્રયાગ ગજાયુત કલ્પવાસ : ।
યજાયુતં મેરુ સુવર્ણાદાનં ગોવિન્દનાના ન કદાપિ તુલ્યમ् ॥
-(શ્રી પાણ્ઠક ગીતા).

અર્થ:- પ્રત્યેક ગ્રહણ (સૂર્ય, ચંદ્રના) માં કરોડો ગાય દાન
કરો, કાશી પ્રયાગાદિ તીર્થસ્થાનોમાં અથવા ગંગાજીના તટ પર

* પરન આવે તોલે *

તીર્થવાસીના ઇપમાં કેમ ન નિવહિ કરો, પરંતુ તે બધા કાર્ય-
કલાપોના પુણ્યની તુલના જીવનમાં એકવાર અક્ષરાતીત શ્રી કૃષ્ણા
નામ ઉચ્ચારણાથી પ્રાપ્ત પુણ્યની તુલનામાં ક્યારેય નહિ આવી શકે.

સહસો (હજારો) વર્ષ સુધી કલ્પવાસ કરો. અથવા હજારો, લાખો,
ચઙ્ગાદિ કરો, પુનઃ સુમેરુ પર્વત તુલ્ય સુવર્ણાનું દાન જ કેમ ન કરો,
પરંતુ તે બધા પુણ્યોનું ફળ એક વખત ગોવિંદ નામ-પ્રજ્યવાળા
અક્ષરાતીત કૃષ્ણાના નામોચ્ચરણા તેમ જ નામ સ્મરણાના પુણ્યની
તુલ્ય ક્યારેય પાણ આવી શકશે નહિ.

3. સમકોટિ મહામન્ત્રશિયતવિખમકારકા : ।

એક એવ પરો મન્ત્રઃ કૃષ્ણો ત્યક્તર દ્રઘમ् ॥

- (બ્રહ્મવૈવર્ત પુરાણ).

અર્થ:- સાત કરોડ મંત્રોમાંથી એક અક્ષરાતીત કૃષ્ણા નામનો
મંત્ર માત્ર જ માયામાંથી આત્માઓને તારવાવાળો-પાર
લગાડવાવાળો મંત્ર છે, અન્ય બધા મંત્ર માયામાં જ ભિત
કરવાવાળા છે. એવું કેમ ? અન્ય બધા મંત્ર માયાવી પક્ષના છે,
કૃષ્ણા નામક મંત્ર બ્રહ્મ પક્ષના છે કેમ કે બ્રહ્મ નામના મંત્ર જ માયાથી
છોડાવીને બ્રહ્મધામમાં પહોંચાડી શકે છે. બ્રહ્મસ્વરૂપ અક્ષરાતીત
કૃષ્ણા નામના ઉચ્ચારણ માત્રથી જ આત્માનો ઉદ્ધાર થવાનું મુખ્ય
કારણ એ જ છે.



* અષ્ટાદશોડદ્વારાયः *

સિદ્ધ કરો સાધના, વિપ્ર *મુખ વેદ વંદત ।

શબ્દાર્થ :-

સિદ્ધ કરો = યોગી બનો, વિભિન્ન	વિપ્ર મુખ = બ્રાહ્મણ કુળમાં
સિદ્ધિઓ પ્રાપ્ત કરો	જન્મ પ્રાપ્ત કરીને
સાધના = અનુષ્ઠાન દ્વારા	વેદ વંદત = સારા જીવન વેદ પાઠ કરતાં જ રહો
	ભાવાર્થ -

અહો ! કઠિનથી કઠિન અથવા કઠોરથી કઠોર સાધના પથમાં ઉત્તીર્ણ થઈને અનેકો પ્રકારની રિદ્ધિસિદ્ધિ હાંસિલ (પ્રાપ્ત) કરો. ઉતામ કુલીન બ્રાહ્મણ કુળમાં જન્મ પ્રાપ્ત કરીને ચારે વેદાદિ ગ્રંથોને કંઠસ્થ કરીને જીવનભર તેનું ઉત્ત્યારણ પાઠ પણ કરતાં રહો, સર્વોપરી

*૧ અધીત્ય ચતુરો વેદાન્ન વ્યાકૃત્યાષ્ટાદશ સ્મૃતિ : ।

અહો શ્રમણ્ય વૈફુત્યઅમાત્માપિ કલિતો ચ ચેત ॥

-(શાસ્ત્ર).

અર્થ :- ચારે વેદોના અધ્યયન કરો અને અઢાર સ્મૃતિઓ (પુરાણો) માં નિપુણા, કુશાલ, વાચસ્પતિ બનો અથવા સમાજમાં રોચક અત્યંત મનમોહક આકર્ષક કરવાવાળી શક્તિથી સંપત્ત્ર વ્યાખ્યાતા (પ્રવચન કરનાર) બનો, તો પણ અગર જો “આત્મજ્ઞાન” ન થયું, એમ કહેશો તો ઉક્ત કથિત સારા પ્રચાસ અથવા કોશિશો “અજ્ઞાગલસ્તનસ્યેવ તસ્ય જન્મ નિરર્થકમ्” બકરીના ગળામાં સ્થિત સ્તનની તુલ્ય કહેવાશો તથા પ્રાપ્ત મનુષ્ય જીવન પણ નિકળ્યા અને નિરર્થક સિદ્ધ થશે.

* પરન આવે તોલે *

સકલ કિયાસું ધરમ પાળતાં, દયા કરો જીવ જંત ॥ 3 ॥

શબ્દાર્થ :-

સકલ કિયાસું = સંપૂર્ણ કર્મોને	જ કેમ ન બનો
વિધિ પૂર્વક	જીવ જંત = ચોરાશી લાખ
ધરમ પાલતાં = ધર્મવત् પાલન	ચોનિઓના
પણ કરો	અહિસંક જ કેમ ન બનો.
દયા કરો = દયાળું અથવા કૃપાળું	

ભાવાર્થ -

ઝુપથી શુદ્ધાતિશુદ્ધ થઈને ધર્મમાર્ગના આચાર-વિચાર વિધયક નિયમોને શિરોધાર્ય કરીને તેનું પાલન કરતાં રહો, ફરી સંપૂર્ણ જીવ જંતુઓ પર કરુણામય દયા ભાવનો વરસાદ જ કેમ ન કરતાં રહો, પરંતુ તે બધા કાર્યકલાપોની ગતિ - મુક્તિનું પુણ્ય એક વખત કરેલાં અક્ષરાતીત શ્રી કૃષ્ણા નામોચ્યરણાના પુણ્ય ફળની તુલનાની બરાબર ક્યારેય નહિ આવી શકે.

૨. અધીત્ય ચતુરો વેદાન્સર્વશાસ્ત્રાણનેકશઃ ।
ભ્રમ તત્ત્વં ન જાનાતિ દર્ભા પાકટસં ચથા ॥
(મુક્તિકોપનિષદ, પ્ર.૨/ચૌ.૫૫).

અર્થ :- સુન્દરાતિસુન્દર સૌષ્ઠવયુક્ત વાણીવાળા તથા અધિકાધિક ચતુર, પારંગત, વિદ્રત સભાના અગ્રગણ્ય વ્યાજ્યાનશીલ એવં સંપૂર્ણ વેદ-શાસ્ત્રાદિ પુરાણાદિના જ્ઞાતા અથવા પ્રસિદ્ધ વેદવક્તા પણ કેમ ન હોય, લેકિન અગર જો તે વિદ્રાન

* અષ્ટાદશોડ્યાયઃ *

પ્રત કરો વિદ્ય* વિદ્યનાં, સતી થાઓ સીલવંત ।

શાસ્ત્રાર્થ :-

પ્રત કરો = સુચાચણા-ચંદ્રાચણા	સતી થાઓ = સતી સાવિત્રી
ઇત્યાદિ પ્રત	અનસુયા સદશ
વિદ્ય વિદ્યનાં = એવા જુદા-જુદા	પણ કેમ ન બનો
પ્રકારના બીજા	શીલવંત = સુશીલ
પણ કઈ	પાકસરચારિત્રયાળી

ભાવાર્થ -

અહો ! અનેકો વિભિન્ન પ્રકારના પ્રત કરો યા અનુષ્ઠાન લગાડો, સારી પૃથ્વી પર સ્થિત જનસમાજની નજરોમાં સત્યારિત્રયાન પુરુષ અથવા પતિપ્રતા સતી સાવિત્રી તેમ જ અનસુયા જેવી અહાન સ્ત્રીઓની સંજ્ઞાથી સંબોધિત તથા સમ્માનિત કરતાં દ્વારા બ્રહ્મતર્ત્વ નિશ્ચિત ન થઈ શક્યું તથા તેઓએ અક્ષરાતીત સનાતન અદ્ભેત બ્રહ્મ શ્રી કૃષ્ણાનામને સ્વમુખ દ્વારા એક વાર પણ ઉચ્ચારણ ન કર્યું, તો તે વિદ્ધાનનું માનવજીવન પાકરસ બનાવવા માટે પ્રયોગમાં લઈ જવાવાળી દર્ભા (મોટા ચમચા) તુલ્ય જ ગણી શકાશે.

* મધુર મધુર મેતનમજ્જલં મજ્જલાનાં સકલ નિગમ વદ્વી સાટફલં ચિત્તસૃપમ् ।
સફુદપિ પરિગીતં શ્રદ્ધયા હેલયા વા, ભૂગુપર ! નર માત્રં તારયેનુષ્ણણાનામ ॥
-(સ્કન્દ પુરાણ).

અર્થ :- અરે શૌનકજી ! મધુરાતિમધુર મંગલથી પણ

* પરન આવે તોલે *

વેશ ધરો સાધ સંતના,

ગનાની *ગનાન કથંત ॥ ૪॥

શબ્દાર્થ :-

વેશ ધરો	= વેશ ભૂષા ધારણા કરો	ગનાન	= બુદ્ધિજીવી અથવા
સાધ સંતના	= સાધુ સંતોની		પાંડિત્યવાન જ
	સમાન	કથંત	= કેમ ન કહલાવો પરંતુ
ગનાની	= જ્ઞાની, વિજ્ઞાન		

ભાવાર્થ -

જાવ, સાધુ સંતોનો સમાન ઉત્તમાતિઉત્તમ વેશ ધારણા કરીને
જીવનનો સિંગાર કરો અથવા ઉત્ત્રાતિઉત્ત્ર જ્ઞાની, પાંડિત્યવાન
મંગલકારી શ્રુતિઓમાં અંકિત સંપૂર્ણ મંત્રરાશિઓના ફલસ્વરૂપ,
ચિન્મય આ કૃષણાનામનું ઉચ્ચારણ શ્રદ્ધાભાવ અથવા અશ્રદ્ધાથી,
પુનઃ આદરપૂર્વક અથવા અનાદરતાથી જે કોઈ મનુષ્યાત્માએ
એકવાર પણ કર્યું હોય, એવા મનુષ્યાત્મા માત્રનો ઉદ્ઘાર કરવામાં
સામર્થ્યશાળી માત્ર અક્ષરાતીત શ્રી કૃષણાનામ જ છે.

*૧. વાસુદેવ પરિત્યજ્ય યેદન્ય દેવ મુપાસતે ।
તૃષ્ણિતા જાહેરી તીરે કૃપ વાખનિતિ દુર્ભગા : ॥
- (શ્રી પાણ્ઠવ ગીતા).

અર્થ:- જે મૂઢાધીશ (મૂર્ખ) મનુષ્ય વાસુદેવ શ્રી કૃષણને
પરિત્યાગ કરી અન્ય કોઈ દેવી-દેવતાઓનું ચિંતન- ઉપાસના કરે
છે, તેમના વિષયમાં કયાં શું કહું? એવી માનવાત્માઓ તો

* અષ્ટાદશોડદ્વારાયः *

સાબિત થઈને જનસમાજની વરચે જુવન પર્યત અર્થાત् શાસ ચાલતો રહે ત્યાં સુધી જ્ઞાન-ચર્ચા, કથા-વાર્તા વિષયક પરિશ્રમ (મહેનત) કેમ ન કરતાં રહો, લેકિન તો પણ તે બધી ગતિવિધિઓથી પ્રાપ્ત પુણ્ય ફળની તુલના માત્ર એક વખત કરેલાં અક્ષરાતીત શ્રી હૃષ્ણા નામોર્ચારણાથી પ્રાપ્ત થવાવાળા પુણ્ય ફળ સમાન કરી શકાતી નથી.

અભાગિઓમાં પણ એવા અભાગી છે કે જેમ કોઈ અભાગા મનુષ્ય, મનુષ્યાત્મા માત્રને પરમપાપન કરવાવાળી પ્રસિદ્ધ પવિત્ર ગંગા નદીના તટ પર પહોંચીને પણ સ્વયં પોતાની ક્ષુદ્રા (તરસ) મટાડવા માટે કુષો ખોદવા જેવું તુચ્છ કાર્ય કરવા લાગ્યા, તો અક્ષરાતીત વિષયનું શું ?

૨. હૃષ્ણા હૃષ્ણોતિ હૃષ્ણોતિ યો માં સ્મરતિ નિત્યશાઃ ।

જલં લિત્વા યથા પદ્યં નરકાદુદ્ધ રામ્યછમ् ॥

-(શ્રી પાણીક ગીતા).

અર્થ:- જે મનુષ્યાત્મા નિરંતર મારું નામ સ્મરણ અર્થાત् રાત-દિવસ હૃષ્ણા, હૃષ્ણાનો જાપ એવં પાઠ કર્યા કરે છે, તેને હું નરકથી તેવી રીતે ઉગારી (ઉભાર) લઉં છું, જેવી રીતે જલકમલ સરળતાથી જળવેધીને (વીધીને) અથવા છેદીને નિર્લિખ બનીને બહાર નીકળી આવે છે.

૩. શરીરં સુરૂપं તતો વે કલત્રં યશ શ્યામુ ચિત્રં ઘનં મેરુતુલ્યમ् ।

યશોદા કિશોરે મનો વે ન લખ્યા તતઃ કિં તતઃ કિં, તતઃ કિં, તતઃ કિમ् ॥

અર્થ:- અત્યંત સ્વાસ્થ્ય, તંદુરસ્ત સુંદર અને નિરોગી શરીર હોય, અત્યંત સુશીલ સ્વભાવવાળી ધર્મપત્રની જ કેમ ન હોય ,

* પરન આવે તોલે *

તપસી *બહુ વિદ્ય દેહ દમો,

સરવા અંગ દુઃખ સહંત ।

શાબ્દાર્થ :-

તપસી બહુ	= તપસ્યામાં	સરવા અંગ	= બધા અંગ-
વિદ્ય	= પારંગત બની		પ્રત્યંગ દ્વારા
	કેટલાચ	દુઃખ સહંત	= દુઃખ કષ્ટોને પણ
	પ્રકારથી		સહનશીલ બનીને
દેહ દમો	= શારીરનું દમન કરીને		સહન કરો
		ભાવાર્થ -	

અહો ! કઠોરાતિકઠોર સાધનાઓ, નીરસ અથવા કઠિનમાં કઠિન તપસ્યાઓ તથા વિલિન્ન અનુષ્ઠાનો દ્વારા પોતાના શારીરને તપાવો, વિલિન્ન પ્રકારના દુઃખ, કષ્ટ અથવા ચાતનાઓને ઘૈર્યપૂર્વક શિરોધાર્ય કરીશ સહન કરો, પરંતુ તે બધી સાધનાઓના પુણ્યનું

સમાજમાં વિચિત્ર ચશમદ્વી, ઓજસ્વી, ચશ કીર્તિની બોલબાલા - વાહ્યાહ પણ હોય, દાંપત્ય જીવન અતુલ- વિપુલ સુમેરા પર્વત સદ્શ ઘનાઢચ, ઘન-ધાન્યથી પૂર્ણ રૂપેણ સંપત્ત પણ ડેમ ન હોય, પરંતુ ચદિ ચશોદા કિશોર નનંનનનંન અક્ષચાતીત શ્રી કૃપાના નામોચ્ચારણ જીવનમાં એકવાર પણ ન કર્યું હોય, તો ઉક્ત કથિત સમુચ્ચી સાધનાઓનો શું મોલ ? તેનાથી શું વાસ્તો ? તેનું માનવ જીવન પણ કેટલાં નિર્દ્યક એવં કેટલાં સસ્તા સાબિત થશે ?

* ન ભોગે ન યોગે ન વા વાજિરાજો, ન કાન્તા મુખે નૈવ વિતેષુ ધિતામ् ।

ચશોદા કિશોરે મનો વેન લભ્યા, તતઃ કિ, તતઃ કિ, તતઃ કિ, તતઃ કિમ् ॥

* અધ્યાદશોડદ્વાયઃ *

પર તોલે ન આવે એકને,

મુખ શ્રી કૃષ્ણ* કહેત ॥૫॥

શબ્દાર્થ :-

પર ન આવે = પરંતુ નથી આવી	મુખ શ્રી કરણ = મુખથી શ્રી
સકતા	કૃષ્ણાના

તોલે = તુલ્ય-બરાબર	કહેત = નામોચ્ચારણ કરવાનું
એકને = એકવાર પણ	પુણ્ય

ભાવાર્થ -

ઇન માત્ર એકવાર કરેલાં અક્ષરાતીત શ્રી કૃષ્ણા નામોચ્ચારણ રૂપી

અર્થ :- અહો ! પ્રશાસ્ત ભોગાદિ, ઉત્ત્ર યોગાદિ, પરિપૂર્ણ ધનધાન્ય, શ્રી સંપત્તિ, ઘોડાદિ સામગ્રીઓ તથા કામની કંચન સુન્દર સ્ત્રીઓના સુડોળ, સુંદર, કોમળ અંગાદિથી મન, ચિત્તાદિ અનાસકત જ કેમ ન હોય, કિંતુ અગર જો ચશોદા - નંદનંદન શ્રી કૃષ્ણાચંદ્રમાં મન, ચિત્ત ન લાગે તેનું રમરણ કરી એક વાર માત્ર પણ સ્વમુખ દ્વારા તે અક્ષરાતીત શ્રી કૃષ્ણા તેમનું નામોચ્ચારણ ન થઈ શકે, તો તેની જિંદંગી જ નિરર્થક કહેવાશે અને તેને પ્રાણ માનવજીવન ધિક્કારને પાત્ર તથા નર પશુપત્ર સાબિત થશે.

*૧. કૃષ્ણા એવાક્ષરાતીત : સચિચિદાનંદ લક્ષણા : ।

પ્રિયાભિ : પ્રાર્થિત : પ્રેમણા રેમે વૃન્દાવને વિભુ : ॥

- (બૃહદ સદાશિવ સંહિતા).

અર્થ:- સચિચિદાનંદ લક્ષણાચુક્ત ઉત્તમપુરુષ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણા માત્ર છે. તેઓએ પોતાની અંગભૂતા

* પરન આવે તોલે *

~~~~~  
પુણ્યના ફળની તુલનામાં અકાટ્ય રૂપથી આવી શકતા નથી.

સજિયોની પ્રેમમય પ્રાર્થનાને કારણે શ્રી વૃદ્ધાવનમાં પ્રેમમય રસ  
રમણ લીલા કરી હતી.

૨. શ્રી કૃષ્ણાશ્વાક્ષરાતીત પુરુષોત્તમ સંજિતઃ ।

રસ રૂપ તથા યસ્તુ શ્રુતિભિઃ પરિગીયતે ॥

- (પુરાણા સંહિતા ૨૩/૨૮).

અર્થ :- પુરુષોત્તમ સંજાથી વિલૂષ્ટિત અક્ષરાતીત શ્રી કૃષ્ણા  
જ રસ રૂપ પરમાત્મા, પ્રેમાસ્પદ બ્રહ્મ છે, જેના ગુણાગાન શ્રુતિઓ  
પણ કરે છે.

૩. કૂટસ્થ એવ તદ્વામિનિ કૃષ્ણા દર્શન લાલસઃ ।

નિત્યં પ્રયાતિ પરમઃ પ્રેમપૂરિત માનસઃ ॥

- (પુરાણા સંહિતા ).

અર્થ :- સૂચિકર્તા કૂટસ્થ અક્ષર બ્રહ્મ પણ અક્ષરાતીત  
બ્રહ્મધામમાં જે શ્રી કૃષ્ણાના દર્શનની લાલસામાં નિત્ય પ્રતિ જાય  
છે, અક્ષરાતીત શ્રી કૃષ્ણાના નામોર્ચયારણ પોતાના માનવ જીવનમાં  
ન કરી, જીવન નિર્વાહ કરવાવાળાને તો ‘નર પશુ’ કહેલું છે.



\* અષ્ટાદશોડધ્યાયः \*

## મહેરાજ કહે મુખ એ ઘન, જો વળી રૂદે રમંત \* ।

શાબ્દાર્થ :-

|                              |                             |
|------------------------------|-----------------------------|
| મહેરાજકહે = ઈન્દ્રાવતી આત્મા | જો વળી = તેમની તો વાત જ શું |
| શ્રી મહેરાજજી કહે            | કરવી, પછી                   |
| છે કે                        | રૂદે રમંત = જેના હૃદય ધામ   |
| મુખ એ ઘન = તે મનુષ્યાત્માઓ   | મનમંદીરમાં શ્રી             |
| ના મુખ ધન્ય                  | કૃષ્ણજી રહે છે, રમે         |
| ધન્ય છે અને                  | છે, તો                      |

ભાવાર્થ -

અક્ષરાતીત ધામની આત્માઓમાં અગ્રગણ્ય શ્રી ઈન્દ્રાવતી આત્માના અધિક્ષતા શ્રી મહેરાજ ઠાકુરજી શ્રી તારતમ જ્ઞાન દ્વારા

\* શ્રુતિપલ ગૃહાનુસંસ્કરણં ચિન્તયનું, નામાનિ રૂપાણિ ય મજાલાનિ તે ।  
કિયાસુ ચર્ચાચ્ચરણાર વિનદ્યો, રાવિષ્ટયેતાન ભવાય કલ્પતે ॥

- (ભાગવત, ૧૦-૨-૩૭).

અર્થ :- અક્ષરાતીત શ્રી કૃષ્ણાના મધુર મંગલમય નામ અને રૂપનું એકપાર માત્ર પણ જે મનુષ્યાત્મા ઉચ્ચારણ કરે છે, સાંભળે છે, સંભળાવે છે, ચિંતન અથવા સ્મરણ કરે છે, તો તે પુણ્યનું મુલ્યાંકન અન્ય કોઈપણ સાધનના પુણ્યફળની તુલ્ય નથી રહી શકતું તો, અંતકાલ સુધી જે મનુષ્યાત્મા, અક્ષરાતીત શ્રી કૃષ્ણાના જ ચરણકમલમાં એક ચિત્ત થઈને જીવન નિર્વાહ કરે છે, તેનું શું ? વાહ રે વાહ !

\* પરન આવે તોલે \*

ચૌદે ભવન તે જીતિયો,

ધન ધન એ કુલવંત \* ॥૫ ॥

શબ્દાર્થ :- મકરણ-૧૮, ચૌ. ૬૦.

ચૌદે ભવન = ચૌદ લોકને જ

પુરુષાર્થા અને)

જીતિયો = તેને તો જીતી લીધું,

ધન ધન = ધન્ય ધન્ય, કૃતકૃત્ય

વિજય પ્રાપ્ત કરી

થઈ ગયા

લીધો (ચૌદ

એ કુલવંત = તેના તો કુળ પણ

લોકમાં તો

કૃતકૃત્ય, ધન્ય

મનુષ્યાત્મા તે

ધન્ય ગણી

સર્વોત્તમ શ્રેષ્ઠ,

શકાશો.

ભાવાર્થ-

નિર્ણયવત् કહી રહ્યા છે કે માનવ જીવનમાં પ્રાપ્ત તે મુખ ધન્ય-  
ધન્ય છે. જે મુખ દ્વારા અશ્રાતીત શ્રી કૃષ્ણાના નામોચ્ચારણ કરી

\*૧. કલેદોષ નિધેરાજનસ્તિ હ્યેકો મહાન् ગુણઃ ।

કીર્તના દેવ કૃષ્ણાસ્ય મુક્તસજ્જ પરં પ્રજેત્ ॥

- (ભાગવત, ૧૨/૩-૫૧).

અર્થ :- હે રાજન ! અનાચાર, પાપાચાર, વ્યલિચાર તથા  
બષ્ટાચાર એવા ચારે ગુણોથી ચુક્ત આ કલિયુગ જેવી રીતે બધી  
રીતેથી દોષો ન દોષો, કલંકો જ કલંકોના ખાન રૂપ છે, તે પ્રમાણે  
આ યુગમાં એક વિશાળ ગુણ પણ છૂપાયેલો છે તે એ છે કે આ  
ચુગમાં માત્ર “કૃષ્ણ કીર્તન” થી જ મનુષ્ય નિઃશંક રૂપેણ

\* અષ્ટાદશોડ્યાયઃ \*

શકે છે. એવી ધર્મત્તમાઓ એવં પુણ્યવાન અહો ભાગ્યવાન આત્માઓની તો વાત જ શું કરવી, જેના હૃદય રૂપી નિર્મલ ધામમાં અક્ષરાતીત શ્રી કૃષ્ણા સ્વયં વિરાજમાન છે, જે મન હી મન (મનમનમાં) સંગ બેસતી, ખેલતી અને ધૂમે છે અહો ! તેને તો માનો ચૌદ લોકોને પણ પરાસ્ત કરી દીધાં. ધન્ય - ધન્ય છે તે કુળ પણ જેનો સારો વંશ જ એવી ધર્મત્તમાના મુખ દ્વારા ઉચ્ચારિત અક્ષરાતીત શ્રી કૃષ્ણા નામથી કૃતકૃત્ય થઈ ગયું.

ઉત્તમાતિઉત્તમ પરમપદ પ્રાપ્ત કરી શકે છે.

૨. માતા મહાનં શતકं પિતૃણાશચ સહસ કમ् ।

પુંસામેન સમુદ્રધૃત્ય પરમધામં સ ચ ગરછાતિ ॥

અર્થ :- જે - જે કુળમાં એક એવો સાચો ભક્ત પ્રગટ થાય છે. જેના મન-મંદિરમાં અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા વિરાજમાન થઈને તેની સાથે ખેલે, ધૂમે તથા રહે છે. એવા ભક્તિમાન ભક્તો પોતાની માતાના પક્ષની સો પેઢીઓને અને પિતાના પક્ષની હજાર પેઢીઓને નરકમાં રોવું, બિલખવું, જલવું-બળવું તેમ જ તડપવું જેવી ભયંકર અવસ્થાઓથી ઉગારી (ઉભારી) ને તેનો ઉદ્ધાર કરીને તેને મૃત્યુલોકની પણ કર્મભૂમિમાં મુખ્ય ભારત વર્ષના શુલ્ક કર્મામાં પ્રવૃત્ત કરાવી પોતાના પરમધામમાં પહોંચી જાય છે.



~~~~~

नौधः-

यशवंती कहे मारा श्रङ्गा सुमन साथજु !

तभो धेर बेठा बेठा, आ भनन करजो रे ।

भनन कटी प्रेम धरी, जल्दी परमधाम आवजो रे ॥


यशवंती कहे मारा धामस्थ साथજु....

- मराठा



~~~~~

આહવાન



નિસદિન રંગ મોહોળન મેં, સાથ શ્યામાજુ શ્યામ ।  
યાદ કરો સુખ સબોં અંગો, જો કરતે આઠો જામ ॥  
- (પરિક્રમા, પ્ર. જ / ચો. પ).

અર્થ- હે મારા ધામસ્થ સુમન સુન્દરસાથજુ !

અમે બધા અક્ષરાતીત બ્રહ્મધામ શ્રી રંગમહલમાં  
રાત-દિવસ શ્રી શ્યામશ્યામાજુની સાથે કેવી રીતે રહેતા હતા ?  
પોત-પોતાના અંગ-પ્રત્યંગથી તે સુખોને યાદ કરો, જેને અમે  
આઠેય પ્રહર- ૨૪ કલાકની લીલાઓ દ્વારા નિરંતર પ્રાપ્ત કર્યા  
કરતી હતી ! આટલું તો કરો !!

- ગ્રાણામ

# આર્ટ પુકાર

હે રાજ - હે કૃષ્ણ ! હે ધની - હે પિયા !! હે દુલાહા !!!

દુલાહા લીજે કંઠ લગાય -

હે પ્રાણનાથ.....

તુમ દુલાહા મૈં દુલાહિન , ઓર ન જાનું બાત ।  
ઈશ્ક સૌ સેવા કરું , સબ અંગો સાક્ષાત् ॥

- પ્રશાંત -

